

THE FREE INDOLOGICAL COLLECTION

WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC

FAIR USE DECLARATION

This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.

Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.

If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.

-The TFIC Team.

जैन धर्म प्रवेश पोथी.

भाग ३ नं.

— — — — —

छपावी प्रसिद्ध करनार,

श्री जैन धर्म विद्या प्रसारक वर्ग,

पालीताणा.

द्वितीयावत्ति. प्रत २०००.

संवत् १५६३.

सन् १९०७.

श्री जैन प्रिनिंग प्रेस—अम्हावाढ़.

किंमत रु. ०-४-०.

કર્તાએ સર્વ હજે સ્વાધીન
રાજ્યા છે.

ऋषणपत्रिका

हेवेंद्र भूज्य चरम तीर्थकर श्री

महावीर परमात्मा.

જे मना નામતું સ્વરણ પણ મહા સંપદાને વિ-
સ્તારે છે, જે મની વાણી આ લવાભિધમાં ડુખકાં
ખાતાં લભ્ય પ્રાણીઓને નોકા સમાન છે, જે મતું પ-
વિત્ર અરિત્ર દ્રષ્ટિગોચર થતાં વીતરાગપણું સિદ્ધ કરા-
વે છે, જે મની સેવા કલ્પલતા સમાન છે, તેથી ચોગ-
શ્વરો પણ તેને સહા ચાહે છે, જે મતું હર્ષિત થતાં
તિર્યચી પણ સ્વાભાવિક વૈરલાવને તળ હે છે, ઉપ-
દ્રવ કરનારાં પ્રાણીઓએ પર પણ જે એ દ્વારા ભાવે રહે
છે, જે મના યુણુજ્ઞાનરૂપી અમૃત અમર પદ્ધી આપે છે,
રાગ દોષાચિથી સંતપ્ત થાયેદાં પ્રાણીઓને શાંત ક-
રવામાં જે એ પુષ્કરાવર્ત મેઘ સમાન છે, અને સ્વયંભૂ-
રમણ સસુદ્રની સાથે કરુણારૂપી જળથી સ્પર્ધા કરવા
વાળા, એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને
તે મના ચરણાભુજમાં આ લધુ હુસ્તક સમર્પણ
કરીએ છીએ.

પ્રસિદ્ધ કરીએ.

પ્રસ્તાવના:



શ્રી જૈન ધર્મ પ્રવેશ પોથીના એ ભાગ અમારા તરફથી પ્રસિદ્ધ થયા છે. તેનો આ ક્રીંલે ભાગ છે પ્રથમના એ ભાગોમાં કે જ્ઞાન આપવામાં આંદોલન હોય છે તેના કરતાં વધારે ચંદ્રિકાતા વિષયો આ ભાગમાં લેવામાં આંદોલન હોય; તેમજ પાછળના ભાગોમાં આવેલા વિષયોને પુનરાવર્તન હોય લઈ તેનો કંઠ વધારે વિસ્તાર હોયો છે.

શ્રી જૈન ધર્મ ઝૂપી વિશાળ જ્ઞાનસાગરમાં પ્રવેશ કરવાને સુગમ પડે એવો મૂળ ઉદ્દેશ છો પુસ્તકોનો છે અને તે માટે પુસ્તકને ડિયા, ધર્મ, નીતિ અને તત્ત્વ એ આર વિભાગોથાં વહેંચેલું છે. બાળકોની શક્તિ અનુસાર પત્યેક ભાગોનું જ્ઞાન થવાને માટે સંખ્યા પાડોની ચોજના કરેલી છે. ધર્મ તત્ત્વ સંખ્યા જ્ઞાન બાળકોને આપવું રહેલું નથી, અને તે માત્ર તત્ત્વજ્ઞાન, કે ડિયા વિગેરની વાતજ બાળકોને કહેવામાં આવે તો તેમનાથી તે સમજય નહિ એ. વારતવિક છે, માટે અનતાં સુધી સર્વ વિષયોને વ્યાવહારિક દૃષ્ટાંતોમાં ઉતાર્યાં છે; અને બાળકોને ઇચ્છિકર તથા પ્રિય થઈ પડે એવી ચોજના કરેલી છે.

આ પુસ્તકમાં શ્રાવક વર્ગમાં ગંધી સંખ્યાધી કે લેહ તે લક્ષ્યમાં નહિ લેતાં માત્ર સર્વ શ્રાવક વર્ગને સામાન્ય રીતે ઉપયોગી થાય તેવી રીતે દર્શાન, પૂજા, સામાયક, પ્રતિક્રિયા, વિગેરની આવશ્યકતા તથા તેનું ક્રણ એ પાઠો આપ્યા છે. પ્રતિક્રિયાદિ આવશ્યક પત્યેક ગંધીના શ્રાવકો પોતાપોતાના રવતાંત્ર શિષ્યો તોજ હીક થાય એવી અમારી માન્યતા છે, કારણ કે ગંધીના સર્વ એવા લેહો લક્ષ્યમાં લઈ સર્વને ડિયાયી થાય એવી એ વિષયુની સામાન્ય

રીતિની ચોજના કરવી એ અશક્ય જે હું છે, તેથીજ અમે અમારી જૈન પાઠીઓમાં સર્વ શ્રાવકોને સામાન્ય ધર્મબોધ થાય એવી ચોજના કરેલી છે.

આ પુસ્તકમાં વિષયને લગતાં રમ્ભળ ચિન્હો આપી તેને મ-
નોરંજક ણનાવવાનો અમારો વિચાર હતો, પણ આ દ્વિતિયા
વૃત્તિમાં પણ તેમ કરવા ણની શક્યું નથી. તો પણ અમે એ વि-
ષય મહત્વનો ગણ્ણીએ છીએ, તેટલા માટે અમો ત્રીજી આવૃત્તિમાં
ચિન્હો આપવાનો અમારો વિચાર પાર પાડીશું એવી આશા છે.

આ પુસ્તક તૈયાર થયા પછી સુનિમહારાજ શ્રી ૧૦૦૮ ચા-
સ્ત્રિવિજયજી પાસે શુદ્ધ કરાયું છે, તેઓ શ્રીએ જે સ્થળે
જૈન ધર્મ વિરુદ્ધ શાખા કે વાક્યો જણાયાં તે સુધારી આપ્યાં
છે, સિવાય ખાળકોને આ પુસ્તક વધારે ઉપયોગી કેમ થાય તે
માટે ઘણી સફાય આપેલી છે. તેથી આ પ્રસંગે અમો ઉક્ત
સુનિ મહારાજનો ઉપકાર માનીએ છીએ.

વળી આ પુસ્તકની લાખા ખાળકોને અનુષ્ઠળ અને રૂચિકર
થાય તે માટે અત્રેની ગુજરાતી તાલુકા સ્કુલના હેડમાસ્ટર શા.
થાંપશીલાઈ ગુલાખચંદ તેઓએ પુસ્તક તપાસી ચોણ સુચના
આપી છે તેથી અમો તેમનો આ સ્થળે ઉપકાર માનીએ છીએ.

આ પુસ્તકની પ્રથમાવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં સ્વર્ગસ્થ
શોઠ લાલજી દેવણુંધના સમરણાર્થે તેમના વિધવા સોનખાઈએ
(સ. ૨૫૦) ની મદદ આપેલી છે, તેથી આ પ્રસંગે અમો તે-
મનો આલાર માનીએ છીએ. તથા અન્ય શ્રાવક શ્રાવિકાઓને
પણ ઉક્ત ખાઈનો હાખલો લઈ આવા ધર્મકાર્યને સહાય આ-
પવા માટે નિવેદન કરીએ છીએ.

પ્રસિદ્ધ કર્તા.

અનુક્રમણિકા.

વિષય.

						પૃષ્ઠ.
શ્રાવકના ફિનકૃત્ય વિષે કવિતા.	૧
દર્શન.	૩
પૂજન.	૫
સામાચિક.	૮
પ્રતિક્રમણ.	૧૦
શ્રાવકના સંસાર સુધારા વિષે કવિતા.	૧૨
ન્યાયથી પૈસો કમાવવો.	૧૩
વિવાહ.	૧૬
સહાચાર.	૧૮
ઇ શરૂઆતો	૨૧
દુદ્રિયોનો જય	૨૩
સારા ગામમાં વ.સ કરવો.	૨૬
શ્રાવકનું ધર.	૨૭
પાપની ઝીક.	૩૦
યોતાના ધર્મને હાની ન પહોંચો, તેવો દેશાચાર પાળવો.	૩૨
કોઈની નિંદા કરવી નહીં.	૩૪
શ્રાવક પ્રમાણે ખર્ચ રાખવું.	૩૫
પહેરવેષ	૩૭
ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે કવિતા	૪૦
માખાપની સેવા.	૪૧
કહર જણુવી.	૪૩
અલ્લણ્ણ ડોયા તો જમવું નહિ.	૪૬
વખતસર જમવું.	૪૮
દુષ્ટની સેવા:	૬૬૬	૬૬૬	૬૬૬	૬૬૬	૬૬૬	૫૦

નિંદવા ચૈણ્ય કામ કરવાં નહિ.	૫૩
ભરણુ પોષણુ.	૫૪
વિચારને કામ કરવું.	૫૭
ધર્મ સાંલળજો.	૫૮
દ્વા પાણવી.	૬૧
ખુદ્દિના શુષ્ણુનો ઉપયોગ.	૬૩
શુષ્ણુ ઊપર પક્ષપાત કરવો....	૬૫
ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે કવિતા	૬૭
હુરાથડ રાખવો નહિ.	૬૮
દિવસે દિવસે વધારે જ્ઞાન મેળવલું.	૭૧
અતિથિને આહર.	૭૩
ધર્મ; અર્થ અને કામ બચાવની નિયમિત સેવવાં લાગ ૧ લો.	લાગ ૧ લો.	૭૫	
" "	...	લાગ ૨ લો.	૭૭		
દેશકાળ અમાણુ વતલું લાગ ૧ લો.	૮૦	
" "	લાગ ૨ લો,	૮૨	
લોક વિરૂદ્ધ કામ કરલું નહિ...	૮૪	
પરોપકાર.	૮૭
લાગ રાખવી.	૮૯
કુર દેખાવ ન રાખવો.	૯૨
શહુસ્થ શ્રાવકના સાર, ય ધર્મ વિષે કવિતા.	૯૪	
મનની મોટાઈ	૯૫
સંપ વિષે કવિતા	૯૮
દીશ પારાની માળા...	૯૯
વિનય.	૧૦૧
આલાર.	૧૦૩
શ્રાવક ડેવો છોય તે વિષે કવિતા.	૧૦૬
નડારા શ્રાવક વિષે કવિતા.	૧૦૬
દ્વાખ,	૧૦૭



શ્રી જૈન ધર્મ પ્રવેશ પોથી

ભાગ ૩

ખંડ ૧ લો

જૈન કિયા માર્ગ.

પાઠ ૧ લેટ.

શ્રાવકના દિનકૃત્ય વિષે કવિતા.

હૃદિગીત.

જાગે પ્રથમ લઈ ૧અદ્વિતીય નિદ્રા ધર્મ કેરી ચીતમાં,
હું ડાણુ ને કયારે સુતો ઓછું વિચારે ૨ચિતમાં;
શાખા વિષે સાંભારતા નવકારને મનમાં ધણું,
સાધભિંબ બંધુ સાંભળો દિનકૃત્ય તે શ્રાવક તાણું. ૧
કેરી ધર્મ ૩નગરણું સુણે પ્રતિકમણુને પછી આચરે,
પછી ચૈએ પનિયમો ધારવા પચખાણુ ગ્રીતે આદરે;

૧ યોડી નિદ્રા. ૨ મનમાં. ૩ પથારી વિષે. ૪ હું ડાણુ, મારી જતિ,
જ, દેવ, શુરૂ અને મારો ધર્મ ડાણુ ધત્તાદિ વિચાર કરવો તે ધર્મ નગ-
ણું કહેવાય છે. ૫ ચૈએ જાતન નિયમ ધારવા.

કરિ ઢેહુ १ચિંતા શુદ્ધ થઈ પછી કામ કૈ હાતખુતણું,
સાધર્મિં અંધુ સાંલળો દિનકૃત્ય તે શ્રાવક તણું. २

સારા २સમારી કેશને ન્હાવણું કરે નિર્મણ જળે,
સુંદર લલાટે તિલક કરતાં દેવપૂજામાં વળે;
ગુરુ વંદનાને આચરે નવ દોષ આવે ત્યાં આણું,
સાધર્મિં અંધુ સાંલળો દિનકૃત્ય તે શ્રાવક તણું. ३

૩સ્વાધ્યાય સામાચિક કરી ૪નિર્દોષ લોજનને કરે,
શ્રી દેવગુરુને શાનની આશાતના સૈંચા ૫પરિહંસે;
ધન દેવનું સાંલળવા રાખે નહિ કાયરપણું.
સાધર્મિં અંધુ સાંલળો દિનકૃત્ય તે શ્રાવક તણું. ૪

નીતિથકી ઉઘોગ કરિ ૬નિર્વાહુ ધરનો આચરે,
૭સાધર્મિને સાધુ અતિથી સર્વનો આહર કરે;
સૌ સાથ ૮ઉચ્ચિતાચારથી ચાલી વધારે ૯યશ ધણું,
સાધર્મિં અંધુ સાંલળો દિનકૃત્ય તે શ્રાવક તણું. ૫

સાંજે ૧૦પરિષ્ક્રમણું કરી અવસર વિચારે આપથી,
થઈ શુદ્ધ શર્યામાં સુદે જાગે નહિ ૧૧પરિતાપથી;
આંદું કરી દિનકૃત્ય શ્રાવક પુણ્ય ખાંધે ચોગણું,
સાધર્મિં અંધુ સાંલળો દિનકૃત્ય તે શ્રાવક તણું. ૬



૧ અડે જરું. ૨ સુધારી. ૩ સજાય. ૪ દોષ વગરનું. ૫ છોડી હે.
૬ આળવિકા. ૭ સરખા ધર્મસાગા ભાઈશોને. ૮ સર્વતી સાથે ચોગણ
આચારથી ચાલીને. ૯ કીર્તિ. ૧૦ ચિંતાથી.

પાઠ ૨ નો.

દર્શાન.

મોહન કરીને એક આવકનો છોકરે હતો, તે હમેશાં દેરાસુરમાં દર્શાન કરવા જતો હતો, તે એકદમ દર્શાન કરીને પાછો આવતો હતો, એક વખતે વિદુલ કરીને એક બીજે છોકરે તેને સામે ભાગ્યો, તે વિદુલ, મોહનનો મિત્ર હતો, વિદુલને મોહને પુછ્યું, વિદુલ ! તું કયાં જાય છે ? વિદુલે કહ્યું, હું દેહેરે દર્શાન કરવાને જાઓ છું, મોહન બોલ્યો, જા, જલદી દર્શાન કરી આવ, પછી આપણું સાથે બાહેર કરવા જઇએ. તારી રાહ જોઈને હું અહિં જાલો છું, વિદુલે કહ્યું, મોહન ! દર્શાન કરતાં મને વાર લાગશે, માટે જો તારાથી તેટલી વાર સુધી રાહ જોઈ શકાય તેમ હોતો, જાલો રહે, નહિતો તું એકદો કરવા જા, હું પછીથી તને મળીશ. મોહન બોલ્યો, લાઈ વિદુલ ! દર્શાન કરવામાં શી વાર લાગે ? એ તો એ ત્રણું મીનીટનું કામ છે. હું એ કે ત્રણું મીનીટમાં દર્શાનનું કામ પતાવી હતો છું, વિદુલ હસીને બોલ્યો, મોહન ! આ ઉપરથી મને લાગે છે કે, તું દર્શાન કરી જણુંતો નથી, મોહને કહ્યું, વિદુલ ! દર્શાનમાં વળી શું કરવાનું છે ?, પહેલાં મોટા લગવાનની સામે એ હાથ જોડી દર્શાન કરવાં, અને પછી અહાર ઉલા રહી બીજુ પ્રતિમા જીને છેટથી હાથ જોડી પતાવી દેવું, એમાં વાર શાની લાગે ? વિદુલ બોલ્યો, લાઈ મોહન, આ તારી મોટી લુલ થાય છે. લગવાનનાં દર્શાન કેવી રીતે કરવાં જોઈએ, એ વાત દરેક શ્રાવકે જાણુંની જોઈએ. મોહન બોલ્યો; લાઈ વિદુલ ! હું તો એટલું જ જાણું છું; બીજુ કાંઈ મને ખખર નથી, કેવી રીતે દર્શાન કરવાં

લેધાયે, તે મને અરાખર સમજાવ. વિહુલ યોવ્યો, મોહન ! પહેલાં જ્યારે દર્શન કરવાની ધારણાથી ઘરની અહાર નીકળીયે, ત્યારે મનમાં સારી ભાવના ભાવવી, અને ધ્યાણી હેંશ લાવવી. જ્યારે દેરાસરની ધળ કે આર જેવામાં આવે, ત્યારે આપણું મનના સારા પરિણામ કરવા, દેરાસરમાં પેસતી વખતે આપણું પાસે કોઈ જતની સચિત્ત વસ્તુ છે કે નહિ, તેની તપાસ કરવી. તે વખતે આપણું મોઢામાં પાન સોપારી કે કાંઈ પણ રાખલું નહિ પણ પ્રલુની સામે ઉલા રહી એ હાથ મસ્તક ઉપર જેડી તેમને વંદના કરવી. વંદના કર્યા પછી પ્રલુનાં સ્તવન ગાવાં, અને મનમાં મેમ લાવીને પ્રલુલુનું ખંખ ધ્યાણી વાર સુધી નીરખલું. પછી ત્રણ પ્રદક્ષિણા કરી ખીજુ જિનપ્રતિમાળનાં ભાવથી દર્શન કરવાં. દર્શન કરતી વખતે ઘરના, પાઠશાળાના કે કોઈ રમત ગમતનાવિ. ચારે મનમાં લાવવા નહિ. લાઇ મોહન ! આવી રીતે દર્શન કરવાથી આપણું ને દર્શનનો પૂરો લાલ મળે છે. ઉતાવળથી વેઠ કાઢવાની મેમ દર્શન કરવાથી કાંઈ પણ લાલ મળતો નથી.

મોહન યોવ્યો—લાઇ વિહુલ ! હવે હું તારું કહેલું અરાખર સમજુ ગયો. મને તો આવી કાંઈ ખણરજ ન હતી. આજ સુધી હું ઉતાવળથીજ દર્શનતું કામ પતાવી હેતો હતો. લાઇ વિહુલ ! તે મને આવી સારી સૂચના આપી, તેને માટે હું તારો ઉપકાર માણું છું. ચાલ, તારી સાચે ઝરીથી દર્શન કરવા આવું. પછી મોહન વિહુલ સાચે ઝરી વાર દેરાસરમાં દર્શન કરવા આવ્યો, અને વિહુલ પાસેથી દર્શન કરવાની બધી રીત તેણે નજરે જોઈ લીધી, પછી તે હુમેશાં વિધિ પ્રમાણે દર્શન કરવા લાગ્યો.

સારથોધ.

વિદુલની જેમ દરેક આવકના છેકરાએ દેરાસરમાં જઈને
દર્શન કરવાં જોઇએ, મોહુનની જેમ ઉતાવળથી જેમ તેમ દર્શન
કરવાં ન જોઇએ.



સારાંશ પ્રશ્નો.

- ૧ મોહુન ડેવી રીતે દર્શન કરતો હુતો ?
- ૨ વિદુલે તેને દર્શન કરવાને માટે શું કહ્યું હતું ?
- ૩ દર્શન ડેવી રીતે કરવાં જોઇએ ?
- ૪ મોહુન આખરે ડેવી રીતે દર્શન કરવા લાગ્યો ?



પાઠ તુ જો.



પુજન.

ગુલાખચંદ, અને વાડિલાલ નામે એ ભિન્નો હતા. તે ખંને
સાથે અદ્યાસ કરતા, અને સાથેજ કરતા હતા. ગુલાખચંદ ચા-
લાક અને નિયમ પ્રમાણે વર્તનારો હુતો, અને વાડિલાલ ખુદ્દિમાં
ચાલાક, પણ આણસુ હુતો.

એક વખતે વાડિલાલ, ગુલાખચંદને પાઠશાળામાં જવાને
તેડવા આવ્યો, તે વખતે ગુલાખચંદ દેહદેશી વેર આવતો હુતો.

વાડિલાલ—ગુલાખચંદ ! કેમ હજુ તૈયાર થયો નથી ?
પાઠશાળામાં કયારે જરું છે ?

ગુલાખચંદ—વાડિલાલ ! હજુ પાઠશાળાનો વખત બચ્યો,
નથી, મારે હજુ જરું છે.

વાડિલાલ—તું હમેશાં મોહું કરે છે, પહેલેથી જઈને આપણે ત્યાં ઘડી વાર રમીશું, પછી વખત થશે, એટલે પાઠશાળામાં જઈશું.

ગુલાખચંદ—લાઇ વાડિલાલ ! વહેલા જઈને ત્યાં રમવું, એ મને પસંદ નથી. પાઠશાળા ઓધડયા પહેલાં આપણે ત્યાં શામાટે જવું જોઈએ ? આપણે વહેલા તૈયાર થઈએ તો વેર વાંચવું, અને જ્યારે વખત થાય, ત્યારે પાઠશાળામાં જવું જોઈએ.

વાડિલાલ—તું હમેશાં અરાખર પાઠશાળાના વખત પ્રમાણે આવે છે, તે મને તો ખસંદ નથી. વળી તું અત્યાર સુધી જમ્યો નથી. એ પણ કેવી વાત કહેવાય ?

ગુલાખચંદ—વાડિલાલ ! તું હમેશાં વહેલો શી જીતે તૈયાર થાય છે ? સવારે શું શું કામ કરે છે ? તે કહે.

વાડિલાલ—સવારે જીડી શરીરની અધી કિયા કરી પછી ગ્રાહીવાર વાંચીને તરત જમવા એસું છું.

ગુલાખચંદ—વાડિલાલ ! તું દેહને પૂજ કરવા જાય છે કે નહિ ?

વાડિલાલ—લાઇ ગુલાખચંદ ! મને પૂજ કરવાનો વખત ભળતો નથી, તેથી જઈ શકતો નથી. કોઈ કોઈ વાર રજુને દિવિસે જળો છું.

ગુલાખચંદ—ત્યારે તારા કપણમાં રોજ ચાંદલો તો હું જોઉં છું.

વાડિલાલ—હા, એ ચાંદલો તો હું વેર કર્દાંછું. વળી કોઈ વાર પૂજ કરવા ગયો હોઉં, તો ત્યાં કરેલો ચાંદલો એ ત્રણ દિવિસ સુધી પણ લુંસાઈ જવા દેતો નથી,

ગુલાખચંદ—લાઇ વાડિલાલ ! આતો ધાણી દિલગીરીની વાત કહેવાય. તું શાવકનો છોકરો થઈ દેહને પૂજ કરવા જાય નહીં, અને કોઈ વાર પૂજ કરી હોય, તેનો વાસ્ત્વ ચાંદલો એ ત્રણ દિવિસ સુધી રાખી સુકે, એ કેવી નહારો વાત કહેવાય ? આજ દિવિસ

સુધી મને આ વાતની અખર નહોંતી. દેહેરે પૂજા નિહિ કરનારો, ઘેર ચાંદ્યો કરી કરનારો, અથવા એ ત્રણુ દિવસ સુધી વાસી ચાંદ્યો રાખનારો, તારા કેવો શ્રાવકનો છોકરો મારો મિત્ર કહેવાય, એ મને પણ શરમ લાગવા જેલું છે.

લાઈ વાડિલાલ ! હુવેથી તું હુમેશાં દેહેરે પૂજા કરવા જને. તું કહેછે કે, મને વખત મળતો નથી, તે પણ તારું જોઈએ બહારું છે. રોજ પાઠશાળાનો વખત થયા પહેલાં તું મને બહેલો તે. ડવાને આવે છે, તો દેહેરે પૂજા કરવામાં શામાટે વખત ન મળે ? તું જણે છે કે, આપણા વિદ્યા ગુરુ દેહેરે પૂજા કરવાની હુમેશાં ભલાભણુ કરે છે. ને તું હુવેથી દેહેરે પૂજા કરવા નહીં જાય તો, હું તારી મિત્રતા છોડી જઈશ. જેઓ શ્રાવકના છોકરા થઈ દેહેરે પૂજા કરવા જતા નથી, તેઓ નહારા છોકરા કહેવાય છે, અને નહારા છોકરાની સોખત કરવી ન જેઇશે, એ વાત આપણે શીખ્યા છીએ.

વાડિલાલ—લાઈ શુલાભચંહ ! મને માઝ કરજે, હુવેથી તું હુમેશાં દેહેરે પૂજા કરવા જઈશ, અને પાઠશાળાના વખતોનું તને તેડવા આવીશ. પછી વાડિલાલ હુમેશાં શુલાભચંહની સાથે દેહેરે પૂજા કરવા જવા લાગ્યો, અને પૂજા કરવાના પ્રલાભથી તેના મનના પરિણામ સારા થઈ ગયા.

સારબોધ.

દરેક શ્રાવકના છોકરાએ શુલાભચંહની જેમ હુમેશાં દેહેરે પૂજા કરવા જલું જેઇશ. વાડિલાલની જેમ ન કરું જેઇશ, તેમજ જેઓ પૂજા કરતા ન હોય, તેની સોખત પણ ન કરવી જેઇશ.

સારંશ પ્રશ્નો.


૧ શુલાભચંહ કેવો છોકરો હતો ?

૨ વાડિલાલ કેવો છોકરો હતો ?

૩ શુલાભચંહે વાડીલાલને પૂજને માટે શું પુછયું હતું ?

૪ શુલાભચંહે વાડિલાલને કેવી શીખામણ આપી હતી ?

૫ છેવટે વાડીલાલે શી કણુલાત આપી હતી ?



પાઠ ૪ થો.

સામાયિક.

માધવ અને મનસુખ કરીને એ આવકના છોકરા હતા. માધવ હુમેશાં ધર્મ ઉપર પ્રીતિવાળો, અને ધર્મને માર્ગ ચાલનારો હતો. મનસુખ ધર્મ ઉપર પ્રીતિવાળો અને ધર્મની વાતો કરનારો હતો. પણ તે પ્રમાણે વર્તનારો નહતો. આ બંને મિત્રો પાડાશમાં રહેતા હતા. અને સાથેજ અલ્યાસ કરતા હતા. મનસુખ ક્રીક્ષત ધર્મની વાતો કરનારો છે, પણ ધર્મની કિયા કરનારો નથી, એ વાત માધવના જાણુવામાં ન હતી. તે તો મનસુખને ધર્માંબદ્ધ ધર્મ અને ધર્મ પ્રમાણે વર્તનારો જાણુતો હતો.

એક વખતે સવારમાં માધવ, મનસુખને ઘેર આંદો. મનસુખ તે વખતે પોતાના લાઇઓની સાથે સોગઠાંબાળ રમતો હતો. તે નેઈ માધવે પુછયું; લાઇ મનસુખ ! આજે અત્યારે આ કયાંથી સુઅધું ? તમે બધાને તો એમ કણો છો કે, સવારમાં તો સામાયિક કરવું લેઈન્નો, અને તે પછી પોતાનો અલ્યાસ કરવો લેઈન્નો. વળી

तमे जुगारनी रभतो रभवानी पणु ना कहें छे, अने आ तमे चोते रभो छे, ते पणु संवारना वर्खतमां रभो छे, ए केवी वात कहेवाय? माधवनां आवां वचन सांकणी मनसुख आंगें यडी गये। थोडीवार विचारीने मनसुख ओल्यो,—माधव! ताहुं कहेलुं भराभर छे, मारा मनमां सवारे सामायिक विगेरे करवानी धुच्छा रह्या करे छे, पणु कोई कर्मयोगे माराथी अनी शक्तुं नथी, जे वातनी हुं थीजने ना कहुं छुं, ते वात माराथी अनी जय छे।

माधव ओल्यो—लाई मनसुख! कहि थीलु धर्मनी किया ताराथी न बने तो चाल्यु, पणु सामायिक तो हरेक श्रावके अवश्य करवुं जेइए, सामायिक करवाथी केटला लाल थाय छे? ए वात तुं चोते पणु जाणु छे, एटले ते विषे तारो आगण कहेवानी कांइ ज़र नथी, कारणु के सामायिक करवानो उपदेश भने तेंज आयें हुतो।

मनसुख—लाई माधव! आजे तारो भोटो आलार मानुंछुं, तारा आववाथी भने मारी खामीतुं लान् थयुं छे, हवे हुं कहिप-णु आवो हुराचार सेवीश नहीं। माधव! आ तारा हुर्शुणी भित्र मनसुखने हुजारवार धिक्कार छे, जे भाषुस थीजने ओध आपे छे, अने थीजने सारे भार्ग चालवानी लतामणु करेछे, छतां ते चोते अवणे भार्ग चाले, तो तेने धर्षाऊं पापी भाषुस समज्वे, भित्र माधव! आ तारा पापी भित्रनुं भोहुं तारे जेवा लायक नथी।

अभ कही मनसुखे सोगठांबालु हुर ईंडी दीधी, अने तरत भाधवने साथे लाई उपाश्रये युरू पासे गये। त्यां शुरूनी सामे हाथ लेडी सामायिक करवाना तथा जे प्रभाषु थीजने कहेलुं, ते प्रभाषु चोते वर्तवानां पर्चयभाषु लीधां, त्यारथी मनसुख हुमेशां सामायिक करवा लाग्यो।

સારબ્બોધ.

દુરેક શાખાની જેમ હુમેશાં ધર્મમાં વર્તવું જોઈએ
અને બીજાને જેવો બોધ આપવો, તે પ્રમાણે પોતે પણ ચાલવું
જોઈએ; તેમ નહીં કરવાથી મનસુખની જેમ પરતાવો થાય છે.



સારાંશ પ્રશ્નો.

- ૧ માધવ કેવો છાકડો હતો ?
- ૨ મનસુખ કેવો છાકડો હતો ?
- ૩ મનસુખને માધવે શું કહું હતું ?
- ૪ સામાચિક કરવાને વખતે મનસુખ શું કરતો હતો ?
- ૫ માધવના કહેવાથી મનસુખે શું કહું હતું ?
- ૬ છેવટે મનસુખે શેનાં પરચખખાણ લીધાં હતાં ?



પાઠ ૫ મો.

પ્રતિક્રિમણુ.

હેવપુરીમાં હ્યાધર કરીને એક શાખકનો છાકડો હતો. તે એક
વખતે ઉપાશ્મારામાં સુનિના સુખતું વ્યાખ્યાન સાંભળવા ગયો. ત્યાં
તેણું એવું સાંભળ્યું કે “ સંસારી જીવ રાત અને દ્વિવસ પાપ
કર્યા કરે છે. ” આ વચ્ચને સાંભળતાંજ તેના મનમાં ચિંતા થવા
લાગી. હ્યાધર ધર્મ ઉપર ધાર્ણા આનિતક છાકડો હતો, તેથી તેના
મનમાં ઉચ્ચાટ થવા લાગ્યા કે, હવે મારે શું કરવું ? હું પણ
સંસારી છું, તો મારાથી પણ હુમેશાં પાપ થતું હશે. જ્યારે
રોજને રોજ પાપ વધતાં જશે, તો પછી મારે નરકમાં પડવું પ-

જો. તે નરકની પીડા ભારાથી શી રીતે લોગવી શકાશે ? આવી ચિંતા કરતો. તે ઘેર આવ્યો. તેના ખાપનું નામ પ્રેમધર હતું. તે કેન્દ્રમંદિસાં ધણો પ્રવીણુ હતો. પ્રેમધરે : હું, દીકરા ! જમવાનો વખત થયો છે, માટે જમી લે. દ્વાધર બોલ્યો, ખાપા ! આજે મને જમવાની રૂચિ નથી, મારો જીવ ગલસરાય છે. પ્રેમધર બોલ્યો, એટા ! તને શું થયું છે ? શું તારા પેટમાં કાંઈ રોગ થયો છે ? દ્વાધરે કહું, ખાપા ! મને કાંઈ થયું નથી. ફૂકત મને એક મોટી ચિંતા થઇ પડી છે. પ્રેમધર બોલ્યો, એટા ! તારા જેવા ખાળકને ચિંતા શી હોય ? શું છે ? તે કહે. પછી દ્વાધરે પોતાને ચિંતા થવાની અધી વાત પહેલેથી કહી સંભળવી. તે સંભળી પ્રેમધર બોલ્યો, એટા ! તેવી ચિંતા શામાટે રાખે છે ? પાપ હૂર કરવાનો એક સે-હેઠો ઉપાય છે. અને તે ઉપાય પણ તારી પાસેજ છે. દ્વાધર બોલ્યો, ખાપા ! તે કયો ઉપાય તે મને જલદી કહેણ. પ્રે-મધરે કહું, એટા ! આવકના દીકરાએ હમેશાં એ વાર પ્રતિકુમણુ કરવું, તેથી તને કોઈ જતનાં પાપ વધતાં નથી. દિવસે કરેલાં પાપ રાત્રિના પ્રતિકુમણુથી આલોવાય છે, અને રાત્રે કરેલાં પાપ દિવસના પ્રતિકુમણુથી આલોવાય છે. દેથી જે શ્રાવક હમેશાં પ્રતિકુમણુ કરવાનો નિયમ રાખે તો, તને પાપની આવક વધી શકતી નથી, વળી હમેશાં પ્રતિકુમણુ કરવાથી મન નિર્મણ થાય છે, અને મન નિર્મણ થવાથી તેમાં પાપ કરવાના નકારા વિચારે આ-વતા નથી. એથી પાપ થવાનાં કારણો બંધ થઇ જય છે. એટા, દ્વાધર ! તું ખાપની ચિંતા કરીશ નહિ. તું એ પ્રતિકુમણુ શીખ્યો છું, માટે હમેશાં સવારે અને સાંજે પ્રતિકુમણુ કર્યા કરજે. એટલે તારામાં કહિ પણ પાપ ચેશી શકશે નહિ. પ્રેમધરનાં આવી વચ્ચન

सांलणी દ્વારા ખુશી થઈ ગયો, અને તેણે પોતાના પિતાનો આસાર માની જણ્ણાંથું ડે, આપા ! હવેથી હું હમેશાં એવાર પ્રતિકુમણું કરીશ, અને યાપની આવકને બાંધ કરીશ.

ત્યારથી દ્વારા હુમેશાં એ વખત પ્રતિકુમણું કરવા લાગ્યો, અને તે મોટી ઉમરે એક શુદ્ધ આવક તરીકે પ્રખ્યાત થયો.



સારાધ્યાધ.

દ્વારાધરની જેમ દરેક આવકના છોકરાચો યાપનો ડર રહ્યો નેથીએ, અને એ વાર પ્રતિકુમણું કરીને યાપની આવક બાંધ કરવી નેથીએ.



સારાંશ પ્રશ્નો.

૧. દ્વારાધર ડેવો છોકરે હતો ?

૨. તેસે શેની ચિંતા થઈ હતી ?

૩. પ્રેમધરે તેને શું કહ્યું હતું ?

૪. પ્રેમધરના કહેવાથી દ્વારાધરે શું કહ્યું હતું ?

૫. એ વાર પ્રતિકુમણું કરવાથી દ્વારાધર ડેવો થયો હતો ?



પાઠ ક હું.

આવકના સંસારને સુધારવા વિષે.

શિખરિષ્ણી.

સદા સંપે ચાલો શુલ શુણુ વધારો વિનયથી,

દ્વા યાપો નિત્યે દિલમહિ ડરો યાપ લયથી;

तपस्याना तेजे १निरमण अनी कर्मज हुणो,
सुधारो २साधभी सकल लव आ श्रावक तणो.

अनी धर्म धीरा ३सुखकर सदाचार करने,
४वहो वाणी साची निज हुदयमां टेक धरने;
करो सारां डासो ५हुःखकर विपत्ति नव गणो,
सुधारो साधभी सकल लव आ श्रावक तणो.

करो ग्रेमे पूज जिनवर तणी लाव धरीने,
धरो लक्ष्मि सारी शुद्ध जन तणी ६होष हरिने;
वधारो विद्याने ७परम महिमा ने अति धणो,
सुधारो साधभी सकल लव आ श्रावक तणो.



ખंડ ૨ નો.



ગृહस्थ श्रावकनो सामान्य धर्म.



પाठ ૭ મે.



न्यायथी पैसो કમावવો.

હરेक श्रावके नीतिथी पैसो કमावવો જोઈએ. પोતाना શેઠને,
મિત્રને અને વિશ્વાસી માણુસને છેતરીને તથા ચોરી કરીને પैસો

१ મેલવિનાના. २ હે સાધભીભાઈ ! આ શ્રાવકનો ઘધો સંસાર સુધારો.
૩ સુખ આપનાર. ૪ બોલો ૫ હુઃખ આપનાર. ૬ નાથ કરીને. ૭ મોરો મહિમા

મેળવવો, તે અનીતિનો પૈસો કહેવાય છે. જે પૈસો નીતિથી મેળવ્યો હોય, તે પૈસાનો ઉપલોગ શાંકા વગર થઈ શકે છે. વળી નીતિનો પૈસો જે સત્પાત્રને આપ્યો હોય, અથવા ગરીબ અને હુંખી માણુસની મદદમાં આપ્યો હોય તો, તેથી આપણું કદયાણ થાય છે. અનીતિથી મેળવેલો પૈસો જે કંઈ સારે માર્ગો વાપરે, તો પણ તેનું સારું ફરણ મળતું નથી, એટલુંજ નહીં, પણ તેનાથી આ લોકમાં રાજ તરફથી શિક્ષા થાય છે, અને સુવા પછી નરકની શિક્ષા લોગવવી પડેછે. માટે અનીતિથી પૈસો મેળવવો નહીં, પણ નીતિથી પૈસો મેળવવો. નીતિથી પૈસાદાર અનેલો માણુસ જે કંઈ સખાવત કરે, અથવા લોકેના લલાંને માટે પૈસો ભરયો, તે બધો લેખે થાય છે, અને તે આલોક અને પરલોક અનેમાં સુખી થાય છે. તે ઉપર વામચંદ નામના એક વાણીયાની વાર્તા છે.



વામચંદની વાતા.

પદ્ધતુરનગરમાં વામચંદ નામે એક વાણિયો હતો. તે વેપારના કામમાં ધણો પ્રવીણું હતો. રામદાસ નામના એક પૈસાદાર શેડનો હુકને તે નોકર રહ્યો હતો. રામદાસ ધણો નીતિવાળો અને ઉદ્ઘાર હતો. હુકનું બધું કામ વામચંદ ચલાવતો હતો. રામદાસ શેડનો તેની ઉપર એટલો બધો વિશ્વાસ હતો, કે જે કંઈ વામચંદ કરે, તેજ વાત રામદાસ કખુલ કરતો. એક વખતે વેપારમાં રામદાસને ધણી કમાણું થઈ, તે જોઇ વામચંદને તેનો એક કામચંદ નામનો ભિત્ર કહેવા આવ્યો. લાઇ વામચંદ ! તારો શેડ ધણું કમાય છે, અને તે કમાણું તારથીજ થાયછે, માટે તું પૈસાદાર કેમ થતો નથી ? નોકરીના પગારમાં તારું કંઈ વળશે નહીં. વામચંદે કહું, લાઇ કામચંદ ! પૈસાદાર થઈને શું કરલું છે ? આટલાથીજ હું સંતોષ

માતું છું. કામચંદ બોલ્યો—જો તારી આગળ પૈસો હશે તો તું
વધારે સુખી થઈશ. મારા કેવા પરઉપકાર કરીશ, અને ગરીબોને મહદ
આપીશ. વામચંદે કહું, ભિન્ન ! વધારે પૈસાથી કાંઈ વધારે સુખી
થવાંતું નથી. સુખ તો સંતોષમાંજ છે, મારા શેડને છેતરી અનીતિનો
પૈસો લઈ હું એનાને ઉપકાર કરું, તેના કરતાં પ્રમાણુકપણુથી
નોકરી કરું, અને મારું પાલન કરનાર શેડનું લખું ઈચ્છી પગારના
પૈસામાંજ સંતોષ માતું, એ કેવું સારું ? અનીતિના પૈસાવડે પરો-
યકાર કરવાથી કાંઈપણ કુળ થતું નથી. વામચંદનાં આ વચ્ચેન
તેનો શેડ રામદાસ ઘરની દીવાલની ઓથે રહી સાંસળતો હતો. તે
સાંસળી ઘણુંનું ખુશી થઈ ગયો. અને પોતાના પ્રમાણુક નોકરની
આવી સારી દાનત જોઈ તેણે વામચંદને મોટી રકમ દિનામમાં આપી.



સારબોધ.

વામચંદની જેમ પ્રમાણુકતાથી નોકરી કરનાર માણુસને તેની
પ્રમાણુકતાનો ખદલો મળ્યા. વગર રહેતો નથી; તેથી દરેક આવડે
પ્રમાણુકતા રાખી નીતિથી પૈસો મેળવવો જોઈએ.



સારાંશો પ્રશ્નો.

- ૧ અનીતિનો પૈસો કદો કહેવાય ?
- ૨ અનીતિનો પૈસો સારે માર્ગે વાપરવાથી શું થાય ?
- ૩ કદો પૈસો વાપરવાથી કલ્યાણ થાય ?
- ૪ વામચંદની વાતનો આર શું છે ?
- ૫ વામચંદને કામચંદે કેવી જલાહ આપી હતી ?
- ૬ વામચંદને તેના શેડ શું કર્યું હતું ?



પાઠ ૮ મૌ.

* * * * *

વિવાહ.

અહસ્થ શ્રાવકે ખીજ ગામના કે ખીજ વંશના માણુસની સાથે વિવાહનો સંખંધ જોડવો. તેમાં વળી એટલું પણ જોલું કે, જેની સાથે સંખંધ જોડવાનો હોય, તેમનાં કુળ અને સ્વભાવ વિગેરે પોતાનાં સરખાં હોવાં જોઈએ. તેમ વળી તેમનો વ્યવહાર ચોખ્યો હોય, માંસ, મહિરાતું સેવન અને રાત્રિ લોજન કરવાનો નહારો પ્રચાર તેમનામાં ન હોય, તેવાં જનોની સાથે વિવાહનો સંખંધ કરવો જોઈએ. જે ખાર વર્ષની કન્યા અને સોળ વર્ષનો પુરુષ હોય તો જી, એ બંનેનો વિવાહ કરવો ચોણ્ય ગણ્ણાય છે. રૂપ, શુણું અને વ્યા જોઈને વિક્રાનું પુરુષને કન્યા પરણુંબાબી, તે વિવાહ અધારી ઉત્તમ ગણ્ણાય છે. અને કાંઈ પૈસા લઈને કન્યા આપબી, તે સર્વથી નહારો વિવાહ ગણ્ણાય છે. જે મનાં કુળ તથા સ્વભાવ સરખાં ન હોય, જે મનો વ્યવહાર ચોખ્યો ન હોય, અને જે મના ધરમાં હુરાચાર હોય, તેવાઓની સાથે વિવાહનો સંખંધ કહિપણું કરવો નહિ. તેને માટે મંછારામ અને પ્રેમણ નામના એ અહસ્થની ખાતો ધડા લેવા જેવી છે, મથુરા નગરીમાં મંછારામ નામનો એક શ્રાવક રહેતો હતો. તેને ચંદના નામે એક દીકરી હતી. ચંદના ખાળ વચ્ચમાંથી ધર્ણી અતુર હતી. તેણે સારીરીતે ખી કેળવણી લીધી હતી. ચંદના જ્યારે ચોણ્ય ઉમરની થઈ, એટલે તેના પિતા મંછારામને તેના વિવાહની ચિંતા થઈ પડી. તેવામાં કોઈ મીત્રના કહેવાથી પ્રેમણ નામના એક અહસ્થના રામણ નામના દીકરાની સાથે મંછારામે ચંદનાતું વેવિશાળ કર્યું. ચંદનાની ઉમર જ્યાદ વર્ષની હતી, ત્યારે પ્રેમણના પુત્રની ઉમર ખાર

वर्षनी हुती. मंछारामतुं कुकु०ध श्रावके धर्मने लडने श्रावकना अधा आचारने जाणुनार अने पाणनार हुतुं, अने प्रेमलुतुं कुकु०ध मात्र नाभथीज श्रावक हुतुं. तेना घरमां भिथ्यात्वीना अधा आचार चालता हुता. चंदना अने रामलुनो विवाह थयो. चंदना जयारे सासरे आवी, त्यारे ते श्रावकनी दीकरीचे पेताना सासराना घरमां अधा भिथ्यात्वीना दीवाज जेया. जे दीवसे चंदना प्रेमलुने घेर आवी, तेज दिवसे चंदनाने तेनी सासुचे जमवा ओलावी. ते वर्खत शत्रिनो हुतो. एटले चंदनाचे कहुं के, हुं रात्रे जमती नथी. तमे श्रावक थधने रात्रे केम जमो छो ? तेनी सासु नठारा स्वलावनी हुती. तेणु चंदनाने कहुं के, तारे अमारे घेर रात्रे जमलुं पडशे. नहींतो तुं तारे पियर चालीज. एम कळी तेणुचे चंदनाने केटली-एक गाणो आपी. रामलु हजु छाकरो हुतो. पेतानी माना कळेवाथी तेणु चंदनाने घणुा भार मार्यो. चंदना रोती रोती पेताना पिताने घेर गष्ठ, अने ते अधी वात पेताना आप मंछारामने कळी संलग्नावी. मंछाराम प्रेमलुने ठपडो आपवा गयो. त्यां प्रेम-लुचे तेनी साथे भाराभारी करी, अने मोटो विरोध थयो. आभरे चंदना आपने घेरज रही, अने मंछाराम अने प्रेमलुनी वरच्ये धणुं वर्ष सुधी कलुया चालया कर्या.

—*—*—*

सारणीध.

केमना कुण, स्वलाव अने आचार सरथां न हाय. तेवा-आनी साथे विवाह संध उरवाथी मंछाराम अने प्रेमलुनी केम मोटो टोटो थाय छे, अने तेवा कुणमां दीकरी आपवाथी ते दीकरी चंदनानी केम हुःअी थाय छे.

સારાંશ પ્રશ્નો.

- ૧ શ્રાવકે તેવા પુરુષોની સાથે વિવાહનો સંખ્યાંધ જોડવો જોઈએ ?
- ૨ વિવાહમાં કન્યા અને વરની કેટલી ઉમર હોવી જોઈએ ?
- ૩ ઊત્તમ વિવાહ કર્યો અને નહારો વિવાહ કર્યો ?
- ૪ ભંછારામ અને પ્રેમજી તેવા ગૃહસ્થ હતા ?
- ૫ ચંદના અને રામજીની ઉમર વિવાહને ચોણ્ય હતી કે નહિએ ?
- ૬ પ્રેમજીના ધરમાં તેવા આચાર હતા ?
- ૭ ચંદના સાસરે કેમ રહી ન હતી ?
- ૮ ચંદનાને ડોણે માર માર્યો હતો ?



પાઠ ૮ મો

સદ્ગુરી

ગૃહસ્થ શ્રાવકે સદ્ગુરીએ, અને તેની પ્રશાંસા કરવી. જીની અને વૃદ્ધ પુરુષોની સેવાથી જેમણે સારી શીખામણું મેળવી હોય, તેવા પુરુષોનું જે આચરણું તે સદ્ગુરીએ કહેવાય છે. સદ્ગુરીએ માણુસ લોકના અપવાહથી ધીએ છે, ગરીબ અને દુઃખી માણુસનો ઉદ્ધાર કરવામાં તેને આદર હોય છે, અને તે હુમેશાં કદર જાણે છે. એવા સદ્ગુરીએ શ્રાવકનાં સારી રીતે વખાણું કરવાં જોઈએ. એ શ્રાવકનો અરેખરો શુણું કહેવાય છે. સદ્ગુરીનાં અને સદ્ગુરીનાં પ્રખાણું કરવામાં કેવો લાલ છે ? તેને માટે એક નીચેની વાર્તા જાપ્યોણી છે.

માધવ અને કેશવ નામે એ લાઇએ હતા. માધવને હુમેશાં સદ્ગુરી ગમતો હતો, અને કેશવ તેની વિરુદ્ધ હતો. સદ્ગુરીથી

આ વળી રીતે વર્તનારે કેશવ એક વખતે વાડીમાં કરવા ગયો, ત્યાં
કેટલાએક હુચચા છાકરાયો જુગાર રમતા હતા, જુગાર રમતાં
રમતાં તેઓની વરચે હાર જિતને માટે વાંધો ઉઠયો, તે વાંધો
અતાવવાને તે વાડીમાં આવી ચ્યાલા કેશવને તેઓ થઈ ગયા, અને
કેશવ જેમ કહે તે કખુલ કરવાને બધાઓ બધાયા, કેશવ સહાચાર-
ના વિરાધી હતો, તેથી તેનામાં ખરાખર ન્યાય આપવાતું પ્રમા-
ણુકપણું હતું નહીં. આથી તેણે પક્ષપાત કરી, એ વાંધો ખીજાના
ખાલમાં ચુક્કોયો. કેશવની અનીતિ જેઈ તેઓ નાખુથી થઈ ગયા,
અને સામા પક્ષના માણુસોને ભારવા તૈયાર થયા, એમ કરતાં તે-
ઓની વરચે મારામારી થઈ, અને તેમાં એ ત્રણ ખુન થઈ ગયાં.
આ ખખર થતાંજ રાજાના માણુસોએ તે બધાને કેદ કર્યા, તેમાં
કેશવ પણ ખુની તરીકે પકડાયો, રાજાએ તેમનો ન્યાય કરાવી શિક્ષા
આપવાનો ઠરાવ કર્યો, ત્યાં માધવ પોતાના લાઇ કેશવને છોડવવાને
રાજાની પાસે આવ્યો. રાજ જૈની અને નીતિવાળો હતો; તેણે મા-
ધવને પુછ્યું કે, તું જેમ આવ્યો છું ? માધવે કહ્યું, મારા નિ-
રપરાધી લાઇ કેશવને છોડવવાને આવ્યો છું. રાજએ કહ્યું, તારો
લાઇ નિરપરાધી છે, તેની શી આત્રી ? માધવે કહ્યું, જે આપ કહો.
તે આત્રી આપું. રાજએ પોતાના વિદ્ધાન્ત મંત્રીઓની સાચે મસલત
કરી કહ્યું—માધવ ! જેના કુળમાં સહાચાર પળાતો હોય, અને જે સહા-
ચારનાં વખાણું કરતા હોય, તેવા કુળનો માણુસ આવાં ખરાણ કામ
કરેજ નહિં, તે તો હમેશાં ઘણું કરીને નિરપરાધી હોવો જોઈએ.
મને તેવી આત્રી છે, માટે જે તારો લાઇ કેશવ નિર્દોષ
હોય તો, તું સહાચાર એટલે શું ? અને સહાચારનાં વખાણું કેવી
રીતે કરવાં જોઈએ ? તે મારી આગળ જણાવ. પછી માધવે સ-
હાચારનું રવરૂપ રાજને કહી સંબળાયું, અને તે પછી નીચે પ્ર-

માણું સહાચારનાં વખાણુ કર્યાં, જે માણુસ હુમેશાં ડોધની નિંદા
કરે નહિ, સારા માણુસની પ્રશાસા કરે, વિપત્તિ આવે ત્યારે
ધીરજ રાખે, સંપત્તિ મળે ત્યારે નભે થાય, પ્રસંગ આવે ચોડું
ગોલે, ડોધની સાથે વાહ કરે નહિ, જે પોતે કણુલ કર્યું હોય, તે
પ્રમાણે વર્તે, પોતાના કુળનો ધર્મ યાળે, ઓટે માર્ગ ખર્ચ કરે
નહિ, જે ધર્ટે તેલું કામ કરે, ખર્દું કામ કરવામાં આથર્હ રાખે,
ડોધ કામમાં ગાઝલ રહે નહિ, સારા લોક રીવાજને અતુસરે, જે
જે ચોંધ્ય હોય તેનું પાલન કરે, અને કંઠે આણુ આવે તોપણ
નઢાડું કામ કરે નહિ, એ સહાચાર કહેવાય છે. અને તેવો સ-
હાચાર સેવનાર પુરૂષને ધર્ન્ય છે. માધવનાં આવાં વચ્ચન સાંલળી
રાજી ખુશી થયો. અને “આ કેશવ સહાચારને જાણુનારા માધવનો
બાધ છે, માટે તે નિર્હોષ હોય અથવા ન હોય, પણ માધવની
લાયકાતની ખાતર છોડી મુકવો જોઈએ.” આવું ધારી તેણે કે-
શવને છોડી મુક્યો.

સારથોધ.

કેશવ સહાચારની વિકૃષ્ણ હતો, પણ માધવનો સહાચાર જેધ
રાજી તેને છોડી મુક્યો હતો; માટે દરેક શ્રાવકના પુત્રે સહાચાર
શાખવો, અને જે ખીંચે સહાચાર પાળતો હોય તેનાં વખાણુ કરવાં.

સારાંશ પ્રશ્ના.

- ૧ સહાચાર અટલે શું ?
- ૨ માધવે કેશવને કુચા ગુણુથી છોડાયો ?
- ૩ કેશવ શા માટે પકડાયો હતો ?
- ૪ સહાચારનાં વખાણુ સાધવે કેવી રીતે કર્યાં હતાં ?

પાઠ ૧૦ મે.

૭ શત્રુઓ.

આપણા શરીરની અંદર કામ, કોધ, લોલ, માન, મહ અને
હર્ષ-એ છ શત્રુઓ છે. તેઓ અંદર રહી શત્રુના જેવું કામ કરે
છે, માટે તે ખરેખરા શત્રુઓ કહેવાય છે. બીજાએ પરણેલી અથ-
વા કુંવારી સ્વી ઉપર નઠારી ઈચ્છા કરે, તથા પોતાની પરણેલી
સ્વી ઉપર આત અલીલાધા ધરે તે કામ કહેવાય છે. વિચાર વગર
પોતાનો અને બીજાનો નાશ કરવાનું કારણ તે કોધ કહેવાય છે.
બીજાને પોતાનું ધન આપે નહિ, અને બીજાના ધનને કારણ વગર
દે તે લોલ કહેવાય છે નઠારી હઠને તથા અહંકારને લઈ ચોંચ
વચન માને નહિ, તે માન કહેવાય છે, ખળ, ઠકુરાઈ, વિદ્યા અને
રૂપ વિગેરથી મગજર થવાનું કારણ તે મહ કહેવાય છે. અને કા-
રણ સિવાય બીજાને હુંખ ઉત્પન્ન કરવાથી અથવા જુગાર શીકાર
વિગેર નઠારો ટેવથી મનમાં ખુશી થાય તે હર્ષ કહેવાય છે. આ
અંદરના છ શત્રુઓનો જે ત્યાંગ કરે, તે ખરેખરો શ્રાવક છે. જે
શ્રાવક હોય, તેમણે કેવા શુણ રાખવા જોઈએ, તે ઉપર રાજસિંહ
રાજની કથા છે.

પાઠણું નગરમાં રાજસિંહ નામે એક રાજુ હતો. તે શ્રાવક
ધર્મને માનતો હતો, પણ તેનામાં શ્રાવકના શુણ આંદ્યા નહતા.
એક વખતે એક બાતમીદારે ખરુર આપ્યા કે, તારો ઉપર તારા
શત્રુઓ ચડી આવે છે, આ ખરુર જાણતાંજ તેણે ચડાઈ કરો, અને
ચાડા દિવસમાં હૃદમનોને હરાવી તે પણે તરત રાજધાનીમાં આ-
ંદ્યા. તે વખતે ક્ષમાવિજ્ય નામે એક સુનિ શહેરની પાસેની વા-

હીમાં ઉત્તર્યા હતા. રાજા વિજય કરી આવતો હતો, ત્યાં તેને માર્ગમાં ખખર પડી કે, વાડીમાં સુનિ પદ્ધાર્યા છે, એટલે રાજ તેભને વાંદવા ગયો, સુનિએ રાજને ધર્મ લાભ આપ્યો, અને ધર્મ સંખાંધી વાત પુછી. શત્રુઓની ઉપર થોડા વખતમાં જીત મેળવી આવેલા રાજએ સુનિને ગર્વથી જણ્ણાંયું કે, મહારાજ ! થોડા વખતમાં મોટી જીતકરીને હું આપને વાંદવા આવ્યો છું. મેં મોટા શત્રુઓને હરાવી દીધા, તેને માટે હું આપના જેવા મહાત્માનો ઉપકાર માતું છું. રાજના આવાં ગર્વ લરેલાં વચન સાંભળી સુનિ બોલ્યા—હે રાજ ! તે શત્રુઓની ઉપર મોટી જીત મેળવી, એવાત સાંભળી મને અચંભો થાય છે. હમણાં જે તું બોલ્યો, એ ઉપરથી તો સમજાય છે કે, હજુ તારાથી ખીજ હુશમનો જીતી શકાયા નથી. રાજએ કહું, લગવન્ ! તે વાત શી રીતે મનાય ? મારે હું કોણું શત્રુ છે ? તે અતાવો. સુનિ બોલ્યા—રાજ ! તું જેની ઉપર જીત મેળવીને આવ્યો, તે તો તારા બાહેરના શત્રુઓ છે, પણ હજુ અંતરના શત્રુઓ જીતવા બાકી છે. રાજએ પુછ્યું, તે અંતરના કયા શત્રુ તે કહો. સુનિ બોલ્યા—કામ, કોધ, લોલ, માન, મદ અને હર્ષ એ છ શત્રુઓ અંતરના ગણ્ણાય છે. હમણાં તેં જે ગર્વનાં વચન કર્યાં, તે તારે મહ નામનો શત્રુ છે. એમ કહી સુનિએ તેને સમજુતી આપી ખરાખર સમજાંયો. રાજ સમજુ ગયો, અને ત્યાર પછી તેણું થોડે થોડે પ્રયાસ કરી અંતરના છ શત્રુઓને જીતી દીધા, અને સુખી થયો.



સારબોધ.

રાજસિંહ રાજની જેમ બાહેરના શત્રુઓને જીતી ગર્વ કરવો નહીં. ક્ષમાવિજય જેવા વિક્રાન સુનિની પાસેથી ખરાખર સમજુને

અંદરના છ શત્રુઓને જીતી લેવા, એટલે કામી, કોધી, લેલી, માની, મહવાળા અને હૃષ્વવાળા થિંગું ન જોઈએ.



સારાંશ પ્રસ્તુતો.

૧ અંદરના છ શત્રુઓ કયા ? તે ગણ્ણાવો.

૨ તે છ શત્રુઓનાં જુદાં જુદાં સ્વરૂપ સમજાવો.

૩ ખરો શાલક કયો કહેવાય ?

૪ રાજસિંહ રાજને શાથી ગર્વ થયો હતો ?

૫ તેમને કયા સુનિએ બાધ આપ્યો હતો ?

૬ રાજ રાજસિંહને ડેવી રીતે બાધ થયો હતો ?



પાઠ ૧૧ મો.

ઇંદ્રિયાનો જ્ય.

ગૃહસ્થ શાલક ચોતાની ઇંદ્રિયાનો જ્ય કરવો જોઈએ. નાક કાન, જીબ વિગેરે ઇંદ્રિયો ચોતપોતાના વિકારમાં માણુસને આસક્તા કરે છે, તેવી ઇંદ્રિયાનો શાલક જ્ય કરવો જોઈએ. ઇંદ્રિયાને નિયમમાં ન રાખવી, તે વિધિનો માર્ગ છે; અને ઇંદ્રિયાને નિયમમાં રાખવી, તે સંપત્તિનો માર્ગ છે. જો ઇંદ્રિયો તાણે કરી હોય તો, તે સુખનું કારણ છે, અને છુટી સુકી હોય તો, તે હઃખનું કારણ છે, માટે ગૃહસ્થ શાલક ચોતથી બને તેમ ઇંદ્રિયાને કબજે રાખવી. કબજે નહીં રાજેલી ઇંદ્રિયો માણુસને નઠારી સ્થિતિમાં લઈ જાય છે, તે કિપર ચંદ્રકેતુ રાજની વાત ધરાખર દાખલા રૂપ છે,

અવંતી નગરીમાં ચંદ્રકેતુ રાજ હતો. તે ધર્ણો ધર્મી અને ન્યાયી હતો. તેના રાજ્યમાં ધર્મ અને ન્યાય અંને સમાન રીતે શોલી રહ્યા હતા. કેટલોક વખત રાજ્ય કર્યા પછી, તે રાજ્યએ હીક્ષા લેવાને વિચાર પણ કર્યો હતો. આવા ઉંચા વિચારને રાજ એક વખતે રાત્રે પોતાના મેહેલમાં સુતો હતો, ત્યાં ફૂર્થી એક ભધુર અવાજ તેના કાને આવ્યો. તે સાંભળતાંજ રાજ મેહેલમાંથી નીકળી છુપી રીતે તે અવાજને અલુસારે ચાદ્યો. નગર ખાહેર આવતાં એક વડનું આડ આવ્યું, તેની નીચે એક સુંદર સ્વી ગાયન કરતી જોવામાં આવી, તેને જોતાંજ રાજને મોહ થઈ ગયો. અને તે સ્વીનું ગાયન સાંભળવામાં તદ્વકીન થઈ ગયો. શાહીવાર પછી તે તે બાધ ગાતી બંધ રહી. એટલે રાજ્યએ પુછ્યું, કે તમે શા માટે ગાયન બંધ કર્યું ? તે સ્વી બોલી—રાજ ! જે પુરુષ આ મારા રસને પીએ, અને આ સુગંધી પુલ સુંધે, તેનેજ હું ગાયન સંભળાલું છું ઓળને સંભળવતી નથી. રાજ્યએ તે વાત કણુલ કરી, પછી તે સ્વીએ રાજને રસ પાયો, અને સુગંધી પુલ સુધાડ્યું. તરતાં રાજ ધર્ણો ઝુશી થઈ ગયો, અને તે સ્વીમાં આશક થઈ ગયો. તે આખી રાત તેની પાસેજ બેસી રહ્યા. સવારે પણ રાજ તેની સાથે ચાલી નીકળ્યો. ત્યાં તે સ્વી જાય, ત્યાં તે પાછળ લમ્બવા લાગ્યો.

રાજને તેના કારલારીએ અને હજુરી માણુસે શોધવા નીકળી પડ્યા. ક્રતાં ક્રતાં કેટલોક દિવસે રાજને પત્તા જગતની અંહર મળ્યો. રાજની નડારી સ્થિતિ જોઇ કારલારીએ ચિંતામાં પડ્યા. ચેલી સ્વી ત્યાંથી કોઈ ઠેકણે છુપાઈ ગઈ. રાજને ધર્ણું સમજાવવા માંડ્યું પણ તે રાજ તે સ્વીને વારંવાર ચાદ કરવા લાગ્યો. તેવામાં કોઈ જૈન સાધુ ત્યાં આવી ચઢ્યા. તેમણે રાજને બોધ આપ્યો,

ઓટલે રાજને જરા લાન આવ્યું. સુનિ બોલ્યા—રાજ ! તું ખરૈન
ખરો જેન થઈને આ શું કરે છે રાજએ પુછ્યું ? મહારાજ ! હું
શું કર્યું અને મને શું થયું છે ? તે કહો. સુનિ બોલ્યા—રાજ !
તું તારો ઈદ્રિયોને વશ રાખી શક્યો નહીં, તેતું આ પરિણામ
છે. પહેલાં તે બાઇનું ગાયન સાંભળી તું તેની પાસે ઢોડી ગયો,
પછી તેને સુંહર જોડ, તેમાં આશક થયો, પછી તે તેની પાસેથી
રસ પીધો, અને તે સુગંધી કુલ સુંધરું. કાન, અંખ, જીબ અને
નાક, એ ચાર ઈદ્રિયોને તું વશ કરી શક્યો નહીં, માટે તારો
આ સ્થિતિ થઈ. રાજ તરત સારી રીતે સમજ ગયો, અને પછી
તે સુનિની પાસે દીક્ષા લઈને રાજ્ય છોડી ચાલી નીકળ્યો.

સારબોધ.

ચંદ્રકેતુ રાજની કેમ માણસે ઈદ્રિયોને વશ થવું નહીં.
ઈદ્રિયોને વશ થવાથી ચંદ્રકેતુની કેમ નઠારી સ્થિતિમાં આવી
જવાય છે.

સારાંશ પ્રશ્નો.

૧. ઈદ્રિયોને લુતલી અને ઈદ્રિયોને ન લુતલી, તેથી શું થાય છે ?
૨. ચંદ્રકેતુ રાજ કેવો હુંતો ?
૩. ચંદ્રકેતુ રાજ કેવી રીતે નઠારી સ્થિતિમાં આવ્યો હુંતો ?
૪. ચંદ્રકેતુ રાજને કોણે અને ડેવી રીતે બોલ આવ્યો હુંતો ?

પા� ૧૨ મે.

સારા ગામભાં વાસ કરવો.

ગૃહશ્થ શ્રાવકે કેવા ગામભાં રહેવું જોઈએ ? તે પહેલાં જાણવાનું છે. જે ગામ કે શહેરમાં લડાઈ, બળવોં કે બંડ જગે તેવું ન હોય, તેમજ જ્યાં હુકાળ, ભરકી અને લોકોમાં વિરોધ ન હોય, અને જ્યાં સ્વધર્મી રહેતા હોય, અને દેરાસરલુ હોય, તેવા શહેર કે ગામભાં શ્રાવકે નિવાસ કરવો જોઈએ. જે તેવા સ્થળમાં નિવાસ ન કરે તો, શ્રાવકનો ધર્મ સંચ્યાય નહીં અને બધી જાતની લુકશાની થાય છે અને જાતારે ધર્મ સંચ્યાય નહીં, ત્યારે પછી તેના આલોક અને પરલોક બંને બગડે છે. તે ઉપર નંદની કથા ધરો દેવા લાયક છે.

રાજપર નામના એક ગામભાં નંદ નામે એક શ્રાવક રહેતો હતો. તે નંદ શ્રાવક ધર્મભાં પ્રીતિવાળો. અને લીધેલી ટેક તે પાણનારો હતો. એક વખતે તે ગામભાં રાજાની સાથે લોકોને વાંચે પડવાથી લોકોએ મોટો બળવો જાડાયો. બળવો શમાવવાને રાજાએ લશ્કરનાં માણુસોને લોકોની સામે મોકદ્યા. રાજાનાં માણુસોએ લોકાના માલ કંખજે કરી લીધા, અને તેમના ધરને કડીએ. હેવા માંદી. તે વખતે નંદના ધર ઉપર પણ ધાડ આવી. નંદ બળવાઘોર ન હતો. પણ નંદારાની સાથે ધાડા નંદારા ગણ્યાય, એ નીતથી રાજમાં માણુસોએ નંદનું ધર પણ જસ્ત કર્યું. નંદે પોતાના ધરમાં ધરદેરાસર કરી મહાવીર સ્વામીની પ્રતિમા પધરાવી હતી, તે પ્રતિમાની પૂજા કર્યા વિના જમવું નહીં, એવી નંદને બાધા હતી. આથી પકડાએલા નંદે થાણી આજુલુ કરી, પણ રાજાનાં માણુસો સમજાયાં.

નહીં, અને તેને કેદ કરી પૂરી રાજ્યો. છેવટે રાજાએ ઓવો ઠરાવ કર્યો કે અળવાઓર માણુસોને દરીઆ પાર જિતારી હેવાં. નંદ તે બધાની સાથે દરિયાપાર ગયો, અને પોતાની આધાની ટેક રાખી અનશન કરીને ત્યાંજ મરી સ્વર્ગમાં ગયો.



સારથોધ.

નકારા ગામમાં રહેવાથી નંદની જેમ હુંથી થવાય છે; તેથી દરેક વૃહુસ્થ આવકે તેવા ગામમાં રહેવું નહીં અને નંદના જેવી ધર્મની ટેક રાખવી જોઈએ.

સારાંશ પ્રશ્નો.



- ૧ કેવા ગામમાં આવકે ન રહેવું જોઈએ ?
- ૨ ધર્મ ન સચ્યવાય તો તેને શ્રી તુકશાની થાય ?
- ૩ નંદ કેવા ગામમાં રહ્યો હતો ?
- ૪ આખરે નંદને શુથ્યું હતું ?



પાઠ ૧૩ મો.

શ્રાવકનું ધર.

રાધ્યચંહ—મોહન ! જો આ કેવું ભજાનું ધર છે ?

મોહન—ધરણું સારું ધર છે.

રાધ્યચંહ—એ ધર કોણું હથે વારુ ?

મોહન—એ ધર કોઈ શ્રાવકનું લાગે છે.

રાધ્યચંહ—આ શ્રાવકનું ધર છે, અમ તેં શ્રી રૂતે જાણ્યુ ?

મોહન—શાવકના ધરની બાંધણી કેવી હોવી જોઈએ ?

રાયચંદ્ર—ત્યારે તું મને, કહે, તેની તને ખખર છે ? મારે તે જાણવાની દુષ્ટી છે.

મોહન—શાવકના ધરના બારણા ઉપર ગણુષ્ટતીની ભર્તી ન હોય, તેમજ ધણું બાર પણ ન હોય. જે જમીનમાં હાડકાં ન હોય, પ્રોત્સાહન ડાસ જિગતા હોય, સુગંધદાર માટી હોય, અને મીકું જળ નીકળે તેમ હોય, તેવી જમીન ઉપર શાવકનું ધર બંધાય છે, જ્યાં પાડાશ સારો હોય, આસપાસ ગીય વસ્તી ન હોય, તેમ તદ્દન ખુલ્લું પણ ન હોય, તેવા સ્થળમાં શાવકનું ધર હોલું જોઈએ.

રાયચંદ્ર—ખરેખર હુવે મારાથી સમજાયું. આ ધર તેવું જ છે. ગૃહસ્થ શાવકને જોઈએ તેવી તેની બાંધણી છે. જે ધરને જવા આવવાનાં વધારે બારણાં હોય તો વખતે કોઈ ચોર કે લુચ્ચા લોકો પેશી જાયછે. જે નડારો પાડાશ હોય તો, આપણને વારંવાર હેરાનગતિ લોગવવી પડેછે. જે હુલકી જતના લોકોની પાસે રહેવાથી આપણું કુદુંથનાં માણુસોમાં હુલકાઈ દાખલ થાય છે.

મોહન—હુવે તું ખરાખર સમજાયો. નડારા પડોશથી કેવો ગેરલાલ થાય છે, તેનો દાખલો એક જાણવા જેવો છે. મનમોહન કરીને એક શાવક નડારા પાડાશમાં રહેતો હતો. તેને વિકુલ કરીને એક છોકરો હતો. મનમોહન પોતાના છોકરાને જૈનશાળામાં દાખલ કર્યો. જૈનશાળામાં એક વર્ષે પરીક્ષા આવી, એટલે તે છોકરો નાપાસ થયો. મનમોહન તેનું કારણું પુછવાને પાડશાળાના શિક્ષકની પાસે ગયો. શિક્ષકે કહ્યું કે, તમારો છોકરો આખા વષમાં પદર દિવસ શાળામાં આંદોલા છે. પછી વિકુલને બોલાવી તેના બા-

પે સુધ્યું, ત્યારે રેણુ કહું કે, હું હમેશાં શાળામાં આવતો, જ્યારે તેને ધમકી આપી સુધ્યું, ત્યારે તે માની ગયો, અને સાચું બોલ્યો કે, હું હમેશાં શાળાનું નામ રખને રખડવા જતો હતો. તેના આપે સુધ્યું કે, કયાં રખડવા જતો હતો ? વિહુલે કહું, આપણા પાડોશ માં લવળ કરીને એક મોચીનો છોકરો રહેછે. તેની સાથે આગો દિવસ રખડતો અને રમતો હતો. લેવટે એટલે સુધી માન્યો કે, હું કોઈ કોઈ વાર તેના વેર આતોપીતો પણ હતો. આ પ્રમાણે પોતાનો છોકરો વટકાયો અને બગડ્યો, એમ જાણી મનમોહન ત્યાંથી પોતાનું ઘર ફેરવી રીતન પાડોશમાં રહેવા ગયો, જ્યાં રહેવાથી વિહુલ માંડમાંડ સુધ્યો, અને મનમોહનને જાતિ તરફની મોટી શિક્ષા અમલી પડી.



સારેધોધ.

કોઈ પણ શ્રાવકે નઠારા પાડોશમાં રહેવું નહીં જોઈએ. નઠારા પાડોશમાં રહેવાથી વિહુલની માઝક છોકરા બગડે છે, અને નાતાની શિક્ષા અમલી પડે છે-



સારાંશ પ્રશ્નો.

૧ શ્રાવકનું ઘર કેવું જોઈએ ?

૨ શ્રાવકે કેવે ઠેકાણે ઘર બાંધલું જોઈએ ?

૩ શ્રાવકના ઘરની બાંધણી કેવી જોઈએ ?

૪ હલકા પાડોશથી શું થાય છે ?

૫ મનમોહન અને વિહુલને શું બન્યું હતું ?



પાઠ ૧૪ મે.

પાઠની ખીક.

દરેક શ્રાવકના છોકરાએ પાપની ખીક રાખવી જોઈએ. પાપ બેનું જતનાં છે, એક એવાં પાપ છે કે જે પાપનાં કુળ આદોકમાંજ જોઈ શકાય છે, અને ખીક એવાં પાપ છે કે જે પાપનાં કુળ પરલોકમાં જોઈ શકાય છે. તે બને જતનાં પાપથી હુમેશાં ઉત્તા રહેણું. ચોરી, વ્યબિચાર, અને જૂગાર વિગેરે પાપ કરવાથી રાજી શિક્ષા કરે છે. તે હુંખ આ લોકમાં જોઈ શકીએ છીએ, અને માંસ આખું તથા દાડું પીવો વિગેરે પાપ કરવાથી નરકમાં જવાય છે. તે હુંખ પરલોકમાં જોઈ શકાય છે. આ બને જતનાં પાપ કરવાથી આદોક તથા પરલોકમાં હુંખી થવાય છે. તે ઉપર એક મધુશર્મા નામના આહણુંની વાર્તા છે.

મધુશર્મા નામે એક જુવાન આહણું હતો. તેને નહારી સી. અત થવાથી તે ઘણો વંડો ગયો હતો. આ ખણર તેના આપને પડી, એટલે તેણે દીકરાને સુધારવાને માટે ઘણા ઉપાય કર્યા; પણ આખરે તે બધા નકામા થયા. તેના આપણું નામ દેવશર્મા હતું. તેણે લીખ માગી માગીને ઘણું ધન એકદું કર્યું હતું. તે માંહેથી ઘણું ધન પોતાના પુત્ર મધુશર્માને સુધારવામાં સેણે અર્થી નોંધ્યું. તે છતાં પણ જ્યારે તે સુધર્યો. નહિ, એટલે દેવશર્મા કંટાળી ગયો. અને પોતાનો નિર્વાહ ચાલે તેટલું ધન લઈને, પોતાના ઘરમાંથી નીકળી ખીકે રહેવા ગયો.

મધુશર્માની પાસે ક્રયારે ઊંઠ પણ ચૈસો રહ્યો. નહિ, એટલે તેણે મનમાં વિચાર કર્યો છે, આજ રાતે હું બાપને મારો નાખો,

ધર્માંથી ધન હુરી લાવું, તો પછી મારે "પૈસાની છુટ થાય,
અને સારી રીતે જુગાર રમવાની ભજ પડે આવું વિચારી તેજ
રાતે તે જુદા ધર્માં રહેતા હેવશર્માને મારવા તૈયાર થઈ આવ્યો,
ત્યાં રક્તામાં હરિચંદ કરીને એક શ્રાવક મળ્યો. હરિચંદ મધુ-
શર્માનો બાળમિત્ર હોતો, પણ મધુશર્માની કુચાલ જેઠને તેણે તેમો
સંગ છાડી દીધો હતો. હરિચંદે પુછયું-કેમ મધુ ! અત્યારે કયાં
જાય છે ? મધુશર્માએ કહ્યું, કાંઈ કામે જઈ છું. તે કામ ધણ
છુદું છે, તને કહી શકાય તેમ નથી. હરિચંદ બોલ્યો-મારે તારુ
કામ જાણુવા મરજ નથી, પણ જે જ્ઞાની છે, તે તારા કામને જાણે
છે. મારે તો તારા હિતની ખાતર એટલુંજ કહેવાનું છે કે, પાપ-
નો લય રાખવો. જે માણુસ પાપનો લય રાખે છે, તે સહા સુખી
રહે છે. મધુશર્મા બોલ્યો-પાપ શી વસ્તુ છે કે જેનો લય રાખવો ?
હરિચંદે જણાયું. પાપ એવી વસ્તુ છે કે, તે છાની રહેતી નથી,
અને તેનો અદ્દો મળ્યા વગર રહેતો નથી. હરિચંદનાં આવાં વ-
ચન સંલળીને મધુશર્માએ વિચાર્યું કે, પાપ છાનું રહેશે નહિ,
માટે મારે પાપનો ડર રાખવો. પછી તે પાછો વળ્યો, અને હરિ-
ચંદનો ઉપકાર માની સારે માર્ગે ચાલવા લાગ્યો, અને આખરે
પોતાના પિતાને પ્રિય થઈ પડ્યો.

સારબ્દીધ.

મધુશર્માની જેમ ફરેક શ્રાવકે પાપનો ડર રાખી નથારાં કામ-
માંથી પાછા ફરલું, અને ધીજનો ઉપહેથ માની સારે માર્ગે ચાલવું.

સારાંશ પ્રસ્તુતી.

૧ પાપ એટલી જાતનાં છે ?

ર એ જતનાં પાપ વિષે સમજાવો.

૩ શ્રાવકે પાપને માટે શું કરવું જોઈએ ?

૪ મધુશર્મા કેવો હતો, અને તેને માટે (દેવશર્માજી) શું કર્યું ?

૫ મધુશર્માને પાપનો લય કોના કહેવાથી લાગ્યો હતો ?

૬ આપણારે મધુશર્માનું શું થયું ?



પાઠ ૭૫ મો.

પોતાના ધર્મને હાની ન પૂછોંચે, તેવો દેશાચાર પાળવો.

અહૃસ્થ શ્રાવકે પોતાના દેશમાં ઘણું વખતની ઝૂઢિથી જે સારો આચાર ચાહ્યો આવતો હોય, તે અરાધર પાળવો. પોતાના દેશમાં ખાવા પીવાની અને ચેહેરવા ઓઠવાની જે સારી રીત હોય, તે રીતને ગૃહસ્થ શ્રાવકે કદિ પણ છોડી દેવી ન જોઈએ. જે પોતાના દેશાચારને પાણે નહોં, તેની સાથે દેશના તમામ લોકો વિરોધ કરે છે. કદિ દેશાચારમાં આપણુને કોઈ નકારી ઝડિ લાગતી હોય, પણ જ્યાં સુધી લોકો તે ઝડિને છોડી હે નહિ, ત્યાં સુધી આપણું તે ઝડિને વળણ્યા રહેવું. જે તે ઝડિ લોકોને ઘણીજ હાનિ કરનારો હોય, તો લોકોને તેની સમજણું પાડી, પણી સર્વની સાથે તે ઝડિનો ત્યાગ કરવો જોઈએ દેશાચારને છોડી દઈ સ્વતંત્રપણે વર્તવાથી માણુસ યરોલાલની જેમ લોકમાં વગોવાય છે, અને ઠેકાણે ઠેકાણે લેતું અપમાન થાય છે.

તિલકપુરસાં અરોલાલદ, નાસે જોક જુબાન શ્રાવણ હતો. તે વેપારને માટે બહાર ગામ ગયો. કેટલાંચોક વર્ષ સુધી અહુંર ગ્રામ રહી,

તે ચોતાને વતન પાછો આવ્યો. ખાહેરના દેશમાં કુરવાથી તૈને ચો-
તાના દેશની રૂઢિ પસંદ પડી નહીં. દેશમાં ચાલતી ઇરેક રૂઢિને
તે ધિક્કારવા લાગ્યો. કોઈને ઘેર મરણ કે વિવાહનો પ્રસંગ આવે,
તેમાં તે ભાગ કેતો નહીં. તેમજ ચોતે વેપ પણ જુગીજ રીતનો
પહેરવા લાગ્યો. તેવામાં તેની મા અચાનક મરણ પામી. તે વખતે તે
નાં વિરોધી અનેકાં સગાંવહાલાંઓ પણ તેને ઘેર આવ્યાં નહીં.
માતાના સુહદાને સમશાનમાં શી રીતે લઈ જવું ? તેને માટે ચ્યો-
લાલને મોટી સુઅરણ થઈ પડી. તેણે ધખુંબાર સુધી રૂઢન કર્યું, અને
પછી માતાના સુહદાની આગળ એસી રહ્યો. તેની કો સમજુ હતી,
તેથી તેણુંચે ચ્યોલાલને સગાંઓને તેડવા જવાનું કર્યું, ત્યારે તે
ઘેર ઘેર કુરવા નીકળ્યો. દેશાચારની વિરુદ્ધ વર્તનારા ચ્યોલાલને
કોઈએ પણ મેં માંડયું નહીં. તેમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગ-
યા. છેવટે ચ્યોલાલ બધા લોકોની આગળ રોધિને નમી પડ્યો,
અને દેશાચાર વિરુદ્ધ નહીં ચાલવાની તેણે સર્વની આગળ પ્રતિ-
ના લીધી, ત્યારે લોકો તેની મદદ આવ્યા, અને છ દિવસે ગાંધી
જહેલા તેની માના સુહદાને સમશાનમાં લઈ ગયા. અને બીજ
બધી જાતાની મદદ કરી.

સારખોધ.

ચ્યોલાલની જેમ કોઈએ દેશાચાર વિરુદ્ધ વર્તિયું નહીં,
દેશાચારની વિરુદ્ધ વર્તનારો માણુસ ચ્યોલાલની જેમ હુઃખી થાયકે.

સારાંશ પ્રશ્નો.

૧ દેશાચાર ચેટલે શું ?

૨ કઈ કથ દેશાચારની રીત છેઠલી નહીં ?

૩ હેઠાચાર પ્રમાણે નહીં ચાલવાથી શો જેરકાલછે ?

૪ કોઈ બુની ઝડિનકારી હાથ તો તેનો કેવી રીતે ત્યાગ કરવો?

૫ યશોલાલ શી રીતે વત્યો હતો ?

૬ યશોલાલ સુધરીને ઠેકાણે કયારે આવ્યો ?



પાઠ ૧૬ મો.

કોઈની નિંદા કરવી નહીં.

ગૃહસ્થ આવકે કોઈની નિંદા કરવી ન જોઈએ, ઉંચી જાતના, સાધારણુ કે હુલકી જાતના કોઈપણ માણુસની નિંદા કરવી નહીં, તેમાં પણ ખાસ કરીને રાજ અથવા કેમને ધણુ લેકો માન આપેછે, તેવા મોટા માણુસોની તો કદિપણુ નિંદા કરવી નહીં. આપણા શાસ્ત્રમાં લખેછે કે, કે માણુસ બીજાની નિંદા કરે અને પોતાની અહાર્થનાં વખાણુ કરે, તે માણુસ નીચ ગોંત્રનું કર્મ બાંધેછે. એવા કર્મને બાંધનારા માણુસો હુલકા કુળમાં અવતરે છે. બીજાની નિંદા કરવાથી ચાડુદતાને મોટી શિક્ષા થધ હતી. તે વાર્તા જાણવાથી આપણુને બીજાની નિંદા કરવાથી કેવાં ઝુણ મળેછે, તેની ખાત્રી થશે.

ઉજ્જ્વલનગરીમાં ચાડુદતા નામે એક આવક હતો. ચાડુદતામાં બીજ ધણુ શુણુ હતા, પણ એક રેનામાં એવો અવગુણુ હતો, કે કે તેના ઓજ શુણુને ઢાંકી દેતો હતો. તે હુમેશાં બીજાની નિંદા અને પોતાનાં વખાણુ કર્યા કરતો હતો. ઉજ્જ્વલનગરીમાં ભદ્રનપાળ નામે રાજ હતો. તે ધણુ કોઈ સ્વભાવનો હતો. તેના કોઈ સ્વભાવને લખને લેકો તેનાથી ત્રાસ પામતા હતા. એક વખતે રાજા ભદ્રન-

પાણ છુપી રીતે નગર ચ્યાં જેવાને નીકળી પડ્યો. પોતાને માટે દોડો ડેલું કહેછે ? તે જાણુવાની તેની ઈચ્છા હતી. રાજના વ્રાસથી દોડો તેનું કાંઈપણ કહી શકતા ન હતા. રાજ કરતો કરતો ચારુદૂષના ધરની આગળ આવ્યો. ધીજાની નિંદા કરવાના સ્વભાવવાળો ચારુદૂષના ધરમાં બેસી છાની રીતે પોતાની ખીની આગળ રાજની નિંદા આ પ્રમાણે કરતો હતો. “ રાજ મહનપાળ નઢારો છે. તેના ડેખી સ્વભાવથી દોડો વ્રાસ પામી તેને ગાળો આપેછે.” આ અધ્યાં વચ્ચન રાજએ કાનોકાન સાંલઘયાં. તરત રાજ પોતાના દરખારમાં આવ્યો, અને સવારે તેણું ચારુદૂષને માણુસો મેંકલીને પકડાવ્યો. પછી રાજ મહનપાળે કોધથી ચારુદૂષને મારી નાખ્યો.



સારથોધ.

ધીજાની નિંદા કરવાથી ચારુદૂષના જેવા હાલ થાય છે, માટે કોઈ શાખકે ધીજાની નિંદા ન કરવી જેધાંચે.



સારાંશ પ્રશ્નો.

- ૧ ખાસ કરીને ડેાની નિંદા કરવી ન જેધાંચે ?
- ૨ આપણા શાખમાં નિંદા કરતારને માટે શું લખે છે ?
- ૩ ચારુદૂષનો નઢારો સ્વભાવ કયો હતો ?
- ૪ મહનપાળ ચારુદૂષને શા માટે માર્યો ?



પાઠ ૧૭ મો.

આવક પ્રમાણે ખર્ચ રાખવું.

ગૃહસ્થ શાખકે હસેશાં પોતાની આવક પ્રમાણે ખર્ચ રાખવો

આવકથી વધારે ખર્ચે રાખવો ન જોઈએ. પોતાની આવકમાંથી કે ખર્ચે કરવો હોય, તે ત્રણું પ્રકારે કરવો. પ્રથમ પોતાને ભરણું પોષણું કરવા ચોણ્ય કે કુદુંખનાં માણુસો હોય, તેના ભરણું પોષણુંને માટે એક લાગ ખર્ચવો, એક લાગ ધર્મતથા પોતાના ઉપલોગમાં ખર્ચવો, અને એક લાગ ખચાવીને સંબહમાં રાખવો. આવી રીતે ત્રણ ભાગે પોતાની આવકની ગોઠવણું કરવી. તેવી ગોઠવણુથી ગૃહ-સંસ્કરમાં ચાલનારો માણુસ સર્વ રીતે સુખી થાય છે. જે તે ગ્રમાણે ન વર્તે તો, ગૃહસ્થનો સારો વ્યવહાર ચાલતો નથી, અને તે હુદ્ધી થાય છે. આવક ગ્રમાણે ખર્ચે નહીં રાણનાર માણુસ, ઉમેદચંદની જેમ અતિશય હુદ્ધી થાય છે.

ધર્મપુરમાં ઉમેદચંદ કરીને એક વેપારી હતો. તે હુદ્ધનો કોળો અને વ્યવહારમાં ગોટાળો કરનારો હતો. તેની હુકાન સારી ચાલતી, પણ ખર્ચનો નિયમ ન હતો. દરમાસે તેને સો રૂપિયાની આવક હળી, અને દોઢસોનો ખર્ચ થતો હતો. આ ગ્રમાણે કેટલોક વખત ગોટાળો ચાલતાં તેની હુકાનમાં મોટો આડો પડયો. એક વખતે તેના વિશ્વાસી વાણોતરે આવી જણાંયું કે, શોઠ ! હવે હુકાન ચાલે તેમ નથી. કારણું કે, આપણી હુકાનમાં મોટી આધ છે. ઉમેદચંદ એલયો-આપણે શેરીની આધ હોય ? દરમાસે સો રૂપિયાની આપણે આવક છે. વાણોતરે કહું, શોઠજી ! તમે સો રૂપિયાની આવક મનમાં લાવીને ધરણું ખર્ચ કરોછો, તેની હુદ્ધ રહેતી નથી. પચાસ રૂપિયાનું તો તમારા ધરનું ખાનગી ખર્ચ છે. તેનો તો કાંઈ હિસાબ-જ નથી. પચવીશ રૂપિયા નોકરનું ખર્ચ છે, અને પચાસ રૂપિયા ધરનું ઉધાડું ખર્ચ છે, તે શિવાય તમે પરચુરણ ખર્ચ કરોછો, તે તો જુદું. આવી નહારી રીતથી આપણુંને દરમાસે મોટો આડો પડે છે.

તે સાંલણી શેડ ઉમેદચંદ ચિંતાતુર થયો. પછી લેણુંદારોએ તેની તમામ મીનકત કણજે કરી લીધી, અને આખરે સો ઇપિઅની આવકાળા ઉમેદચંદને વેર વેર લીખ માળીને પોતાના કુટુંબનું પોષણ કર્યું પડ્યું.

સારથોધ.

દરેક ગૃહસ્� આવકે પોતાની આવક પ્રમાણે ખર્ચ રાખવો અને ઘરના વેળેવારની ગોઠવણું બરાળર રાખવી, આવક કરતાં વધારે ખર્ચ રાખવાથી ઉમેદચંદની જેમ હુંઓ થાય છે.

સારાંશ મેનો.

૧ ખર્ચ શા પ્રમાણે રાખવો જોઈએ ?

૨ પોતાની આવકમાંથી કેટલા પ્રકારે ખર્ચ કરવો ?

૩ આવક જાપરાંત ખર્ચ રાખવાથી શું થાય છે ?

૪ ઉમેદચંદને કેટલી આવક હતી ? અને ખર્ચ કેટલું હતું ?

૫ આખરે ઉમેદચંદને શું થયું હતું ?

પાઠ ૧૮ મો.

પહેરવેપ.

ગૃહસ્થ આવકે પોતાની સ્થિતિ પ્રમાણે પહેરવેષ રાખવો જોઈએ. આપણામાં કહેવત છે કે, “શોભાતું અને ચાંપડતું પહેરસું.”

ઘેરવેષ રાખવામાં પૈસો, ઉમ્મર, સ્થિતિ અને નિવાસ એ ચાર આખત જોવાની છે. ઘેરવેષ ઘેરતાં માણુસે વિચારવું કે, “આપણી પાસે કેટલો પૈસો છે, આપણી કેટલી ઉમ્મર છે, આપણે કેવી સ્થિતિમાં છીએ, અને આપણે કયા દેશમાં રહીએ છીએ, આ ચાર આખતનો વિચાર કરીને માણુસે પોતાનો વેષ રાખવો જોઈએ. તેવો વિચાર કર્યા વગર પોતાની ભરળું પ્રમાણે ઘેરવેષ રાખે તો કોકો હુંસી કરેછે. અહિં એટલું પણ જોવાનું છે કે, જો આપણે સારી સ્થિતિમાં હોઈએ, અને નડારો દેખ ઘેરીએ, અને નડારો સ્થિતિમાં ઊંચી જતનો વેષ ઘેરીએ, તો તે પણ અધિત્ત છે. માટે જે સ્થિતિમાં હોઈએ, તેના પ્રમાણમાં ઘેરવેષ રાખવો જોઈએ. સારી સ્થિતિ છતાં નડારો વેષ રાખવાથી શું થાય છે, તેને માટે એક અમૃતચંદ્ર નામના શ્રાવકની વાત બોધ લેવા લાયક છે.

મથુરાપુરીમાં અમૃતચંદ્ર નામે એક લોલી શ્રાવક હતો. તે સારી સ્થિતિમાં હતો, તથાપિ લોલને લઈને નડારો વેષ રાખતો હતો. તેના ઘેરવાનાં લુગડાં જાપર ધણી થીગઢીએ રહેતી. અને તે પણ ધણ્ણા મેલાં રહેતાં, તે ધનવાન છતાં રાંકના લેવો દેખાતો હતો. તેને જોઈ કોકો તેની હુંસી કરતા, અને ધણીવાર અપમાન પણ કરતા હતા. એક વખતે મથુરાના રાજાના દરખારમાં ધણી હુંંધ છુટતાં રાજાએ એકદમ તેની તપાસ કરવા માંડી. તપાસ કરતાં માત્રમ પહુંચું કે, ગંદા પાણીની ખાળમાં કોઈ મોટું ગ્રાણી ભરી જવાથી તે હુંંધ આવેછે. રાજાએ તે ખાળ સાઝે કરાવવા માણુસોને આજા કરી કે, ગમે તે હુલકા માણુસને વેઠે પકડી અત્યારે અહિં લાવો. રાજાનાં માણુસો તેને માટે છુટ્યાં, અને કેટલાએક હુલકા લોકોને પકડી લાવ્યા. મેલો વેષ રાખનારો અમૃતચંદ્ર પણ તેમની સાથે

પદકડાયો, અમૃતચંદ્રે ધણું કહ્યું, પણ રાજનાં માણુસોને માનયું નહીં. દુર્ગાંધી ખાળમાં ખીલ વેડીઆનો સાથે અમૃતચંદ્રને પણ ઉતાર્યો. અધારોએ ભળીને તે મરેલ પ્રાણી ખાહેર કાઢ્યું. અને તેને ઉથ-કીને ગામની ખાહેર લઈ ચાલ્યા. રસ્તામાં ખીલ શ્રાવકોએ મરેલા પ્રાણીને ઉપાડી ચાલેતા અમૃતચંદ્રને જોયો, અને તે વાતની તેના દીકરાઓને ખખર રરી. દીકરાઓએ રાજનાં આગળ આવી તે વાત જહેર કરી, એટલે દયાળું રાજનો અમૃતચંદ્રને ખોલાયો, અને તેને માટે પેતાનાં માણુસોને ઠપકો આપ્યો. માણુસોએ કહ્યું, સાહેણ ! અંતે તેને હુલકા વેષ ઉપરથી પકડાયો હતો શ્રાવક છે એમ અમે જાણ્યું નહીં. કારણું શ્રાવક હોય તે આવો ગાંઢો વેષ રાખે નહીં. તે પછી અમૃતચંદ્રને રાજનો સારો વેષ રાખવા કહ્યું, અને રાજની વાત કખુલ કરી અમૃતચંદ્ર વેર આવ્યો. આખા ગામમાં અમૃતચંદ્રની ધણી ફૂજેતી થઈ.

સારાધે.

સારી સ્થિતિ છતાં નઠારો પેહેરવેષ રાખવાથી અમૃતચંદ્રના જેવી સ્થિતિ થઈ પડેછે.

સારાંશ પ્રશ્નો.

- ૧ થહુસ્થ શ્રાવકે શા પ્રમાણે પેહેરવેષ રાખવો જોઇએ ?
- ૨ પેહેરવેષ રાખવામાં કેટલી બાણત જોવાની છે ?
- ૩ પેહેરવેષ પેહેરતાં માણુસે શું વિચારવું જોઇએ ?
- ૪ મરજુ પ્રમાણે પેહેરવેષ રાખવાથી શું થાય ?
- ૫ મનુશાળુને અમૃતચંદ્ર ડેવો વેષ રાખતો ?
- ૬ અમૃતચંદ્રને માય શું થયું હતું ?

પાઠ ૧૯ મો.


ગૃહસ્� આવકના સામાન્ય ધર્મ વિષે કંવિતા.

સવૈયા એકત્રીશા.

ન્યાયથકી ધન આપ કમાયે, કુળ શોલમાં સરણા ૧સાથ,
વિવાહ કરવા ૨અન્ય ગોત્રમાં, ધરતા ધર્મ વિચારી ખાથ;
નિત્ય વખાણે સદાચારને, ૩અંતરના છ શત્રુ હણ્ણાય,
તેજ ગૃહસ્થ ખરો આવક સુત, વીરધર્મને ચોંચ ગણ્ણાય. ૧

ઇદ્રિયનો જય કરવા તત્પર, વિશ્વ લરેલાં છોડે સ્થાન,
ધર ખાંધી રહે સુંદર સારાં, ઘોશમાં ૪સગવડનું માન;
પાપથકી જે ઉરતા રહે છે, પ્રીતે દેશાચાર પળાય,
તેજ અહસ્થ ખરો આવક સુત, વીરધર્મને ચોંચ ગણ્ણાય. ૨

નહિ પરનિંદા કદી કરે મુખ, રાજ ૫પ્રમુખની તેમાં ખાસ
ખેંચ કરે આવક પ્રમાણે, રાણી નિત્યે ખરી તપાસ;
વેષ ધરે ન વૈલવ પ્રમાણે, આછકલાધ ધરે જરાય,
તેજ અહસ્થ ખરો આવક સુત, વીરધર્મને ચોંચ ગણ્ણાય. ૩



૧ કુળ તથા શોલમાં જે સરણા હેઠ તેની સાથે. ૨ ખીજ ગોત્રમાં
૩ કામ, કોધ, લોભ, માન, અદ અને હર્ષ. એ છ શત્રુ અંદરના ગણ્ણાય
છે. ૪ ખધી જતની સગવડના માપ પ્રમાણે. ૫ રાજ વિગેરેતી તો ખાસ
કરીને નિંદા ન કરવી.

પાઠ ૨૦ મૌ.

માણાપુની સેવા.

શ્રાવકે પોતાનાં ઉપકારી માણાપની સેવા કરવી જોઈએ. ત્રણે કાળ માણાપને પગે લાગયું, અધારહેવારનાં કામમાં માણાપની આજા દેવી, ચુગંધ, કુલ, ઝળ અને ણીજી ખાવાની વસ્તુઓ માણાપની આગળ ધરવી. કહિપણું તેમની આજા અને ચોણગવાં નહીં. એ માણાપની સેવા અથવા પૂજા કહેવાય છે. માણાપને ભાડે કેન શાસ્ત્રમાં લખ્યું છે કે, સોનાના સિંહાસન ઉપર ઐસાડીને દરરોજ પૂજા સેવા કરે, તોપણું માણાપના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. તેમનું અન્ય ધર્મનાં શાસ્ત્રોમાં પણ લખેલું છે કે, દર્શા ઉપાધ્યાય જેવા એક આચાર્ય ગણ્યાય છે. સો આચાર્ય જેવા એક પિતા ગણ્યાય છે, અને સો પિતા જેવી એક ભાતા ગણ્યાય છે. તેથી હુમેશાં માણાપને વધારે ભાન આપયું, અને તેમનું કહ્યું માનનું. માણાપનું કહ્યું નહિ ભાનનાર ગોવિંદ ધર્ષણો હુંખી થયો હતો.

રાજ્યપર નામના એક ગામમાં જયચંહ કરીને એક શ્રાવક રહેતો હતો. તેની સ્ત્રીનું લામ પ્રેમા અને દીકરાનું નામ ગોવિંદ હતું. ગોવિંદ તેમને એકને એક દીકરો હતો, તેથી તે લાદમાં ઉછ્યો હતો. ગોવિંદ જયારે ઉમર લાયક થયો, ત્યારે તેનાં માણાપ વૃદ્ધ ઉમરનાં થયાં. ઘડપણું લઈને જયચંહ અને પ્રેમા અશક્ત થઈ ગયાં. ઉક્તાં ઐસતાં તેમને ધર્ષણી મેહેનત પડવા લાગી. માણાપ કાંઈપણ કામ જતાવે, ત્યારે ગોવિંદ ના કહેતો, અને સામું પોલતો હતો. કિટલીક વાર તો તે બિચારાં કરગરીને કહેતાં, તોપણું કુશું

ગોવિંદ તેની દરકાર કરતો નહીં, એમા માંડ માંડ પળ ધસરડી ધરનાં કામ કરતી, પણ નિર્દ્ય ગોવિંદને તેની જરાપણ હ્યા આવતી નહુંતી.

ગોવિંદ ઉછાંછળો, તોરી અને લહેરી હતો. કેાઠ પણ મોટા અકસ્માત્ બને તેમાં તે પતંગીયાની જેમ જંપલાતો હતો. તેનામાં હીમત વધારે હુંતી. એક વખતે રાત્રે જ્યાંદની પાણેશમાં મારા મારીનો મોટો કળુંચો થયો. લોકો લાકડીઓ, તથા હુથીઆરો લઈ તેમાં સામેલ થયા. આ વખતે ગોવિંદ તેમાં જવાને તૈયાર થયો. ગોવિંદને ત્યાં જતો જોઈ તેતાં વૃદ્ધ માણાપે કહું, એટા ગોવિંદ ! તું ત્યાં જઈશ નહિં. વખતે મારામારીમાં તને તુકશાન થશો, તોપણ ગોવિંદે માન્યુંનહિં. પ્રેમાળ માણાપને કરગરતાં મૂકી ગોવિંદ તે લદાઈમાં સામેલ થયો. ગોવિંદ જે કે માણાપની સેવા કરતો ન હતો, તોપણ સ્વાલાવિક રીતે સ્નેહ ધરનારાં જ્યાંદ અને પ્રેમાનો પુત્ર ત્યાં ગયો, તેથી તેની ચિંતામાં ઉંઘ આવી નહિં સવાર પડી ત્યાં ખખર સાંસાજ્યા કે, ગોવિંદ ધાયલ થયો છે, અને માણાપને મળવા માગે છે. તેનાં વૃદ્ધ માણાપ ધણી મુશીભૂતે ત્યાં આવી પહોંચ્યાં, અને પુત્રની આવી સ્થિતિ જોઈ રોવા લાગ્યાં. તે વખતે પસ્તાવામાં પડેલા ગોવિંદે કહું, માતા ! પિતા ! તમે અફ્સોસ કરશો નહિં. તમારી આજ્ઞા નહિં માનવાથી મારી આ દશા થઈ છે. જે ઉછાંછળા દીકરાયો માણાપતું કહું માનશે નહિં, તે મારી જેમ હુઃખી થઈ મરી જશો. આટહું કહું ગોવિંદે પોતાનો પ્રાણું છાડી દ્વારા.

સારથાધ.

હરેક શ્રાવકે માણાપની સેવા કરવી જોઈએ, અને તેમની આજા પ્રમાણે વર્તિબું જોઈએ, માણાપની આજા પ્રમાણે નહિ વર્તવાથી ગોવિંદની માઝક હુણી થઈ મરી જવાય છે.

સારાંશ પ્રશ્નો.

૧ શ્રાવકે માણાપને શું કરવું જોઈએ ?

૨ માણાપની આગળ શું ધરવું ?

૩ જૈન શાચ્ચમાં માણાપની સેવા માટે શું લખ્યું છે ?

૪ ધીન શાચ્ચમાં માણાપને માટે શું લખે છે ?

૫ ગોવિંદ કેવો છેકરો હતો ? અને તેનાં માણાપ ડેષુ હતાં ?

૬ ગોવિંદ શું કરવાથી મરી ગયો હતો ?

૭ ગોવિંદે મરવા વખતે શું કહું હતું ?

પાઠ ૨૧ મો.

કદર જાણવી.

શ્રાવકમાં કદર જાણવાનો શુણુ હોવો જોઈએ. ડોઇએ કરેલા ઉપકારનો બદલો આપવે, એ મોટામાં મોટો શુણુ છે. ધીનો કરેલા ઉપકારને ઉત્તમ પુરુષો જ્યાંસુધી તેનો બહલો ન આપી શકે, ત્યાંસુધી પોતાના માથા ઉપર તે એક મોટો ઘોળે ગણ્ણુ છે. આ ઉપર નાળીચેરના જાહનો દાખલો અપાથ છે. નાળીચેરના જાહને ને માણુસ પાણી પાઈ ઉછેરે છે, તે પાણી પાનાર આંખજને નાળી.

શૈશ્વી પોતાના જીવિત સુધી માથાપર મોટાં ફળનો ભાર ઉપાડી લઈ તેને અમૃત જેવું જળ આપે છે. સારા માણુસોએ એ નાળી ચેરનો દાખલો લઇને બીજાએ કરેલા ઉપકારને બુલી જવા ન જોકુંએ. કરેલા ઉપકારનો બદલો આપનાર શુલદાસ નામના શ્રાવકનો હાખલો ઘણો આધદાયક છે.

અંદ્રપુરમાં શુલદાસ નામે એક શ્રાવક રહેતો હતો. તે ઘણો ખર્મી અને પવિત્ર મનનો હતો. કોઈયિષુ કામનો બદલો આપવો, એ તેનો સુખ્ય સ્વભાવ હતો. કોઈએ સાધારણુ કે ભારે કામ કર્યું હોય ત્યારથી તેના મનમાં તેનો બદલો વણવાની ચિંતા થતી હતી. એક વખતે શુલદાસ દેરામાં પૂજા કરવા ગયો. પૂજા કરતાં તેણું પ્રભુની આગળ દીવો કર્યો. તે વખતે ધનદાસ નામે કોઈ બીજે શ્રાવક પણ જિન પૂજા કરવાને આવ્યો હતો. દીવાની વાટ શુલદાસના ઓઠેલા વસ્ત્રને અડી ગઈ, તેમાંથી મોટો ભડકો થયો. તે વખતે ધનદાસ હીમિત કરી આગળ આવ્યો, અને તેણું પોતાના હુથવડે શુલદાસના વસ્ત્રનો ભડકો ખુલ્લાવી હીધ્યો, ધનદાસના હુથ એવા હાઓ ગયા કે, તે એક માસે રૂઝાઈને સાળ થયા હતા. ધનદાસ જો આવી પહેંચ્યો નહેાત તો શુલદાસ અભિધી હાજી ભરી જત. શુલદાસે ધનદાસનો મોટો ઉપકાર આન્યો, અને તે ઉપકારનો બદલો આપવાના સારા અવસરની રાહ જોઈને રહેવા લાગ્યો. ધનદાસ શુલદાસના ઘરની નજીક રહેતો હતો. તેની સ્થિતિ નભળી હતી. શુલદાસ પણ સાધા રણું સ્થિતિનો હતો, એક વખતે રાત્રે ઘણો વર્ષાદ પડવા લાગ્યો. પવનના અપાટાથી ઘણું લોકોનાં ધરો પડતાં હતાં, આ વખતે ધનદાસનું જુંપડ જેવું ધર પણ પડવાની તૈયારીમાં હતું. શુલદાસે તે વખતે વિચાર કર્યો કે, આવા લાયંકર વર્ષાદમાં મારા ઉપકારો

ધનદાસની શી સ્થિતિ હુશે ? ચાલ તેની તપાસ કરૂં. આવું વિચારી તે ધનદાસને વેર આવ્યો, અંધારું વોર હતું. ધનદાસતુંધર પડવાની તૈયારીમાં હતું. મજબુત ખાંધાનો શુલદાસ આવી ધનદાસના છાપરાના લાકડાને ટેકો આપી ઉલો રહ્યો. વર્ષાદ એક પહોર સુધી ઘોધ અંધ પડ્યો. સવારે ધનદાસે બીજુ તરફ નમી પહેલું ધર જેયું, અને નથાં પોતે એકો હતો, તે છાપરાને ટેકો આપી ઉલેલો શુલદાસ પણ તેના જેવામાં આવ્યો. શુલદાસે ટેકો આપ્યો નહેત તો, ધનદાસ દટાઈને ભરી જત. પોતાના ઉપકારનો બદલો. આ ગ્રમાણુ વાળેલો જેઠ ધનદાસ ધણું ખુશી થયો, અને શુલદાસના એ ગુણુની ઘણી પ્રશ્નાસા કરવા લાગ્યો.



સારથ્યોધ્ય.

દરેક શ્રાવકે શુલદાસની જેમ કદર જાણવાનો મોટો ગુણું રાખવો જેઠચો, કરેલા ડામનો બદલો. આપવો, એ મોટામાં મોટો ગુણું છે.



સારાંશો પ્રશ્નો.

- ૧ મોટા લોકો બદલોન વાળે ત્યાં સુધી કેખું માને છે ?
- ૨ નાળીઓરનો હાખલો આપી સસજાવો.
- ૩ શુલદાસ અને ધનદાસતું દૃષ્ટાંત શું છે ?
- ૪ ધનદાસે શુલદાસનો શો ઉપકાર કર્યો હતો ?
- ૫ શુલદાસે તેનો ડેવી રીતે બદલો. આપ્યો હતો ?



પાઠ ૨૨ મો.

અજુર્ણ હોય તો જમવું નહિ.

જેમ આવકને કેટલાંએક ગુણ, ધમે તથા બ્યવહારને લગતા રાખવાના છે, તેમ તેણે પોતાના શરીરની આરોગ્યતાને માટે પણ કેટલાક ગુણ રાખવાના છે. અગાઉ જમેલો ઐરાક ખરાખર પદ્યો ને હોય, ત્યારે જમવું ન જોઈએ. અપચાથી અજુર્ણ રહે છે. અને તેમ છતાં જો જમવામાં આવે તો, શરીરમાં અનેક જાતના દોગ ચેદા થાય છે. અજુર્ણ રહ્યાની નીચેની નિશાનીઓ છે. ૧ આડામાં કોણી ગચેલી છાસના જોવી વાસ આવે છે, ૨ આડો હુમેશના કરતાં જુદો આવે છે, ૩ શરીર ભારે રહ્યા કરે છે, ૪ ઝચિ થતી નથી, ૫ ખરાખ ઓડકાર આવ્યા કરે છે. તે સિવાય અજુર્ણથી સુધી, અકવાદ, ઉલટી, મોળ અને એચેની થાય છે. કોઈ કોઈ વાર સનેપાત થદુ ભરણુ પણ થદુ જાય છે. તેથી ગૃહદ્ય શ્રાવકે અજુર્ણમાં કદી પણ જમવું નહિ. અજુર્ણમાં લોજન કરવાથી હરિહર નામના એક આહાણુના જોવા ખરાખ હાલ થાય છે.

વર્ષમાન નગરમાં હરિહર નામે એક પ્રાહ્યણ હતો. તેને આવા ઉપર ધણી પ્રીતિ હતી, જો કોઈ ઠેકાણે મીઠો પહાર્થી આવાનો મણે તો, તે હજર કામ સુકીને જમવા જતો હતો. વર્ષમાન નગરના દોકાં તેને ગ્રેતશ કર્યાના નામથી બોલાવતા હતા. હરિહરના બાપનું નામ લીલાધર હતું, લીલાધર પ્રાહ્યણ જાતિના સ્વલ્પાવને લઇને જમવાનો શોખી હતો, પણ તે શરીરની આરોગ્યતા કેમ રહે, તે સમજતો હતો. હરિહરની જુઆળ વૃત્તિ નેઈ તેને તે ધણીવાર હય-

ડો આપણો હતો. એક વણતે હરિહર પોતાના કાઉં યજમાનને વેર જમવા જતો હતો. તેનો બાપ લીલાધર તેની સાથે હતે, રસ્તામાં હરિહરને એકાએક ઉલટી થદ આવી, અને તેના માથામાં ચઢી આવી. લીલાધર તેને પોતાને વેર પાછા લઈ ગયો અને તેને ઘરમાં સુવાડી ચોતે એકલો યજમાનને વેર જમવા ગયો. થેડો વાર થયા પછી હરિહર ઘરમાં પથારીસાંથી સાવધાન થદ એઠો થયો. અને પોતાના બાપને બોલાવા લાગ્યો. તે વખતે હરિહરની મા ઘરમાં હતી, તે આવી અને કહેવા લાગી કે, દીકરા ! સુઈજ. તારા બાપ હુમણું આવશે. હરિહરને જમવાની વાત યાદ આવી. અને તે બોલ્યો, બા ! મારા બાપા જમવા ગયા છે, અને મારે પણ ત્યાં જલ્દું છે. તેની માઓ કહ્યું, લાઈ ! તારી તણીયત ઢીક નથી, તને અળુણું થયું છે, માટે જમવા જવાય નહીં. હરિહરે પોતાની માતું વચ્ચન માન્યું નહીં, અને ઉઠીને જમવા ચાલ્યો ગયો. લીલાધરે પણ ધાણું વાર્યો, તથાપિ કોઈતું માન્યા વગર તે જમવા એઠો, અને વેર આવી તેજ રાતે તેને તાવ તથા સનેપાત થદ આવ્યો, કેથી તે સવારે ભરી ગયો.

સારણોધિ.

અળુણું ઊપર જમવાથી હરિહરના જેવા હાલ થાય છે, માટે કેઝ શ્રાવકે અળુણું ઊપર લોજન કરું નહીં.

સારાંશ પ્રશ્નો.

૧. આવકે શરીરની આરોગ્યતાને માટે ક્યા શુણું રાખવાના છે ?
૨. શરીરમાં અનેક જાતના દોગ કયારે થાય છે ?

- ૩ અળુણ્ણ રહેવાની શું નિશાની છે, અનેતે કેટલી છે ? તે કહો.
- ૪ હરિહર આદ્યણુને શું થચું હતું ?
- ૫ હરિહરનું મોત શાથી થચું હતું ?

—*—*—

પાઠ ૨૪ મો.

વખતસર જમણું.

થહુસ્થ શ્રાવકે હુમેશાં જમવાને નિયમ રાખવો. કે વખતે ખરાખર લુખ લાગે તેજ વખતે હુમેશાં જમણું. કે ખાવાના પદાર્થોએ પોતાની તથીયતને માઝું આવતા હોય, તેવાજ પેદાર્થો જમવા. તે પણ પોતાની ઇચ્છિ પ્રમાણે જમવા. ઇચ્છિ ઉપરાંત વધારે જમણું નહીં. તેમજ પોતાનાથી કેટલું પચાવી શકાય, તેટલું જ જમણું. ઇચ્છિ ઉપરાંત વધારે જમવાથી ઉલટી અને આડો થઈ જાય છે, અને વખતે ભરણું પણ થાય છે. વખતસર નહીં જમવાથી અને ઇચ્છિ ઉપરાંત જમવાથી માધવના જેવી ઝુરી દશા થાય છે.

રવિપુરમાં માધ્યમ નામે એક આજિકણ છોકરો હતો. તેને ખાળપણુથીજ કે તે ખાવાની નઢારી ટેવ પડી હતી. આપો હિવસ ખાવામાંજ તેનું મન રહેતું હતું. ઘડીએ ઘડીએ આવાનું માગ્યા કરતો હતો. તે મોટી ઉમ્મરનો થયો, તોપણું એ નઢારી ટેવ તેનામાંથી ગઈ નહીં. પછી તે માધ્યમ એક હુકાનનો શેડ થયો. કેટલાએક વાળોતરો તેના તાળામાં આવ્યા. આવી સોટાઈ છતોં તે આજિકણ રહ્યો હતો. સવારથી સાંજ સુધીમાં તે વખત ઘેવખત ખાણું દેતા,

અને રૂચી ઉપરાંત ખોજન કરતો હતો. એક વખતે માધવ વેપારના કામમાં પડેલો, તેથી તેણું કે તે ખાઇને આજો દિવસ કાઢ્યો, તેણું તે દિવસે નિયમસર ખાણું લીધું જ નહીં. પોતાની તથીયતને માફક ન આવે તેવા પદ્ધાર્યો ખાવાથી તેના પેટમાં ભાર રહ્યો, અને તેમાંથી તેને આડાનો લારે રોગ થઈ પડ્યો. આખરે તેજ રોગમાં તે ચોતાનો ગ્રાણ જોઇ એઠો.



સારઘોધ.

૧ દરેક વૃહત્સ્થ શ્રાવકે વખતસર અને રૂચી અમાણું ખાણું કરવું જોઇએ. તેમ નહિ કરવાથી માધવની જેમ ભરવું પડે છે. દરેક છોકરાએ ખાળપણુથી આઉકણપણુનો નહારો સ્વલાવ ન રાખવો જોઇએ.



સારાંશ પ્રશ્નો.

૧ ગૃહસ્થ શ્રાવકે જમવાને માટે શું કરવું જોઇએ ?

૨ કયારે અને કેવા પદ્ધાર્યો જમવા ?

૩ કેટલું અને કયાં સુધી જમવું જોઇએ ?

૪ રૂચિ ઉપરાંત જમવાથી શું થાયછે ?

૫ માધવ કોણ હતો, અને તે કેવો હતો ?

૬ માધવને નહારી ટેવ શું હતી, અને તે કયાં સુધી રહી હતી ?

૭ માધવનું ભરણ શાથી થયું હતું ?



પાઠ ૨૪ મે.

વૃદ્ધની સેવા.

ગૃહસ્થ શ્રાવકે હુમેશાં વૃદ્ધ ભાણુસેની સેવા કરવી. વૃદ્ધ ભાણુસેને જીછને બેડા થવું, તથા તેમની સાસે જીછને વિનયથી નમન કરવું, અને તેમની આજા પ્રમાણે ચાલવું, એ તેમની સેવા કહેવાય છે. તેવા વૃદ્ધ ભાણુસની સેવા કરવાથી સારો ઉપદેશ મળે છે, અને તેમનાં ફર્શનથી પુણીય થાયછે. કે આપણાથી શાનમાં ચંદ્રીઆતા હોય, કે આપણાથી ધર્મમાં ચંડીઆતા હોય અને કે આપણાથી ઉમ્મરમાં માટેરા હોય, તે વૃદ્ધ ગણાય છે. વૃદ્ધોની સેવા કુર્ચાથી કેટથો લોલ થાય છે, તેનો દાખલામાં લધુચંદ્રની વાર્તા નાણુવા જેવી છે.

પાદલિખિત નગરમાં ધર્મદાસ નામે એક શ્રાવક હતો. તેનામાં તેના નામ પ્રમાણે શુણુ હતા. પોતે ધર્મી હતો, અને પોતાના કુટુંબમાં બધા ધર્મી થાય, એવું તે ધર્મિઓ હતો. હુમેશાં અસુક વખત સુધી તે પોતાના કુટુંબનાં ભાણુસેને ધર્મનો બોધ આપતો અને બધાને ધર્મમાં પ્રવર્તીવિતો હતો. તેને પ્રણુ દીકરા અને એ દીકરીઓ થઈ હતી. પ્રણુ દીકરાઓમાં લધુચંદ્ર નામે એક સૌથી નાનો દીકરા હતો. લધુચંદ્ર આળપણુથીજ જડ અને ગાંડા કેવો હતો. ધર્મદાસે પોતાના બધા કુટુંબને ધર્મી બનાવ્યું પણ લધુચંદ્ર તેવોને તેવોજ રહ્યો. લધુચંદ્ર સોળ વર્ષનો થચો, તોપણ તેને નવકાર મંત્ર આવડતો નહોતો. આથી ધર્મદાસને ધણી ચીતા થવા લાગી. પોતાના ધર્મી કુટુંબમાં લધુચંદ્ર જડ રહ્યો, તેને માટે તેણું અનેક ઉપાયો શોખવા માંડયા, પણ કેદી ઉપાય સુજચો. નહીં, એક વખતે

કંઈ પંડિત ત્યાં આવી ચઢ્યા. તેની આગળ ધર્મહાસે લધુચંદની વૃદ્ધની સેવામાં રાખ, તો તે જલદી સુધરશે. પંડિતના કહેવાથી ધર્મહાસે લધુચંદને વૃદ્ધની સેવામાં રાખ્યો. થાડ વખતમાં વૃદ્ધની સેવાના પ્રભાવથી લધુચંદ સુધરી ગયો. તેનામાં ધર્મ, આચાર, નીતિ, વિનય અને વિવેક વિગેરે કેટલાએક ઉત્તમ ગુણો આવી ગયા, તેની જડતા નાશ પામી, અને સારી ઝુદ્ધિ પ્રજાના થાયા.



સારથોધ.

દરેક બહુસ્થ શ્રાવકે વૃદ્ધ માણુસની સેવા કરવી. વૃદ્ધની સેવાથી લધુચંદના જીવો જડ માણુસ પણ સારી ઝુદ્ધિવાળો થાયા.



સારાંશ પ્રશ્નો.

૧ વૃદ્ધ કોને કહેવાય ?

૨ વૃદ્ધ માણુસોની સેવા કેવી રીતે થાય ?

૩ વૃદ્ધની સેવાથી શોશો લાભ મળે ?

૪ ધર્મહાસ હાણુ હતો, અને તે કેવા વિચારનો હતો ?

૫ ધર્મહાસે લધુચંદને શી રીતે સુધાર્યો ?

૬ આખરે લધુચંદ કેવો થયો ?



પાઠ ૨૫ મો.

નિંદવા ચોણ્ય કામ કરવાં નહિ.

બહુસ્થ શ્રાવકે કદ્દ પણ નિંદવા ચોણ્ય કામ કરવાં નહિ.

કામ આદ્વિક અને પરલોકમાં અનાદર કરવા ચોગ્ય હોય, તે નિઃદ્વા ચોગ્ય કહેવાય છે. દાડુ પીવો, માંસ આવું અને પરસ્કી સેવાવી એ અધાં નિંદ્વા ચોગ્ય કામ છે. અથવા જે કામ કરવાથી લોકમાં નિંદા થાય, તે અધાં નિંદ્વા લાયક કામ છે. એવાં નઠારાં કામમાં શ્રાવકે પોતાના મન, વચ્ચન અને કાયાને જોડવાં નહીં. કુલીનપણું સારા કામથીજ જણાય છે. કદિ હુલકી જાતિમાં થચેલ હોય, પણ જે તેનાં કામ સારાં હોય તો તે જાંચો ગણ્યાય છે અને સારી જાતિમાં થચેલ હોય પણ જે તેનાં કામ નઠારોં હોય તો તે હુલકો ગણ્યાય છે. સારા કુળને અને સારી રીતે આખરું પામેલો માણ્યુસ નિંદ્વા લાયક કામ કરવાથી કેવો અનાદર યાસે છે, તે જીપર ચપદચંદ શેડની વાર્તા જાણવા જેવી છે.

તિલકપુરમાં ચપદચંદ નામે એક શેડીએ હતો. તે પોતાના આપઢાદાથીજ સંઘમાં સારી આખરું પામેલો હતો. લોકો તેના કુળની તરફ જોઇને તેને સારું ભાન આપતા હતા. તેની સ્થિતિ સારી હતી. તેના ધરનો નિર્વાહ એક સારા ગૃહસ્થની માઝુક ચાલતો હતો. આટણું છતાં પણ તેનામાં કેટલાએક હર્ઝણો છુપી રીતે રહેવા હતા. પૈસાનો તે લોલી હતો અને હમેશાં વધારે પૈસાદાર થવાની ધારણા રાખતો હતો. ગમે તેવું ખરાખ કામ હોય, પણ જે તેમાંથી પૈસાનો લાક થતો હોય, તો તે કામ કરવાને આગળ પડતો હતો. પણ કેટલીકવાર પોતાની જુની આખરું ને લઈને તેવું કામ કરતાં તે ડર આતો હતો. એક વખતે એવું અન્યું કે, પિંગલા નામની કોઈ વેશ્યા તે ગામમાં રહેતી હતી. કેશવ નામનો એક શાહુકારનો દીકરો ધરમાંથી મોટી ચોરી કરીને તે વેશ્યાના ધરમાં છુપી રીતે રહ્યો હતો. કેશવના ખાપે શક ઉપરથી તે પિંગલાના ધરની જડતી લેવા

વિચાર કર્યો. આ અખર આગાઉથી પીંગલાના લાણુવામાં આવી એ-
ટદે તેજ રાતે કેશવને લઈ પીંગલા એને ડેકાણે છુપાવા નીકળી.
દ્વારા ચચ્ચાંદના ધર આગળ પસાર થઈ એટદે ચચ્ચાંદને તેને
પુછ્યું છે, તું કોણ છે અને કૃતાં લય છે ? પીંગલાએ કહ્યું કે,
આ ભાણુસને કે આજની રાત છુપી રીતે રાખે તેને યાંચસો ર-
પીઓ આપવાના છે. ચચ્ચાંદ તે વાત સાંલળી લલચાયો. અને
કેશવને પોતાના ધરમાં રાખ્યો. પછી પીંગલા પોતાના ધરમાં આકી
ગઈ. પોલીસના ભાણુસોએ પીંગલાના ધરમાં જઈને તપાસ કરી
અને ઘણી ધમકી આપી. છેવટે પીંગલા હરથી સાચી વાત માની
ગઈ અને તેણીએ ચચ્ચાંદ શેડતું ધર ણતાંયું. પોલીસના ભા-
ણુસો પીંગલાને લઈને ચચ્ચાંદ શેડને વેર આંયા અને તપાસ
કરી ત્યાંથી કેશવને પકડ્યો. પછી પોલીસે ચચ્ચાંદના કુદુંખના
ભાણુસોને બાહેર કાઢી તેના ધરને જમ કર્યું અને ચચ્ચાંદને બાં-
ધીને રાજની પાસે લઈ ગયા. આ નિંદવા લાયક કામ કરવાથી
ચચ્ચાંદની મોટી ઝૂલેતી થઈ. રાજને તેની જુની આખરૂને લઈ
ઓછી શિક્ષા કરી પણ કેશવે જેટલું ધન ચોર્યું હતું તે ણધું ચ-
ચ્ચાંદ આગળથી વસુલ કરાયું. ચચ્ચાંદ પૈસો અને આખરૂ
ણને શુભાવી અને ત્યારથી નાતમાં તે ધણોજ હલકો પડ્યો.

સારથીધ.

નિંદવાચેણ્ય કામ કરવાથી ચચ્ચાંદ ક્રવો આખરૂદાર શૃદુસ્થ
પણ હલકો પડો ગયો હતો, તેથી કોઈપણ શાવકે નિંદવા લાયક
કામ કરતું ન જોઈએ.

સારોશ પ્રશ્નો.

૧ નિંદવા ચોણ્ય કામ કર્યું કહેવાય ?

૨ સુખ્ય નિંદવા ચોણ્ય કામ કર્યાં ? તે કહો.

૩ જાંચ અને હુલકો ડેવી રીતે કહેવાય ?

૪ અપળચાંડ કેવો શેઠ હતો ?

૫ તેણે નિંદવા ચોણ્ય કામ શું કર્યું હતું ?

૬ નિંદવા ચોણ્ય કામ કરવાથી તેને શું થયું હતું ?

પાઠ ૨કુ મો.

ભરણ પોષણ.

ઘર માંડીને એટલા શ્રાવક અહુસ્થે નીતિથી પૈસો કર્માધિને
પોતાના કુદુંબનું ભરણ પોષણું કરવું જોઈએ. ભરણ પોષણ કરવા-
ને અવશ્ય કરીને ત્રણને લાયક ગણેલા છે. મા ખાપ અને નાતાં
છોકરાં. જે પોતાની સારી સ્થિતિ હોય તો પોતાના સગાવહાલાં,
આશ્રિત અને નોકરો ધણું ભરણ પોષણું કરવાને ચોણ્ય ગણેલાં છે.
નીતિશાસ્નમાં તેને માટે એટલે સુધી લગેલું છે કે, સારી સ્થિ-
તિવાળા ગૃહસ્થે પોતાના કુદુંબ ઉપરાંત દરિદ્રી મિત્ર, સંતાન
વગરની એન, પોતાની જાતીના વંદ્રો અને નઠારી સ્થિતિમાં
આવી પહેલ કુલીન માણુસ એટલાનું ભરણ પોષણ અવશ્ય કરવું
જોઈએ. દ્વારા અને પરોપકારી શ્રાવક ભરણ પોષણ કરવાને લા-
યક એવા જીધા માણુસેનું ભરણ પોષણ કરે છે અને તેમ કરવા-
થી કુલીનચંદ્રના જેવી સત્કૃતિ ચેળવે છે.

शांतीपुर नगरमां कुलीनयंड नामे एक आवक रहेतो हुतो।
 तेनी स्थिति साधारणु हुती, पण् प्रेतानी पवित्र इस्तने ते
 सारी रीते समजतो हुतो। तेने कमणा करीने एक श्री हुती। ते
 स्वलावे सारी हुती, पण् तेलीनामां लोक इरवानो स्वलाव हुतो।
 कुलीनयंडने दूर वर्ष पांचसो इपीचानी आवक हुती। आवकना प्र-
 भाषुमां ते प्रेताना कुदुंभतुं खर्च राखतो हुतो। डैर्पणु हुःपी
 भाषुस तेनी पासे आवतो तेने ते योग्य आश्रय आपतो अने
 प्रेताना रसोडामां जमाडतो हुतो। तेने आर दीकरा अने वणु दी-
 करीओ हुती। ते शिवाय णीज लाणूज लत्रीज पण् तेने वेर
 रहेता हुता। डैर्पणु साधमी लाई के संगां वहालां हुःपी थतां
 छाय, तेने ते प्रेताने वेर लावीने राखतो हुते। एक वर्षते ते
 देशमां भोटो हुकाण पडयो, धणां संगां वहालां कुलीनयंडने। आ-
 श्रय लेवा आ०यां। तेमने ते अनती रीते आश्रय पण् आपतो हुतो।
 आथी प्रेतानी आवकमांथी तेनो नलाव मांडमांड थवा लाग्यो।
 एक वर्षते तेनी श्री कमणाए एकांतमां कुलीनयंडने कहुं, स्वा-
 री। आप संगांवाहालांमे लेगां करी खवरावो छो, पण् हुने आपणु
 वर प्रोडांचे तेम नथी। कुलीनयंडे प्रेतानी श्रीने धीरज आपी
 कहुं, प्रिया ! हीमत राख, णधां सारांवानां थयो, ज्यां सुधी आ-
 पणु प्रेतांची शकीशु त्यां सुधी आ आम करीशु। हुःपी मित्र,
 एक जातीना भाषुसो अने साधमीलाईजो। ए यथा आपणु कु-
 दुंभनांज कडेवाय, तेवी रीते ताहूं अने आपणु छोकरतुं लरण्य
 प्रेतापु करवाने हुं णंधाअेक्या छुं, तेवीज रीते तेमतुं पण् प्रेतापु
 करवाने हुं णंधाअेक्यानुः। आपणु जांचा ऐराकने बहुते हुवडे
 ऐराक लमुशु पण् आ अपानो निर्वाह करीशु। कमणाए ते बात

માન્ય કરી અને તે હુકાળતું ખદું વર્ષ તેણે સર્વને લોજન કરાવી પાર ઉતારી દીધું. આવા અન્નદાનના પુષ્ટયથી તેજ વર્ષમાં તેને વેપારની અંદર મોટો લાલ થયો અને તે લાલના પૈસામાંથી તેણે પોતાના નામથી એક અનાથાશ્રમ ખાંડ્યું. તે “ કુલીનચંદ અનાથાશ્રમ ” એવા નામથી પ્રખ્યાત થયું. તેનો ઘણું ઢોકાયે આશ્રય લીધો, અને તેથી કુલીનચંદની સત્કીર્તિ સર્વ ઠેકાણે પ્રસરી ગઈ.



સારધોધ.

ભરણ પોષણ કરવા ચોણ્ય માણુસોનું ભરણ પોષણ કરવું એ અહસ્થ આવકની પેહેલી ફરજ છે. તે ફરજ બજાંયાથી કુલીનચંદ ની જેમ સારો કીર્તિ થાય છે.



સારાંશ પ્રશ્નો.

૧ ભરણ પોષણ કરવાને ડોણ ડોણ લાયક ગણ્યાય ?

૨ તેને માટે નીતિ શાસ્ત્રમાં શું કહેલું છે ?

૩ કુલીનચંદ કેવો અહસ્થ હતો ?

૪ તેની જી કમળા કેવી હતી ?

૫ કુલીનચંદે કેવી રીતે, કયારે અને ડોનું ડોનું ભરણ પોષણ કર્યું હતું ?

૬ કુલીનચંદે પૈસાના મળેલા લાલમાંથી શું કર્યું હતું ?



પાઠ ૨૭ મો.

વિચારીને કામ કરવું.

એક અહુદ્ય શ્રાવકે કાંઈપણ કામ કરવું હોય તો તે લાંબો વિચાર કરીને કરવું. વિચાર કર્યો વગર કાંઈપણ કામ કરવું નહોં. અવિચારે કામ કરવાથી મોટી હરકત આવી પડે છે. હરકોઈ કામ કરતાં ચેહેરાં તેનું પરિણામ જેવું અને પછી તેને માટે લાંબો વિચાર કરવો. લાંબો વિચાર કરી જોતાં જે તેનું પરિણામ સારું લાગે તો તે કામ અવસ્થય કરવું. વિચાર કર્યો વગર ઉતાવળથી કરેલા કામનું નગર્દ પરિણામ આવે છે. તે ઉપર હિંમતલાલ શે-ઠનો હાખદો ખરાખર ઓધ લેવા ચોણ્ય છે.

મખિપુરમાં હિંમતલાલ કરીને એક શેઠ હતો. તે એક કામ કરવામાં જાતાવળો હતો. તેના મનમાં કાંઈપણ વેહેમ પડે તો તે ઉતાવળથી તેનો નિવેડા લાવતો હતો. હિંમતલાલ શેઠને કાપડનો વેપાર હતો અને તે જારા પાયા ઉપર ચાલતો હતો. તેની હુકાને ઘણું વાણ્ણોતરો હતા. ચોતે પણ હુકાનના કામમાં ઘણ્ણો વખત રી-કાતો હતો. ચાંકે જમીને હુકાન ઉપર જતો તે અર્ધી રાને વેર આવતો હતો. મખિપુરની નજીક એક ગામમાં તેનો વિઠલ નામે સાસરો રહેતો હતો. તે પણ કાપડનો વેપારી હતો. ઘણીવાર કામ પ્રસ'ગે તે મખિપુરમાં આવતો અને ચોતાના જમાઈ હિંમતલાલ શેઠને વેર ઉત્તરતો હતો.

એક વખતે હિંમતલાલ શેઠનો સાસરો હિવસ અસ્ત થયા પછી રાને ચોતાના જમાઇને વેર આંણ્યો. હિંમતલાલ શેઠ હુકાતે હતો.

ફેકટ શોઢાણ્ણી એકલાં ઘેર હુતાં. વિઠલે પોતાની દીકરીની સાથે પો-
તાના ધરની વાત કહેવા માંડી. વાત છાની હોવાથી તેઓ છુપી
રીતે બોલતા હુતા. વાતની ભસ્યાલત કરતાં ધણ્ણી રાત ચાલી ગઈ.
હિંમતલાલ શેડ હુકાનેથી ઘેર આંદોલાં ધરમાં આવી જુવે ત્યાં
ખીજ પુરુષને પોતાની સ્ત્રી સાથે છુપી રીતે વાત કરતો જેયો. ત-
રતજ મનમાં વેહેમ પડ્યો. કાંઈપણ લાંબો વિચાર કર્યા વગર તેણે
પોલીસને ફરીયાદ કરી કે, મારા ધરમાં ડોઇ લુચ્ચો માણુસ પેઠો
છે. તરતજ પોલીસે આવી વિઠલને પકડ્યો અને તેની સાથે હિંમ-
તલાલ શેઠની સીને પણ પકડી ગયા. વિઠલના કહેવા ઉપર ડોઇએ
તે વખતે ધ્યાન આપ્યું નહીં અને તેને સાચેસાચું મનાવાને પો-
લિસે ધણ્ણો માર માર્યો. સવારે હિંમતલાલ શેડ તેની તપાસ કરવા
પોલીસને ચકલે ગયો ત્યાં પોતાના સાસરા વિઠલને એફેલો જેયો
તે જેતાંજ તે ધણ્ણો શરમાઇ ગયો અને પોલીસને ધણ્ણી આજીજ
કરી તે બંનેને છાડાવી લાંદ્યો. ત્યારથી તેનો સાસરો વિઠલ તેનાથી
રીસાઇ ગયો અને શરમને લીધે બાપ દીકરીને ફરીવાર મેળાપજ
થયો નહીં. હિંમતલાલે પોતાના અવિચારીપણું માટે ધણ્ણો પ-
સ્તાવો કર્યો.

સારથોધ.

ગૃહસ્થ શ્રાવકે હુમેશાં લાંદ્યો વિચાર ફરીને કામ કરવું. સ-
હુસા વિચાર વગર કામ કરવાથી હિંમતલાલ શેઠની જેમ પસ્તાવું
પડે છે.

સારાંશ અનો.

૧ શ્રાવકે કેવી રીતે કામ કરવું ?

૨ અવિચારે કામ કરવાથી શું થાય છે ?

૩ કાંઈપણ કામ કરતાં પહેલાં શું વિચારવું જોઈએ ?

૪ શું કરવાથી નહોરું પરિણામ આવે છે ?

૫ હિંમતલાલ શેડે શું કહ્યું હતું ?

પાઠ ૨૮ મો.

ધર્મ સાંભળવો.

દરેક શ્રાવકે હમેશા ધર્મ સાંભળવો જોઈએ. કારણું કે, ધર્મ આખાતી તથા કલ્યાણના હેતુ રૂપ છે. ધર્મ સાંભળવાથી આપણી આખાતી તથા કલ્યાણ થાય છે. તેમજ ધર્મ સાંભળવાથી મનના ખંડા એટ નાશ પામી જાય છે. અને મન શાંત થાય છે. કે માસુસ હમેશાં ધર્મ સાંભળવા તત્પર રહે છે, તેનું જ્ઞાન વધતું જાય છે અને તેના મનમાં સારા સારા વિચારો આગ્યા કરે છે. જ્યારે આપણું ચિત્ત વ્યાકુળ હોય ત્યારે જો તે ચિત્તને ધર્મ સાંભળવામાં રોક્યું હોય; તો તે ચિત્ત સ્વસ્થ થઈ જાય છે. ધર્મ સાંભળવાનો સ્વભાવ રાખવાથી હરિચંહ શેડ સારી ગતિએ પોહેંદ્યો હતો.

ચાદ્રનગરમાં હરિચંહ નામે એક શ્રાવક હતો, તેની સ્થિતિ નખળી હતી, પણ તે ખારેલા કામને પાર પડતો હતો. નખળી સ્થિતિને લઈને તે હમેશાં ચિંતાતુર રહેતો હતો. મારા ઘરનો નિર્વાહ કેવી રીતે ચાલશે ? હું મારા કુદુંખતું પોષણ શી રીતે કરી શકીશે ? મારા વેહેવાર કેવી રીતે ચાલશે જેને મારી આખરી શી રીતે રહેશે ? આવી ચિંતામાં તેનું શરીર ગોપાઈ જતું હતું.

એક વખતે તેણે કોઈ સુનિને પુછ્યું કે, મહારાજ, હું ધણો હુંથી
છું. મારું ચિત્ત હમેશાં ચિંતામાંજ રહ્યાં કરે છે. તે ચિંતામાંથી
મારો ઉદ્ધાર શી રીતે થાય ? તે ઉપાય બતાવો. સુનિંદ્રે દ્વારા લા-
વીને કહ્યું, હરિચંદ્ર, તું ચિંતા કર નહોં. તારા ઉદ્ધારને માટે એક
સેહેલો ઉપાય છે, કે ઉપાય કર્શમાથી તારી ચિંતા દ્વારા થઈ જશે,
હરિચંદ્ર કહ્યું, મહારાજ કૃપા કરી તે ઉપાય બતાવો. સુનિંદ્ર આવ્યા
તારે હમેશાં ધર્મ સાંભળવો અને તેનો ધર્મિવાર વિચાર કરવો. હર-
િચંદ્ર તે સુનિની વાત કણુલ કરી હમેશાં ધર્મ સાંભળવા લાગ્યો.
ધર્મ સાંભળવાથી તેણું ચિત્ત શરીરે થઈ ગયું અને તેની અધી ચિં-
તા મટી ગઈ. હમેશાં સારા સારા વિચાર આવવા લાગ્યા. સારા વि-
ચારને લધને તેનામાં ખીજી સારો ગુણો ઉત્પજી થયા. તેના સારા
શુણો જોઇને લોકો તેને મહદ કરવા લાગ્યા. જેથી તે આ સંસાર
માં સુખી થઈ આખ્યે સારી ગતિ મેળવી શક્યો.

સારણીધ.

દરેક શ્રાવકે હમેશાં ધર્મ સાંભળવો, જેથી હરિચંદ્રની જેમ
સારી રીતે સુખી થઈ છેવણે સારી ગતિ મેળવી શક્યો છે.

સારાંશ પ્રશ્નો.

૧ ધર્મ શેના હેતુ રૂપ છે ?

૨ ધર્મ સાંભળવાથી શું થાય છે ?

૩ હમેશાં ધર્મ સાંભળવાથી શું વધે છે ? અને તેવા વિચારે
થાય છે ?

૪ હરિચંદ્ર કેવો હતો ?

૫ તેણે કેના ઉપદેશથી ધર્મ સાંભળ્યો હતો ?

પાઠ ૨૯ મો.

દ્વારા પાળવી.

દરેક શ્રાવકે દ્વારા પાળવી જોઈએ. કોઈ હુંખી હોય તેની ઉપર દ્વારા દાખી પોતાથી જાનતી ભક્તિને તેને મદદ કરવી ખીજાને હુંખી માંથી બાધાવવો, એનું નામ દ્વારા છે હરકોઈ નાનાં મોટાં પ્રાણીને હુંખી ન થાય, તેમણે વર્તાં જોઈએ. આચણુથી બસે તેવી શીતે જતના રાખી, નાનાં લુધની યણું રક્ષા કરવી. દ્વારા ધર્મનું મૂળ છે, એ વાત હુમેશાં યાદ રાખવી તે ઉપર એક લુધણુંની ટુંકી વાર્તા યાદ રાખવા જેવી છે.

વીરપુર નગરમાં લુધણું નામે એક ગરીબ છોકરો હુતો. લુધણુંની ખુદ્દિ ઘણ્ણી જડ હતી. એક અક્ષર પણ તેને મોઢે ચહેરો નહીં. નવકારમંત્ર તો તેને યાદજ ન રહેતો. આથી લુધણું ઘણ્ણો સુંભાયો, શ્રાવકપણું ભળતાં પોતાની લુંદરી નકામી થઇ, તેને માટે સેતા મનમાં ઘણ્ણી ચિંતા થવા લાગી. ઘણ્ણીવાર તે ગરીબ છોકરો પોતાની જડતાને માટે એકલો એકલો રોતો હુતો. એક વખતે કોઈ ધર્મશ્રાવક તેને ઘેર આવી ચહેરો, તેણે લુધણુને રોતો જેઠને પુછ્યું, લાધ લુધણું ? કેમ રોવેછે ? લુધણે તેની આગળ પોતાની જડતાની ઠાંધી વાત કહી સંભળવી. તે ગૃહસ્થના મનમાં ઘણ્ણી દ્વારા આવી, અને તેને ખીરજ આપી કહું, લુધણું ! તું રો નહીં. તારા ઉદ્ધારને માટે એક રહેલો ઉપાય છે. તું હમેશાં દ્વારા પાળને, અને “ દ્વારા ધર્મનું મૂળ છે. ” એ વચ્ચન ગોખી રાખેને. બધાં પ્રાણી ઉપર દ્વારા ચાખજે, અને દરેક વખતે જતના રાખીને બધાં કંભ

કરણે. આથી તારું સારું થશે. જીવણે તે વાત કણુલ કરી, અને “દાયા ધર્મનું મૂળ છે” એ વચ્ચન ત્રણું હિવસ સુધી ગોખીને બોઢે કર્યું. સવારથી તે રાતે સુતા સુધી તે “અમુલ્ય વાક્ય” ગોખ્તો, અને બધાં પ્રાણીની ઉપર દયા રાખી જતનાથી ચાલતો હતો. કેાળપણું પ્રાણી હુઃખી થતું હોય, તેને બનતી મદદ આપતો, અને રસ્તામાં પારેવું, ચકલું, કુતરું કે ખીજું કોઈ પ્રાણી હુઃખી થતું હોય, તેને ધાંજરાપોળમાં પોહંચાડી તેની સારવાર કરતો હતો. ધણો વધુત આ પ્રમાણે કરવાથી તેનું મન નિર્મળ થધ ગયું. થોડે થોડે તેની જડતા મટી ગઈ, અને બુદ્ધિનો ઉદ્ઘય થયો. છેવટે જીવણ એકધર્મી અને જ્ઞાની કહેવાયો. લોકો તેને દયાળું રહીને ખાલાવતા, અને તેનું ધણું માન રાખતા હતા એવી રીત દયા પાળવાથી જીવણું જીવન આ હુનિયામાં કૃતાર્થ થધ ગયું.



સારબોધ.

હરેક શ્રાવકે દયા પાળવી જોઈએ. દયા પાળવાથી જીવણુના જેવા જડ માણુસનું પણ લલું થયું હતું.



સારાંશ પ્રશ્નો.

૧ દયા પાળવી એટલે શું ?

૨ કેનું નામ દયા કહેવાય ?

૩ ધર્મનું મૂળ શું છે ?

૪ જીવણ કેવો હતો, અને તેણે કયું વચ્ચન ગોખ્યું હતું ?



પાઠ ત૦ મો.

બુદ્ધિના શુણુનો! ઉપયોગ.

ગૃહસ્થ શાખકે પોતાની બુદ્ધિના આડ શુણુનો ઉપયોગ કરવો જેધીએ, પૂર્વના પુષ્યથી બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય, તે છતાં જે ગૃહસ્થ શાખક તેનો સહૃદયોગ કરે નહિં, તેની મળેલી બુદ્ધિ નકામી થાય છે. ડાઇ પણ સારી વાત સાંકળવાની ઈચ્છા કરવી તે, પેહલો શુણું છે. સાંકળવું, એ બીજો શુણું છે. સાંકળેલી ખાણત થહણું કરવી, એ ત્રીજો શુણું છે. થહણું કરેલી ખાણત ભુલવી નહિં, એ ચોયો શુણું છે. થહણું કરેલી ખાણતને સામાન્ય રીતે સમજવી, તે પાંચમો શુણું છે, તેને વિશેષ કરી સમજવી. તે છુટો શુણું છે. તે સમજાએલી ખાણતમાં સંદેહ દૂર કરી નક્કી કરવું, તે સાતમો શુણું છે, અને તે ખાણતમાં કંદિ ન ફરાય તેવો ખરો નિશ્ચય કરવો એ આઠમો શુણું છે. આ પ્રમાણે બુદ્ધિના આડ શુણુનો ઉપયોગ કરી સારે માર્ગ ચાલનારા ગૃહસ્થ શાખકનું કલ્યાણ થાય છે. કે માણુસ સારી બુદ્ધિ મળ્યા છતાં તેના આડ શુણુનો ઉપયોગ કરે નહિં, તેને સારો માર્ગ મળતો નથી. તેની બુદ્ધિનો ઉપયોગ અવળે માર્ગ થાય છે, અને તેથી તેનો મહુષ્યજન્મ નકામો થાય છે. બુદ્ધિનો સારો ઉપયોગ કરવાથી કેવો લાલ થાય છે? તે ઉપર મતિચંદ્રની વાતા સમજવા જેવી છે.

પાઠલીપુરમાં મતિચંદ્ર નામે એક શાખક હતો. તે ખાળ-પલુથીજ થણો બુદ્ધિવાળો હતો. તેની બુદ્ધિની ચાલાકીથી લોકો ખુશી થઈ વાતા હતા. ડાઇ સારી વાત ઉપર પણ તે વિચાર ગાંધી

તૈમાંથી છુપી બાખત શોધી કાઢતો, અને તે ખીજને સંલગ્નાવી ખુશી કરતો હતો. આવી ખુદ્ધિ છતાં પણ તેણે ધર્મ કે નીતિની વાત ઉપર વિચાર કર્યો નહુતો. ખીજની નિંદા કરવામાં અને મશકરી ઠુંડામાં તે પોતાની ખુદ્ધિનો ઉપયોગ કરતો હતો. એક વખતે ક્ષમાવિજય નામે એક સુનિ પાટલીપુરમાં ચોમાસું રહ્યા, તેમણે મતિંદ્રની ખુદ્ધિની અશાંસા સાંસળી તેને પોતાની પાસે ઓલાંઘ્યો. અને તેને ખુદ્ધિના આઠ ગુણું સમજાયા, અને તેનો સારો ઉપયોગ કરવાની લગ્નમણું કરી. ત્યારથી મતિંદ્ર હમેશાં ધર્મ સાંસળતો, અને તેમાં ખુદ્ધિના આઠ ગુણનો ઉપયોગ કરતો હતો. આથી તે જૈન શાસ્ત્રમાં ધ્યાન કુશળ થયો, અને શ્રાવકેમાં તેની સારી કીર્તિ ફેલાઈ ગઈ, અને તેના આત્માસું કલ્યાણ થયું.

સારણોધ.



શ્રાવકે પોતાની ખુદ્ધિના આઠ ગુણનો ઉપયોગ કરવો. તે અમાણે કરવાથી મતિંદ્રની કેમ સારી કીર્તિ ફેલાય છે, અને આત્માસું કલ્યાણ થાય છે.

સારાંશ પ્રાપ્તો.



૧ ખુદ્ધિના ડેટલા ગુણ હોય છે ?

૨ ખીજે, ચોથે, છંકો અને આઠમો ગુણ કર્યો ?

૩ મતિંદ્ર કેવો શ્રાવક હતો ?

૪ તેની ખુદ્ધિનો સારો ઉપયોગ કરવા કોણે કહ્યું હતું ?

૫ મતિંદ્ર પછી કેવો થયો હતો ?



પાઠ ત૧ મે.

ગુણુ ઉપર પક્ષપાત કરવો.

ગૃહસ્થ શ્રાવકે ખીજના ગુણુનો પક્ષપાત કરવો. ખીજના ગુણુ જોઈને તેનાં વખાળુ કરવાં, અથવા જે ણને તો તે ગુણુવાળાને સહાય આપવી, સજજનપણું, બિદારતા, ધીરજ, ડાહાપણું, ટેરેલપણું, અને ચીડાં વચ્ચન—એ ખધા ગુણુ કહેવાય છે. એવા ગુણુ પોતાના અને ખીજના ઉપકાર કરનારા થાય છે. જે માણુસમાં એવા ગુણુ હોય, તેનું ખાડુ માન કરવું, અથવા તેવાઓને સહાય આપવી, એજ ગૃહસ્થ શ્રાવકનો ધર્મ છે. જે જીવ ગુણુનો પક્ષપાત કરે છે, તે પુણ્યના ખીજ ઉપર સિંચન કરી આદોક તથા પરદોકમાં સારાં ફળ મેળવી શકે છે. ગુણુ ઉપર પક્ષપાત કરનાર રાજસિંહ રાજની વર્તી ખરેખર ધડો કેવા લાયક છે.

સૂર્યપુર નગરમાં રાજસિંહ નામે એક રાજ હતો. તેને તેજસ્સિંહ કરીને એક નાનો ભાઈ હતો. રાજસિંહ પોતાનું રાજય નીતિથી ચલાવતો હતો. કેદિપણું શુણી માણુસ આવે તો, તેની તે સારી રીતે કદર જાણું હતો. રાજસિંહની ઉભ્યર મોટી થઈ હતી. તેને જયસિંહ અને વિજયસિંહ નામે એ કુમાર હતા. તેના ભાઈ તેજસ્સિંહને માધવસિંહ નામે એક કુમાર હતો. માધવસિંહે બાળપણમાંથીજ સારા ગુણુ મેળંયા હતા. રાજનીતિના ખધા નિયમો તેણે ચારી રીતે જાણ્યા હતા. જયસિંહ અને વિજયસિંહ ખને નાની વધમાંથીજ તોઢાની હતા. રાજકુમારને ન છાંજે, તેવી રીતે તેણે વર્તતા હતા. સૂર્યપુરના લોકો જય વિજયની ઉપર નારાજ

રહेता હતा. કોઈ કોઈ વાર તો તેમની વિરુધ ફરીયાડો પણ રાજની આગળ આવતી હતી. માધવસિંહે સર્વે પ્રકારે લોકેની પ્રીતિ મેળવી હતી. રાજ રાજસિંહે ઘણીવાર તેનાં વખાણું સાંલઘયાં હતાં.

આ અરસામાં ચોવું બન્યું કે, માળવાના રાજ વિનોદસિંહનો એક હૃત રાજસિંહની પાસે આગળ લઈને આવ્યો. કાગળમાં લખ્યું હતું કે, “ મારી દીકરી સુલોચનાને સંખંધ તમારા મોટા પુત્ર જયસિંહની સાથે કરવાનો છે. મારે સુલોચના એકજ દીકરી છે, એનું કાંઈ સંતાન નથી. સુલોચનાને પરણુનાર તમારા કુમારને મારે મારું રાજ્ય અર્પણું કરવું છે; જે જયસિંહ લાયક ન હોય તો, વિજયસિંહની સાથે સંખંધ કરનો. મારા રાજ્ય ઉપર લાયક રાજની જરૂર છે; માટે આપને ચોણ્ય લાગે તે કુમારને પસંદ કરશો.” આ કાગળને ઉત્તર રાજસિંહે તરત લખ્યો, અને તેમાં ચોતાના કુમાર જય વિજયને નાલાયક ગણ્ણી પોતાના લાગ્રીજ માધવસિંહનું નામ આપ્યું. પછી માધવસિંહ સુલોચનાને પરણ્યો, અને તે માળવાના મહારાજ થયો. એથી લોકેમાં રાજસિંહનો ગુણમાં પક્ષપાત કરવાનો શુણું સારી રીતે વિખ્યાત થયો.



સારબોધ.

દરેક શ્રાવકે શુણું ઉપર પક્ષપાત રાખવો જોઇયો. રાજસિંહે પોતાના સગા દીકરાને અચોણ્ય ગણ્ણી લાઈના દીકરા માધવસિંહને તેના શુણું ઉપર પક્ષપાત કરી, માળવા દેશનો રાજ અનાંયો હુતો.



सारांश प्रती.

- १ गुणु उपर पक्षपात अटले शुं ?
 २ सुख्य गुणु क्या ? तेनां नाम आये।
 ३ गुणु उपर पक्षपात करवाई शुं थाय ?
 ४ राजसिंह अने तेजसिंह कोणु हता ?
 ५ जयसिंह, विजयसिंह अने माधवसिंह डेवा हता ?
 ६ विनोदसिंह कोणु हतो ? अने सुदोचनाने भाटे शुं घन्यु हतुं ?
 ७ माधवसिंहने थो लाल थयो ? अने ते था भाटे थयो ?
-

पाठ उर भे।

गुहरथ श्रावकना सामान्य धर्म विषे कनिता।

(अंग्रेज वाजनी चाल.)

भात तातनी सुशक्ति लावथी धरो,
 उम्गथी सुसंग "सहायारीनो करो;
 कहर लण्ठनार गुणु प्रीतिने धरो,
 सुमेन णंधु ते अहस्य धर्म आयरो.
 अल्लिं जे रहेल छोय तो नहि जभो,
 करो हमेश वर्खतसर पछी सुझे रमो;
 सहेव ज्ञानपूर्दनी सुसेवना करो,
 सुनेन अंधु ते अहस्य धर्म आयरो.

१ भासा नायारपाणी।

ખરાખ કામમાં કહિ પ્રવૃત્તિ નહિ રચો,
 સર્વે પોષ્યવર્ગે ભરણુ પોષણુ ભચો;
 સર્વ કામ માંહિ દીર્ઘદૃષ્ટિ વાપરો,
 સુજૈન બંધુ તે અહસ્થ ધર્મ આચરો.
 શ્રવણુ ધર્મનું કરો દયા દિલે વહો,
 આઠ ખુદ્ધિના ગુણુ કરી સદા રહો;
 સુપક્ષપાત સદગુણો તણો સુખે કહો,
 સુજૈન બંધુ તે અહસ્થ ધર્મ આચરો.

૪

પાઠ ઉત્ત મો.

હુરાથહ રાખવો નહિ.

ગૃહસ્થ શ્રાવકે કોઈ જાતનો હુરાથહ રાખવો ન જોઈએ. હુરાથહ રાખવાથી ધણું લુકસાન થાય છે. હુરાથહને લક્ષને નીતિના સાર્ગનું જીવુંધન થાય છે. કોઈ કોઈ વાર તો હુરાથહથી ફેણાટની મેહેનત થાય છે. પાણીમાં સામે પૂર જવાનો હુરાથહ રાખનારાં માંછલાંએ. ધણુંં હેરાન થાય છે. કેટલીકવાર તો હુરાથહથી પાપનાં કામ પણ થદ્ધ જાય છે. સોમચંહ નામનો એક શ્રાવક હુરાથહને લઈને ધળો કુઃખી થયો હતો,

શ્રીપુર નગરમાં સોમચંહ નામે એક શ્રાવક રહેતો હતો. તેનામાં બીજા કેટલાએક ગુણુ હતા, પણ હુરાથહ રાખવાનો એક મોટો

૧ ભરણુ પોષણુ કરવા ચોઝ્ય એવા કુદુંબ જ્ઞાતિ વગેરેના ભાણુસે.

૨ લાંખી નજરા.

હુર્ણિલુ હતો, કોઈ પણ કામની શરૂઆત કરતાં તેને હુરાયહ થઈ પડતો, અને તેથી કરીને તે કામ સુશકેલી ભરેલું હોય તો પણ, તે હુરાયહથી છાડતો નહોં અને તેમાં ધણોજ હેરાન થતો હતો. આવા હુરાયહી સ્વલ્પાવથી તેના બીજા શુણ્ણુ ટંકાઈ જતા હતા. ખધા શ્રીપુરમાં સોમચંહ હુરાયહી એવા નામથી તે ઓળખાતો હતો. કોઈપણ કામ કઠાવવું હોય તો, કોઈ સોમચંહને આગળ કરતા, અને તે કામ આયહથી તેને ગળે પાડતા, એટલે સોમચંહ ધણ્ણુ મેલેનત લઈ તે કામ બલાવતો, અને વખતે હુરાયહથી તુકશાનીમાં પણ ઉત્તરી પડતો હતો.

શ્રીપુરની બાહેર એક વાડી હતી, તેમાં હરનાથ કરીને એક કાન યદર્શની બાદો રહેતો હતો. હરનાથ નહાત્તા શુણુનો હતો, તેથી તેની વાડીમાં અનેક જાતનાં પાપ અમતાં હતાં, કોઈવાર હિંસાનાં કામ પણ થતાં હતાં. સોમચંહ દરરોજ તેની વાડીમાં દૂરવા જતો, અને હરનાથની સાથે ઉઠતો બેસતો, તેથી તેને હરનાથની સાથે પ્રીતિ થઈ હતી. લે કે હરનાથની વાડીમાં કે અરાણ કામ થતાં, તેમાં સોમચંહ સામેલ ન રહેતો, તથાપિ ત્યાં જવાનો હુરાયહ તેમે બાધાયો હુતો. હરનાથની વાડીની અરાણ વાતો ગામમાં ચાલવાથી નાતનાં કેટલાંચોક માણુસોએ સોમચંહને ત્યાં ન જવાને અટકાવવા માંડયો, પણ હુરાયહી સોમચંહ તેમનાથી અટક્યો નહોં. પણ ઉલ્લેખ હરનાથનો પણ કરવા દાખલો. જામના ખધા મદ્દાલને એકસ થઈ હરનાથને વાડી બાહેર કાઢવા, અને તેને કોઈ જાતની મદ્દ ન આપવાનો હૃતવ કર્યો; અને તેને માટે શ્રીપુરના રાજને ચોટ અરણુ કરી. આ વાતની સોમચંહને અખર પણ એટલે તે હુરાયહથી ખધા જામની વિરુદ્ધ ખડયો, અને રાજની

આગળ હરનાથનું સારું પોલવા ગયો, રાજાએ સોમચંદને અનાદર કર્યો, અને હરનાથને વાડીમાંથી કાઢી મુકવાનો હુકમ કર્યો, હરનાથ રાજાને હુકમ માન્યો નહ્યો, અને તે જતુની થઇ રાજાની સામો થયો, તે નેચું સોમચંદ પણ હરનાથની સાથે નેડાયો, રાજાએ એને પછી ડેવ કરી લીધા, અને હરનાથની વાડી તથા સોમચંદના ઘરને જસ કર્યો, સોમચંદ પોતાના હુરાથણી સ્વભાવને લઈને રાજાના ડેફાનામાં ઘણોજ ડેરાન થયો, પછી નાતના આગેવાનોએ સોમચંદને રાજાને વિનંતિ કરી છોડાયો, અને સોમચંદ લુંઘણી સુધી કોઈ જાતનો હુરાથણ ન કરવાની બાધા લીધી અને ત્યારથી તે સુખી થયો.

સારબ્યોધ.

કોઈ જાતનો હુરાથણ રાખવો, એ ખરાળમાં ખરાબ રેવ છે,
હરાથણ રાખવાથી માણુસ સોમચંદની જેમ ડેરાન થાય છે.

સારાંશ પ્રશ્નો.

૧ હુરાથણ રાખવાથી શું થાય છે ?

૨ હુરાથણ રાખવાને ભાટે કોતું દસ્તાવ છે ?

૩ સોમચંદ કેવો હુરાથણ રાખ્યો હતો ?

૪ હરનાથ બાવો કેવો હતો ?

૫ સોમચંદને હુરાથણ રાખવાથી શું થયું હતું ?

૬ આખરે સોમચંદ શાથી સુખી થયો ?

પાઠ ઉત્તે મો.

હિવસે હિવસે વધારે જ્ઞાન મેળવશું.

ગૃહસ્થ શ્રાવકે બધામાં સંતોષ રાખવો, પણ જ્ઞાન મેળવવામાં સંતોષ રાખવો ન જેહું છે, હિવસે હિવસે પોતાના જ્ઞાનમાં વધારો કરવો, પોતાના અને ખીજના જ્ઞાનની સાથે પોતાનો સુકાળવો કરવો, અને કેનામાં વધારે જ્ઞાન હોય, તેનો હાખ્લો લઈ તેવો ણનવા પ્રયત્ન કરવો, કે માણુસમાં વધતું જ્ઞાન ન થાય, તે માણુસ અને પણુભાં કાંઈ તદ્દ્વાપત હોતો નથી. વળી પોતાના આત્મામાં શુણું કર્યા છે અને હોપ કર્યા છે, તે સુણાધી હુમેશાં વિચાર કરવો, મારી વર્તણુક કેવી છે ? મને લોકો સારો કહેછે કે નહારો કહેછે તે પણ વિચારશું. હુમેશાં રત્ને સુતી વખતે ગૃહસ્થ શ્રાવકે વિચારશું છે, આજ આણા હિવસમાં મને કેટલું જ્ઞાન વધારે મળશું ? આવો વિચાર કરતાર માણુસ શિવચંદ્રની લેમ મોટો વિદ્ધાન ણની જાયછે.

સિદ્ધનગરમાં એક શિવચંદ્ર નામે શ્રાવક હતો, તેની ઉમર સેણ વર્ષની હતી. તેદામાં ઘણું સારુ શુણું હતા. અર્વથી વિશેષ શુણ એ હતો કે, આખા હિવસમાં પોતે જે કામ કર્યું હોય, તેનો તે વિચાર કરતો. આજે મારામાં વધારે સારો શુણું શો થયો છે? અધવા આજે મારામાં શું જ્ઞાન વાળું છે ? તે વિચારી તેને પોતાની નિય નોંધપોધીમાં નોંધો કેતો હુતો. એક વખતે શિવચંદ્ર વખાલું સાંશળવાને ઉપાયયે ગયો, ત્યાં સુનિમહાનાજતા સુખથી જાંશશું છે, “ધર્મના ચાર પ્રધાર છે. દાન, શીલ, તપ અને ભાવ.” આ પાત્ર સાંલળી તેણું તે ગાંધાર થાહ રાખી કીદું. રત્ને સુતી વખતે

તેણે વિચાર કર્યો કે, આજે આપા દિવસમાં મારા જ્ઞાનમાં શો
વધારો થયો ? આજે હું ધર્મના ચાર લેખ શીજ્યો, દ્વાન, શીદ,
તપ અને લાલ, આ વાત તેણે પોતાની નિત્ય પોથીમાં નોંધી લી-
ધી. એવી રીતે તે હુમેશાં જ્ઞાનનો વધારો કરતો હતો. એમ કરતાં
આખરે તે કૈનનો મોટો પંડિત બતી ગયો.



સારખોધ.

આવકે દિવસે દિવસે પોતાના જ્ઞાનમાં વધારો કરવો, અને
આજે કેટલું જ્ઞાન વધ્યું ? તેનો રાત્રે વિચાર કરવો. એમ કરવા-
થી શિવચંદ્રની લેમ જ્ઞાતીના પંડિત થઈ જવાય છે.



સારાંશ પ્રશ્નો.

૧ ગૃહસ્થ શ્રાવકે શોમાં સંતોષ ન રાખવો ?

૨ દિવસે દિવસે શોમાં વધારો કરવો ?

૩ જે ભાણુસમાં વધતું જ્ઞાન ન હોય તે કેવો સમજવો ?

૪ પોતાના આત્મામાં શેનો વિચાર કરવો ?

૫ શિવચંદ્ર કેવો શ્રાવક હતો ? તેનામાં મોટામાં મોટો ચુણ
શો હતો ?

૬ તે શેની નોંધ લેતો હતો ?

૭ શિવચંદ્રે મુનિ પાસેથી શું સાંભળ્યું હતું ?

૮ ધર્મના કેટલા પ્રકાર છે ? તેનાં નામ આપો.

૯ આખરે શિવચંદ્ર કેવો થયો હતો ?



પાઠ ઉપ મે.

અતિથિને આદર.

ગૃહસ્થ શ્રાવકે અતિથિ ધેઈ આવેલા સાંધુ તથા ગરીબ માણ્યસનો ચોણ્ય સત્કાર કરવો. કે માણ્યસને બધી તિથિએ સરખી હોય છે, કેાં આસ તિથિ હોતી નથી, તે અતિથિ કહેવાય છે. તેવા અતિથિ સાંધુ હોય છે, તેમને જાત, પાણી વોહેલાવવાં અને પુરતક, પાંચ અને વસ્ત્ર આપવાં, તે શિવાય અમે તે સ્નેહી, સાધ્યમ્ભજાઈ, જેગાં કે ભિન્ન આપણે ઘેર મીજભાન થઈને આંધ્યાં હોય, તેમને ચોણ્ય આદર આપવો, એટલે તેમનો પોતાની શહીત પ્રમાણે સત્કાર કરવો, તે ગૃહસ્થશ્રાવકનો ખરો ધર્મ છે. કે કેાં શુષ્ણો ગરીબ માણ્યસ આપણે ઘેર આવી જણો રહે, તેને પણ આપણી શહીત પ્રમાણે અજ આપવું, લેને ઘેરથી કેાં અતિથિ, અભ્યાગત હે ગરીબ માણ્યસ અજ વિના પાછો કાય, તે ગૃહસ્થતું ઘર નહાગું છે. કેમકે શ્રાવકના અસંગદાર કહેવાય છે. અતિથિને આદર આપનાર ઉદારચંદ્રની વાત ખરેખર ધડો લેવા જેવી છે.

કપિલપુરમાં ઉદારચંદ્ર કરીને એક શ્રાવક હતો. તેની દ્વિતી સાંધુ હતી; પણ તે હુમેશાં અતિથિ-અભ્યાગતને ધણો આદર આપતો હતો. કેાં સ્નેહી, ભિન્ન, જેગો કે હુણી માણ્યસ તેને ઘેર જાવે તો, તેનો તે ચોણ્ય સત્કાર કરતો હતો. હતો. ચોતાને ઘેર મીજભાન જાવે ત્યારે, તેના મનમાં ધર્મોજ હર્ષ થતો હતો. હરેક મીજભાનની અરદાશ કરવામાં તેને પણી ઢાંશ આવતી, અને અ-

નમાં ઉમંગ આવતો હતો. આથી કરીને ઉદારચંદ્રની કીર્તિ દેશાં-
તરમાં ચારે તરફ ફેલાણી હતી. લાખો રૂપીઆનો ધણી કે કી-
ર્તિ મેળવી શકે નહિ, તે કીર્તિ એક સાધારણ સ્થિતિના ઉદારચંદ્રે
મીજખાનની સેવા કરવાથી મેળવી હતી.

એક વખૂતે ઉદારચંદ્ર બાહેર ગયેલ, તેવામાં કોઈ મીજખાન તેને
દેર આવી ચકદ્યો. ઉદારચંદ્રની સ્ત્રી પણ ધરમાં હાજર ન હતી;
તેનો નાની ઉભમરનો સુખચંદ્ર નામે દીકરો ધરના આંગણામાં રમતો
હતો. તે મીજખાન ધરમાં આઠ્યો એટલે, સુખચંદ્રે કહું, મારાં
માણાયે ધરમાં નથી. આપ કોણું છો ? તે ગૃહસ્થે કહું, હું તમારે
દેર મીજખાન છું. તારાં માત્રપિતા કયારે આવશે ? ખાણક બાદ્યો,
તમે ધરમાં એસો, હું મારા આપાને તેડી આવું. આમ કહી સુખચંદ્ર
તેના આપ ઉદારચંદ્રને તેડવા હોડી ગયો. ચેલા મીજખાને પછવાઢેથી
વિચાર કર્યો કે, આવા રેઢા ધરમાં રહેલું, તે ચોગ્ય ન કહેવાય,
માટે અહિંથી ઓઝે ચાલ્યા જલું ચોગ્ય છે, આવું વિચારી તે
ગૃહસ્થ ત્યાંથી ઓકે ચાલ્યો ગયો. પછી તરતજ ઉદારચંદ્ર દેર
આઠ્યો, ત્યાં કોઈ મીજખાનને તેણે જેયો નહીં. સુખચંદ્રને પુછ્યુંકે,
મીજખાન કયાં છે ? સુખચંદ્રે કહું, હું આપણા ધરમાં એસારીને
આઠ્યો હતો. ઉદારચંદ્રે આખા ગામમાં તેની તપાસ કરી, પણ
કોઈ ઠેકાણેથી મીજખાનનો પત્તા લાગ્યો નહીં. ઉદારચંદ્ર અને તેનું
કુટુંબ આપો હિવસુ દીલગીરીમાં રહું. ઓઝે હિવસે જ્યારે તે
મીજખાન તેને મળવા આઠ્યો, ત્યારે તેને આથહ કરી જમાડ્યો,
અને ફરીવાર તેમ ન કરવાને વિનંતિ કરી.

સારણી.

ઉદારચંદ્રની કેમ હરેક ગૃહસ્થી અતિધિ હે મીજખાનનો આહર
કરવો જોઈઓ. તેથી સારી શીર્ષિ અને ચુલ્ય બંને પ્રાપું થાય B.

સારાંશ પ્રશ્નો.

- ૧ અતિધિ એટલે શું ?
- ૨ અતિધિ હોણું કહેવાય ?
- ૩ તેવા અતિધિને શું આપવું જોઈઓ ?
- ૪ બીજા ડાનો સહકાર કરવો ?
- ૫ ઉદારચંદ્ર કેવો ગૃહસ્થ હતો ?
- ૬ ઉદારચંદ્ર મીજખાનને કેમ રાખતો ?
- ૭ મીજખાન પાછો જતાં ઉદારચંદ્રે અને તેવા કુદુંબે શું
કર્યું હતું ?

પાઠ ઉક મો.

‘પર્મ, અથ્રી અને કામ પરાપર નિયમિત સેવવાં

લાગ દો,

હરેક સંસારી માલુમે સંસારમાં રહીને ચુલ્ય દીતે પર્મ, અથ્રી
અને કામ કો પ્રાપુને સેવવાં જોઈઓ. એ ગ્રંથને શેંયા વિના સંસાર
એવા, પ્રાચીનતા એવા વિનામને લાગવા વિના સેવવાં હો.

ચાલતો નથી. જેનાથી આપણું કલ્યાણની સિદ્ધિ થાય, તે ધર્મ કહેવાય છે. જેનાથી આપણું બધા અચોજન સિદ્ધ થાય, તે અર્થ કહેવાય છે. અને જેનાથી બધી ઈદ્રીયોને પ્રિતિ થાય, તે કામ કહેવાય છે. તે ધર્મ, અર્થ અને કામને માંહામાંહે હરકત ન આવે તેવી રીતે સેવવાં જોઈએ. આ ત્રણુમાંથી એકને સેવવો નહીં, પણ બધાંને જેમ ઘટે તેમ સેવવાં જોઈએ. જેએ આ ત્રણુને સેવતાં નથી, તેએનું જીવિત આદોક અને પરલોકમાં નકાસું થાય છે. તે વિષે લીમશેડના ચાર દીકરાની વાત સમજવા જેવી છે.

શ્રીનગરમાં લીમ નામે એક શેડ હતો, તેને ચાર દીકરા હતા. લીમશેડ વેપારમાં સારી લક્ષ્મી કમાયો હતો. ચાર દીકરાએ મોટા થયા એટલે તેણે વિચાર કર્યો કે, આ ચાર દીકરાએમાંથી જે લાયક હોય, તેના નામથી હુકાન ચલાવવી, અને બધી સત્તા તેને આપવી. આવા વિચારથી તેણે સર્વથી મોટા દીકરા ધર્મચંહને બોલાવ્યો. અને તેને પુછયું કે, હું તારા નામની હુકાન કરું, અને મારી બધી સત્તા તને આપું, તો તું કેવી રીતે ચલાવીશ ? ધર્મચંહ એદ્યો બાપા ! હું હુકાન સારી રીતે ચલાવીશ, અને પૈસાનો સારો ઉપયોગ કરીશ. પહેલાં તો હું આએ દિવસ ધર્મનાં કામ કરીશ. હુકાનમાં પણ ધર્મ કરીશ. સામાયિક, પડિકમણું અને સભાય ધ્યાન વિગેરે બધી કિયા હુકાનમાં કરીશ. જે ધર્મ જાળુનારા અને ધર્મની કિયા કરનારા શ્રાવકો હશે, તેમને નોકર રાખીશ, અને હુકાનમાં ધર્મ ધ્યાન કરાવીશ. વળી હુકાનને મોટી વિશાળ કરાવી, તેમાં એક તરફ ઉપાશ્રય, એક તરફ પૈષધશાળા અને એક જૈનશાળા કરાવીશ, બાપા ! વધારે શું કહું, પણ સવારથી તે રાત સુધી ધર્મનું કામ જ કરીશ. તે સાંભળી લીમશેડ વિચારમાં પડ્યો કે, આ દીકરો

મારી હુકાનની સત્તાને લાયક નથી. હુકાનમાં આપો દિવસ ધર્મ ધ્યાન કરવાથી હુકાન ચાલે નહિ, અને બધું પડી જાઓ. પછી તેણે અર્થચંદ નામના દીકરાને પુછયું છે, તને હુકાનની સત્તા આપીજે, તો તું શી રીતે ચતાવે?

અર્થચંદ બોલ્યો—આપા ! જો મને હુકાનની સત્તા આપો તો, તું મારા બધા અધોગત સાધી લઈ. આપો દિવસ પેસાનોન વિચાર કરું. પેસો કેમ વધે ? પેસો પેસાને કેવી રીતે વધારે ? એ આખતનો આપો દિવસ વિચાર કરું. સવારથી તે રાત સુધી ખાતાં, પીતાં, ઉઠતાં અને બેસતાં પેસાનોન વિચાર કરું જાત જાતના જોનાનાં ઘરાણાં ઘડાલું, અને રહેસત વધાર્યા કરું. અર્થ-ચંદના આ વિચાર સાંલળો લીમથેઠ વિચાર્યું છે, આ તો જરેખરો અર્થચંદ છે, તે ચણું હુકાનની સત્તાને લાયક નથી.

પાઠ ઉ૭ મો.

ધર્મ, અર્થ, કામ બરાબર સેવવાં

લાગ ૨ જો.

લીમથેઠ કામચંદ નામના ગ્રીલ દીકરાને બોલાવીને પુછયું છે, દોષા ! તને હુકાનની કુત સત્તા આપવા છે, તે તું બલાવી શકીએ કે નહોં ? કામચંદ બોલ્યો આપા ! તું ખલ્લીબો

આએ। દિવસુ મોજમજ લોગવીશ। હુકાનમાં સારા સારા જોવા લાયક ચિનોના તકતા લટકવીશ, મધુર ગાયન કરનારા ગવૈયા અને ઊંચી જતનાં વાળાંએ હુકાનમાં એસીને સાંલળીશ, ઘણું ખુશબોદાર કુલોના ગજરા રાખીશ, અને ઊંચી જતનાં અતાર વાપરીશ. વળી ઉત્તમ પ્રકારની મીઠાઈ લાવી હુકાનની અંદર બધાને જમાડીશ, અને મોટી મોટી મીજલસ કરીશ. કામચંહના આવા વિચાર જાહી લીમશેડે વિચાર્યું કે, આ દીકરે પણ હુકાનના કામને લાયક નથી. પછી ચોથા વિવેકચંહ નામના નાના દીકરાને ઓલાવીને પુછ્યું, એટલે તેણે કહ્યું, આપા ! હું ખુશીથી આપણી હુકાનનો વહૃપટ કરીશ. દિવસના જુહા જુહા ભાગ પાડી બધી જતનાં કામ કરીશ. અમુક વખતે ધર્મ ક્ષયાન કરીશ. અમુક વખતે વેપારનાં કામ કરી ચૈસો પેહા કરીશ. અને અમુક વખતે સંસારના સુખમાં આશક થયા વિના તે લોગવીશ. વિવેકચંહના આવાં વચન સાંલળી લીમશેડ ખુશી થયો, અને તેણે વિવેકચંહને લાયક ગણી બધી સત્તા આપવાનો નિશ્ચય કર્યો. પછી તેણે બધા છોકરાએને ઓલાવીને કહ્યું કે, તમારા બધામાં વિવેકચંહ લાયક છે. કે સંસારી માણુસ અર્થ તથા કામને છોડી એકલો ધર્મજ સેવે છે, તેનાથી સંસારમાં રહી શકતું નથી, એકલા ધર્મને સેવન કરનારા પુરુષે તો સંસારનો ત્યાગ કરવો જોઈએ. ધર્મ તથા કામને છોડી એકલો અર્થ સેવે છે, તે માણુસનું જીવનું નકાસું થાય છે, અને મુખ્ય પછી નહારી ગતી મળે છે, અને કે માણુસ ધર્મ તથા અર્થને છોડી એકલો કામ સેવે છે, તે આલોક અને પરલોકમાંથી ભૂષ થાય છે. માટે ધર્મચંહ એકલો ધર્મને સેવનારો છે, અર્થચંહ એકલો પેસાનો સેવક છે. અને કામચંહ એકલો વિષયને સેવનારો છે, માટે એ ત્રણે નાલાયક છે, અને નાના દીકરો વિવેકચંહ ધર્મ, અર્થ અને કામને આંહોમાંછે

દુસ્કરત ન આવે તેમ જેવનારી છે, ભાઈ આ હુકાનની અને ધર-
ની બધી જરૂર તેનેજ આપવામાં આવે છે.

સારભોગ.

હરેક ગૃહદ્વારે વિવેકચંદ્રની જેમ ધર્મ, અર્થ અને કામને નિ-
રણાધપળું જેવાં લેધાયે. ધર્મચંદ્ર, અર્થચંદ્ર અને કામચંદ્રની
જેમ ઓકલા ધર્મગાં, ઓકલા અર્થમાં, અને ઓકલા કામમાં આશક
થતું ન જોઈએ.

સારાંશ પ્રશ્નો.

- ૧ ધર્મ, અર્થ અને કામ ઓરલે શું ?
- ૨ કોણને ટેવા કીતે જેવાં લેધાયે ?
- ૩ કોણને નિરણાધપળું ન જેવાથી શું થાય છે ?
- ૪ બીજાથોડને કેટલા કીકરા હતા ? અને તેમનાં શું નામ
હતાં ?
- ૫ ધર્મચંદ્ર, અર્થચંદ્ર, કામચંદ્ર અને વિવેકચંદ્રના ટેવા કેવા
સ્વરૂપ હતા ?
- ૬ કીમણે આપરે ક્યા હિકરાને લાયક હશોયો ?

પાઠ તૈ મેલ.

હેશકાળ પ્રમાણે વર્તિલું.


ભાગ ૧ લેટા.

ગૃહસ્થ શ્રાવકે હુમેશાં દેશકાળ પ્રમાણે વર્તિલું, દેશકાળ વિરુદ્ધ ચાલિલું નહિ. જે શ્રાવક દેશકાળ પ્રમાણે વર્તે નહિ, તે ધર્માજ હું ખામોષે. કોઈ વાર લડાઈ કરવાનો પ્રસંગ આવે તો, પ્રથમ પોતાનું અને ધીજાનું બળ વિચારલું. સામે માણુસ આપણાથી બળવાન છે કે નહિ? આપણામાં અને તેનામાં વધારે કોણું બળવાન છે? અને છે વટે કોનો વિજય થશે? એ હાથો વિચાર કરીને તેની સાથે બાધીહી. જે આપણે તેને પોહણાંચી શકીએ તેમ હેઠાંએ તો, તેની સાથે લડવા તૈયાર થલું, અને જો ન પોહણાંચી શકીએ તેમ જથ્થાય તો, સમતા રાખી બેસી રહેલું. શક્તિ અને નિર્ણયતા, દ્રષ્ટિ, ક્ષમતા, અને લાવવડે છે, એમ મનમાં જાણી લેલું. કે માણુસ પોતાની શક્તિ જાણ્યા બિના મોટો આરંભ કરી બેસે, તેની પ્રડતી થાયછે.

આ દેશ કચો છે? અને આ કાળ કેવો છે? એ બાખત વિચારીને વર્તવાથી સુખી થવાય છે. તેને માટે નીતિશાસ્કમાં લખે છે કે “દરેક માણુસે સાત ખાણતનો વિચાર કરીને હરકોઈ કિર્યનો આરંભ કરવો.” ૧ આ કાળ કેવો છે? ૨ આ દેશ કેવો છે? ૩ મિત્ર અને શત્રુ કોણું છે? ૪ ખર્ચ શું છે? ૫ આખર શું છે? ૬ હું કોણું છું અને ૭ મારી શક્તિ શી છે? આ સાત બાખત વારંવાર વિચારી કામ કરવાથી માણુસ દરેક કામમાં ઝરોડ મેળવે છે. આ વિષે દેશકાળ પ્રમાણે ચાલનારા બુદ્ધિચંદ્ર શ્રાવકની વર્તિ ખડા લીધા કેવી છે.

श्रावस्ती नगरीमां युद्धिचंद्र नामे एक श्रावक रहेतो हुतो।
 ते पछो डालो अने धर्मी हुतो, तेना धर्मी स्वेच्छि साधारण हुती,
 पछु तेना बेडेवार पछो चेणो हुतो, तेवी हरीने एक लाख दृप्ति-
 आनी तेनी आपन् बाधाली हुती, युद्धिचंद्रना वयन उपर लोडोने
 पछो ब्रिक्षास हुतो, के वयन ते जोवतो ते अराणर पाणतो हुतो, आ
 वधु यवानुं कारणु इक्त तेना एक गुणुने लडने हुतुं, ते हेशकाण
 ग्रभाणु चालतो हुतो, तेज गाममां युक्तिदास नामे एक भीजे क-
 पटी आद्धारु रहेतो हुतो, ते भीजतुं साझे लेई बणे तेवो हुतो,
 अने ते कापाहावामां पछो हुथीआर हुतो, भीजने इसावी या-
 यो ए तेनो स्वलाप हुतो, युद्धिचंद्रनां लोडोमां सारां वभाणु थतां
 लेई ते आद्धारु भनमां णणतो हुतो अने युद्धिचंद्र हलडो पडे,
 चोपी युक्तिचो रचतो हुतो, तेना डाला हावाधी लोडो ३२ आता
 हुता, एक वर्षते चेतुं घन्युं हे, श्रावस्ती नगरीना राजने गामनी
 वयने एक मेडेव उत्तरवानो विचार थयो, तेचेयो हे, के मेडेव उपर-
 धी राज आभा नगरने लेई शडे, आ अपर युक्तिदासना जाणुवामां
 आयी, तेलु विचार्यु हे, युद्धिचंद्रने इसापवानो हवे अरोपर लाग
 आयो, हे, युद्धिचंद्रतुं घर गामनी वयनां हे अने तेनी गाने
 एक सुंहर देशर छे, ले राज तेतुं घर अने देशर पाई ते
 डालो चेडेव उरे तो, युद्धिचंद्र राजनी राजो धाय अने तेवी राज
 नामुश यधने युद्धिचंद्रने गामनी अहार काढी चुके, आठे राज-
 नी आणण जै आ पात जब्बावी अने युद्धिचंद्रने डेरान डरयो,
 आपुं भारी युक्तिदास राजने आस भगवा गयो, राजचे युक्तिदा-
 सने पुण्यु, युक्तिदासा १ डेम आव्या १ युक्तिदास बोलयो महासाला,
 के सांख्युं हे हे, आप गामनी वयने मेडेव इस्त्रा धारो हे, ए

એ વાત ખરી છે ? રાજએ કહ્યું, હા, મારો વિચાર છે, પણ તેવી જગ્યો કયાં છે ? તે હું શોધું છું. જુકિતદાસે કહ્યું, આપણા ગા-
મમાં બુદ્ધિયંદ્ર નામે એક શ્રાવક છે, તેનું ઘર અને દેરાસર ખરા-
ખર ગામની વચ્ચે છે, જે આપ તે ઠેકાણે મેહેલ કરો તો તે સારો
મેહેલ થશે. જુકિતદાસનાં આવાં વચ્ચન સાંલળી રાજને તે વાતનો
આથડું થયો અને તરતજ બુદ્ધિયંદ્રને પોતાની પાસે એલાંયો.



૫૧૮ ઊં મે.

હેશકાળ પ્રમાણે ચાલણું.

લાગ ર જો.

બુદ્ધિયંદ્ર રાજની પાસે આંયો અને પ્રણામ કરી ઉલ્લો રહ્યો.
રાજ એલાંયો, બુદ્ધિયંદ્ર ! મારે ગામની વચ્ચે એક મહેલ કરવો છે.
અને તમારું ઘર તથા દેરાસર ગામની વચ્ચે છે, તો તે જગ્યા ત-
સારે મને આપવી પડે. બુદ્ધિયંદ્ર મનમાં સમજી ગયો. તેણે
વિચાર્યું કે, જે આ વખતે રાજને ના કહીશ તો તેને આથડું થશે.
અને સામે થઈ અળાતકારે તે કામ કર્યા વિના રહેશે નહીં માટે
હેશકાળ પ્રમાણે વતીને જવાણ આપવો. આવું વિચારી બુદ્ધિયંદ્ર
એલાંયો, અહારાજ ! ધણી ખુશીની વાત. જે આપને જોઈએ, તે આં-
પવાની અમારી ઝરજ છે. આપ પ્રજના પાળક છો, અસે તમારી
પ્રજા છીએ. પ્રજએ પોતાના ધણીનો હુકમ માનવો જોઈએ. બુદ્ધિ-
યંદ્રનાં આવાં ભીડો વચ્ચન સાંલળી રાજ ખુશી થઈ ગયો. બુદ્ધિયંદ્ર-
નું ખરાખ કરવાની ધારણા રાખતારો જુકિતદાસ તરતજ પણી રા-

लानी पासे आनी रीते आवयो अने तेलु कहु, महाराज ! युद्धिं
थद्रे आपने शु' कहु, ? ता कही हयो, करणु के, ते धणु हुच्यो
छे. युक्तिहासनां ओवां वयन सांखणी शब्दगे विचार कर्यो के,
आ मालुसंज्ञ हुच्यो लागेछे. वणी ते युद्धिंथंद्रने हुक्मनं ज्ञान-
य छे. आतु' विचारी राज्य योवयो, युक्तिहास ! युद्धिंथंद्र धणो
लालो मालुस लागेछे, तेलु गोताना घर अने देशाशरनी ज्ञयोओ
मेडेव कर्वामां खुशी गोतावी छे. युक्तिहास योवयो ! ते ओवो
हुच्यो. मालुसछे के, उपर्यो हा पाठे अने अंहर बीजु' डोय, मारे
आप गोतावर तपास शण्णजे. ज्ञाने आप तेना घरसे अने देश-
शरने पाडी नांगवानो आरे हुक्म कर्वो त्यारेज ते केवो छे, ते
ज्ञान्यो. पछी राज्यके युद्धिंथंद्रने गोतानी पासे योवान्यो अने
युच्छु, एम युद्धिंथंद्र ! ताढ़ घर अने हेचाथर याडी नाणी ते
डेक्कने मेडेव कर्वावीसे तो तने कांध हरकत के के नहीं ? युद्धिंथंद्रे
लालु के राजानी भरणु सेम कर्वानी नथी पछु मारी परीक्षा
देवाने आ प्रभावे पुछेछे. पछी युद्धिंथंद्र योवयो, महाराज ! आप
के कर्वे तेमां मारे हरकतन नथी. मात्र घरने भाटे तो कांधपछु
चिंता नथी. पछु हेचाथरने भाटे भने चिंता यायेछे. वणी आप
नीतिवाणी अने धर्मी राज्ये, ओटेसे आपने कांध कर्वानी जड़र
नथी. के आपने योव्य लागे ते कर्वे. युद्धिंथंद्रनां आवां वयन
सांखणी राज्य खुशी धध गयो. अने कहु' के, तारा जेवा हेशाकाण
प्रभावे वर्तनारा मालुमो योदी हयो. ताढ़ घर अने देशाशर आ-
आह रहेहो. ले मेडेव कर्वानी कर्वे तो त्यां नहीं याय पछु
पेला युक्तिहासहु घर पाडीनि तमे हेशावे ययो. करणु के, ते ताश
जेवा आसा मालुस उपर अर्दभाल नाभनरे लक्जे मालुस छे,

સારધોધ.

દેશકાળ પ્રમાણે વર્તવાથી બુદ્ધિચંદ્રની જેમ સારું થાય છે અને
થીજાની અદેખાધ કરવાથી બુક્તિદાસની જેમ નઠારું થાય છે.



સારાંશ પ્રશ્નો.

૧ દેશકાળ પ્રમાણે ન વર્તવાથી શું થાય છે ?

૨ લડાઈ કરવામાં રો વિચાર કરવો ?

૩ લડાઈની આથ કોની સાથે લીડવી ?

૪ શક્તિ અને નથળાઈ શા વડે છે ?

૫ કેવા માણુસની પડતી થાય છે ?

૬ કેવો વિચાર કરવાથી સુખી થવાય છે ?

૭ નીતિશાખમાં સાત આપણત વિચાર કરવાને કહું છે, તે
સાત આખત કઇ છે ?

૮ શાથી ઝોટેહ મળે છે ?

૯ બુદ્ધિચંદ્રને શું થયું હતું ?

૧૦ બુક્તિદાસ કેવો હતો ? અને તેને કેવો અફ્લો મળ્યો
હતો ?



પાઠ ૪૦ મે.

લોકવિરુદ્ધ કામ કરવું નહીં.

જૃહસ્થ આવકે કંદ્પણું કામ લોક વિરુદ્ધ કરવું નહીં. કે અ-
મ કરવામાં લોકો સામે થાય આથવા નિંહા ફરે સેવું કામ કરવાની

આગળ પડણું નહીં. લોક વિરુદ્ધ કામ કરવાથી લોકોમાં નિંદા થાયછે. કહિ કોઈ કામ આપણુને આડું લાગતું હોય અથવા તે કામ કરવાથી ઘણો લાશ થાય તેથું હોય, તો પણ ને તે લોકવિરુદ્ધ હોય તો તે કામ કરવું નહીં. લોકવિરુદ્ધ કામ કરવાથી લોકો નિંદા કરે અને તેથી કરીને લોકોમાં માન ઘરી લયછે. હુમેશાં કેમ પણ તેમ લોકોના બેહેવારને અનુસરવું. લોકોથી જુદા પડી પોતાના વિચાર પ્રમાણે ચાલવું નહીં. લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કામ કરનારા ભાસુસને લોકો ધિક્કારે છે. લોકવિરુદ્ધ કામ કરનાર સાહુસંદ્રભી વાત લખુંબા કેવી છે.

પ્રતાપનગરમાં સાહુસંદ્ર નામે એક શ્રાવક રહેતો હતો. તેની સ્થિતિ ચારી હતી. ડેટલાએક ગુણોને લઈને લોકો તેને માન આપતા હતા. પણ ખધા શાળને ઢાંકે એવો તેનામાં એક ગોરો અવગુણું હતો અને તે અવગુણું એપરવાધુ રાખવાનો હતો. કોઈ પણ કામ તે લોકોની પરવા રાખ્યાવિના કરતો હતો.

પ્રતાપ નગરમાં ડેશરિચિંહ શળ હતો. તેને નવાં નવાં કોતુક નોંધાનો ઘણો શોખ હતો. એક વખતે શાળએ નગરમાં એવી દોષથ્થા કરાવી હૈ, કેના ઘરમાં ગોટી ઉમરની કુંવારી કન્યા હોય, તેણે પોતાની મરણથી શાળની ચાસે મોઝલવી. રાન હુમેશાં કુમારીકાની પુલ કરીને જગેછે. કે કે શાળનો કંચદો જારો હતો. અને તેનામાં જારો ખુદ્દિ ન હતી, પણ લોકોને તે વાત ગર્જી નહીં. અને કર્દના મનમાં ચચું હૈ, શાળની પાસે ગોટી ઉમરની કુમારિને ગોઝલવી તે હીક ન કહેનાય. આવું વિચારી લોકો તે વાતની વિરુદ્ધમાં પદ્ધયા. સાહુસંદ્ર શાળના મંત્રોનો મીત્ર હતો. મંત્રોના કરેલાની સાહુસંદ્ર પોતાની શાંતિ નામની ચુંબાન કુમારિને

રાજની પાસે મોકલવા તૈયાર થયો. આ વાતની લોકોને ખખર પડી. કેટલાએક તો તે વિષે સાહસચંદ્રને અટકાવવા ગયા, પણ તેણે તે માન્યું નહીં અને ચોતાની પુત્રી શાંતિને રાજની પાસે મોકલી. ચોતે પણ તેની સાથે ગયો. કેશરિસિંહ શાંતિને બોલાવી તેને પોધાક આપ્યો. અને ચંદ્રન કેશરનું તિલક કરી શાણગારી અને ખાવાનું આપી વિદ્ધાય કરી દીધી. સાહસચંદ્રને મનમાં ખાત્રી થઈ કે, લોકાને એટો વેહેમ છે. આ રાજની પાસે કુમારિકાને મોકલવામાં ડેઢ જાતને દોષ નથી. તેણે ધણું લોકોને સમજાયા પણ લોકોએ તે વાત માની નહીં. અથઃ લોકો સાહસચંદ્રની વિરુદ્ધ થઈ તેની નિંદા કરવા લાગ્યા. આખરે સાહસચંદ્રની દીકરી શાંતિને ડેઢ પણ પરણ્યું નહીં, તે જવળું સુધી કુંવારીજ રહી.



સારબોધ.

ડેઢ પણ માણસે લોક વિરુદ્ધકામ કરવું નહીં. લોકવિરુદ્ધ કામ કરવાથી સાહસચંદ્રની કેમ નિંદા થાય છે.



સારાંશ પ્રશ્નો.

૧. કેવું કામ કરવું નહીં ?

૨. કેવું કામ કરવાને આગળ પડવું નહીં ?

૩. લોકવિરુદ્ધ કામ કરવાથી શું થાય છે ?

૪. લોકોથી જુહા પડલું કે નહીં ?

૫. લોકો કેવા માણસને ધિક્કારે છે ?

૬. સાહસચંદ્ર કેવો હતો ?

૭. હેઠામાં શ્રી શાણ અને શ્રી અવગુણ હતો ?

૮ કેયરીનિષે કેવી વોપદ્વા કરવી હતી ?

૯ રાખ કરી પૂછ કરતો હતો ?

૧૦ સાહુસચંદ્રને લૈકનિડુદ્ર કામ કરવાથી શું થશું ?

૧૧ સાહુસચંદ્રની દીકરી શાંતિ નવજીવ શુધી કેવી રહી ?



પાઠ ૪૨ મો.

પરોપકાર.

હરેક ગૃહસ્થે પરોપકાર કરવો. ખીજનો ઉપકાર કરવો, એ ખરુણસ્થાધર્મિ છે. જાધાં માણુસો એક વાતના છે. એક ખીજને મહા કરવાથી આ ચંચાર સેહેલાધૂથી તરી શકાય છે. હરેક માણુસ દર્કને ઉપયોગી વાય છે. ખીજનું આપણાથી જાડું થતું હોય તો હોય શા માટે ન કરવું ? કે માણુસ ખીજનો ઉપકાર કરતો નથી, પણ કરવું નકારું છે. ઇમેશાં પરોપકાર કરનાર નવીનચંદ્રની કથો એવી લેવા ચો઱્ય છે.

વીજાપુરમાં નવીનચંદ્ર નામે એક વેપારી હતો, તે દ્વારાવે દુર્ઘીલ અને વધુ હતો. તેણી શુદ્ધ વેપારમાં વધોરે વાલતી, તેથી તેણું પણું વેપાર વધાર્યો હતો. વેપારનો બોનો વધારે વધાયાથી તેણે પરિણારી વાય કરવાનો ખીટાડુદ્ર વખત જણતો નહતો. આવાપીનામાં ખરુણે માંડિમાંડ વખત જગતો હતો. એક વખતે નવીનચંદ્રે જનમાં વિદ્યાધું હે. આ મનુષલાલ કુલેવા છે. દેરાદૂતા ગોરા ખીજને લઈને માણસી પણું કામ થતું નથી. જાડું કરવાધું જી સીતે શરે,

આવો વિચાર કરતો હતો, તેવામાં કોઈ સુશીલ નામે તેનો ભિત્તી
તેને ભળવા આવ્યો. સુશીલે નવીનચંહને ચિંતા કરતો જોઈને
પુછ્યું કે, ભિત્તી ! શેની ચિંતા કરે છે ? નવીનચંહ પોતાની બધી
વાત જણ્યાવી. ત્યારે સુશીલે કહ્યું. ભિત્તી ! જો તારે આત્માતું કલ્યાણ
કરવું હોય તો એક ઉપાય છે. વેપારના મોટા બોલને લઈને તું
દેવપૂજા, સામાયિક અને સાયાય વિગેરે કરો શકતો નથી. તો
તારે હુમેશાં પરોપકાર કરવો. રત્ને સુતી વખતે યાદ કરવું કે,
આજે મેં કેટલો પરોપકાર કર્યો ? એમ કરવાથી તારું કલ્યાણ
થઈ જશે. બધા પ્રતમાં પરોપકાર કરવાતું પ્રત મોટું છે. સુશીલનાં
આવાં વચ્ચન સાંલળી નવીનચંહ નિશ્ચય કર્યો કે આજીથી મારે
પરોપકાર કરવાતું પ્રત લેવું. પછી નવીનચંહ હુમેશાં પરોપકાર
કરવા લાગ્યો. તે પરોપકારના ડામમાં મન, આંખ, કાન અને વાળી
એ ચારને રોકતો હતો. મનમાં પરોપકાર કરવાતું ધારતો, આંખથી
પરોપકાર કરતાં જોતો, કાનથી પરોપકારને માટે સાંલળતો અને
વાળીથી પરોપકારનાં વચ્ચન ખોલતો હતો. હુમેશાં રત્ને સુતી વખતે
આજે ખીજનો ઉપકાર શો કર્યો, તેનો વિચાર કરતો હતો. કોઈપણ
માણુસતું લખું થતું હોય, તેમાં તે આગળ પડીને ભાગ લેતો હતો.
આથી નવીનચંહની ઝર્ણિ લોકેંમાં ઘણી ફેલાણી અને તે બધા
દેશમાં પરોપકારી નવીનચંહ એવા નામથી પ્રખ્યાત થયો.

સારષ્યોધ.

દૂરેક શ્રાવકે પરોપકાર કરવો. પરોપકાર કરવાથી નવીનચંહની
જીમ સારી ઝર્ણિ લથા પુછ્ય વધે છે.

સારાંશ પ્રાનો.

- ૧ ખરેણદે ધર્મ કર્યો ?
 - ૨ આ અંસાર રહેલાધારી થી રીતે તરી શકાય ?
 - ૩ ને બીજાનો ઉપકાર ન કરે તેનું લુપદું હેતુ છે ?
 - ૪ નવીનચંદ્ર કેવો હતો ?
 - ૫ કુથીલે નવીનચંદ્રને શું કહ્યું હતું ?
 - ૬ રાતે સુતી વખતે શો વિચાર કરવો જોઈએ ?
 - ૭ પરોપકારમાં કષ્ટ કષ્ટ ધર્દ્રિયો જોઈવી જોઈએ ?
 - ૮ નવીનચંદ્રને પરોપકાર કરવાધી શું થયું હતું ?
-

પાઠ ૪૨ મો.

લાજ રાખવી.

શાયક ગૃહદ્વારે દમેશાં લાજ રાખવી જોઈએ. લાજ વગરને માલુમ જરૂરાદી અથવા લાન્નોના વગરનો ગણુય છે. જેનામાં લાજ છે, તે માલુમ પોતાના માપું લય તોપણું પોતાની પ્રતિસા છોડો દેતો નથી. નીતિચારમાં લાજને પૂલ્ય માતા જેવી ગણે છે. જેહું માન માતાને આપણું જોઈએ, તેહું માન લાજને આપણું જોઈએ. શોડો કે માલુમને નિર્દેશ કરે છે, તે માલુમનું લુપદું નહાખું છે. માધુચંગાં જોડું લાજ હોય તો બીજા શુષ્પ જેની જોળે આવે છે. લાગવણી માલુમ રૂપ સાખી થકે છે, બોલ્યું પાણે છે અને અદેલી અરેતાં લાગ સહજ રહી ગાડે છે. લાજનું ઠોકાં હુદ્દું હોય છે, અંખની શરમ ઉદ્દેશ્ય.

માણુસ અંધળો ગણ્યાય છે. લાજના ગુણુથી લક્ષ્મીચંદ્રને નગર શેડની પદવી મળી હતી.

વિનોદપુરમાં લક્ષ્મીચંદ્ર નામે એક જીવાન શ્રાવક હતો. તેના પિતાનું નામ જિનદાસ અને ભાતાનું નામ શિવશ્રી હતું. લક્ષ્મીચંદ્રને જૈન ધર્મનું જાન સારું હતું. તે હુમેશાં હિવસમાં અસુક વખત ધર્મનાં પુસ્તકો વાંચ્યા કરતો હતો. શ્રાવકમાં કેવા કેવા ગુણો હોવા જેઇએ, તે અધું સારી રીતે જાણુતો હતો. અધા ગુણમાં તેના હિલમાં લાજને ભાઈ મોહું માન હતું તેથી તે હુમેશાં પોતાના પ્રાણુની જેમ લાજને ગણુતો હતો. લાજના ગુણુથી આખા વિનોદપુરમાં લક્ષ્મીચંદ્રની શાખ વધતી જતી હતી.

એક વખતે ત્યાંના રાજને પૈસાનો ખ્રષ્ટ પડતાં તેણે પોતાના ગામના અધા ધનવાન ગૃહસ્થોને ઓલાંયા અને પુછ્યું કે, મારા અજનનામાં હાલ પૈસો નથી અને અત્યારે રાજ્યનું રક્ષણ કરવાને પૈસાની જરૂર પડી છે, તમે મારી પ્રભલમાં ધનવાન ગૃહસ્થો છો ભાઈ મને પૈસાની મહદ આપી શકશો કે નહીં ? જો જરૂર પડશે તો જ હું તમારી મહદ લઈશ. રાજના કહેવાથી અધા શાહુકારોએ એ મહદ આપવાની હા કહી તેમાં લક્ષ્મીચંદ્રનો પિતા જિનદાસ પોણું હતો, અધાએ પોતપોતાને ઘેર આંયા. થોડા હિવસ પછી રાજને પૈસાનો ખ્રષ્ટ પડયો, એટલે અધા શાહુકારોને ઓલાંયા. શાહુકારોએ મળી વિચાર કર્યો કે, રાજનો વિશ્વાસ શી રીતે થાય ? કફિ તે પૈસા પાછા આપે નહીં તો શું કરી શકિએ ? આખું વિચારી છુમા શાહુકારો રાજની પાસે ગયા નહીં. તે બાત જાણી લક્ષ્મીચંદ્રે પોતાના પિતાને કહું, "આપા ! આ શું કરો એ ? રાજની આગળ હા કહીને પછી ના કહો છો, તે કેવી નિર્દ્દેશ બાત કહેવાય ? ઓલેલું

क्षयन पाणिं लेइचो. तेनामां लाज न देय, ते महुङ्क लेइचो
वयन आणे नही. राजा आपणा खादन करताऱ्ह ऐ. तेना विवाह
उपर चोटा उपकार छ. तेनी आगण हा एहुने अधी न छेव.
ते आज न क्षेवाय. नीतिचो. भवे ना ठेल, पछु वाप्हु दी देव.
क्षेवुं वयन पाणिं लेइचो. ले तमे ना क्षेवो ते सदे विवाह
शरम लाग्यो. हुं लाजने लधने घरमांथी आडेर गांव वाची
लधश. लक्ष्मीचंहना आपां वयन सांसारी नितदाढ़ उम्ही क्षेव.
पोतानो पुन आयो लाजवाणो छे, ते नाणीने तेना सरमा विवाह
आनंद आयो. पछी तेणु लक्ष्मीचंहने पोतानी क्षेवे हुन्हेच्छ
मन लधने शाळानी पासे मोड्यो. बीज शाहुदरो डोर्ड उम्ही क्षेव
आव्याज नही. पछवाडेथी राजाचे लक्ष्मीचंहनी अधी शरम वा
भणी अने तेनामां लाजने. मोटो शुषु लेइ ते वृष्णुनु कुर्की क्षेव
गेगो. अने लक्ष्मीचंहने नगरग्रोहनी पदवी आभी.

सारधीय.

दरेक आपक गुद्दत्वी लाजने. शुषु राज्यो लेइचो. लाज
लधने वेत्युं पाणी शकाय छे जाने तेथी लक्ष्मीचंहनी नेम वा
पदवी मेणवी शकाय छे.

सागांश मध्ये.

- १ तेनामां लाज नवी ते ईचो गत्काय छे ?
- २ तेनामां लाज देय, ते शुं अी शहे छे ?
- ३ नीतिशास्यमां लाजने क्षेवे एही क्षेव ?
- ४ निवाल आपुवानु लाजवे क्षेवे क्षेव ?
- ५ वाजवाणी आपुव शुं क्षेव ?

૬ આંધળો માણુસ કચો ગણ્યાય ?

૭ લક્ષમીચંદમાં શો ગુણુ હતો ?

૮ લક્ષમીચંદ નગરશોઠ શાથી થચો હતો ?

૪૧ ૪૩ મે.

કુર દેખાવ ન રાખવો.

શ્રાવક અહુસ્થે હુમેશાં પોતાના ચેહેરાને દેખાવ ન સ્વરૂપ રાખવો.
કુર દેખાવ રાખવો નહિ. જેનો ચેહેરો કુર દેખાય, તેની ઉપર
લોકો નારાજ રહે છે. તેવા માણુસથી લોકોને જોતાંજ ઉદ્ઘેગ થાય
છે. જે માણુસના ચેહેરાને દેખાવ ન સ્વરૂપ હોય, તે માણુસ ઉપર
લોકો હુમેશાં ઝુશી રહે છે. અને લોકો તેનું આરાધન કરવા આવે
છે. કુર દેખાવવાળા માણુસ પાસે લોકો બીજથી જતાં નથી. જેનો
દેખાવ કુર ન હોય, તે માણુસ લોકમાં સૌભય પ્રકૃતિવાળો ગણ્યાય
છે. ચેહેરાને દેખાવ કુર રાખવાથી દુર્સુખ નામના એક માણુસના
ખીલ ગુણુ ઢંકાઈ ગયા હતા.

કંકણુસુરમાં દુર્સુખ નામે એક શ્રાવક રહેતો હતો. તે ધર્મ
ઉપર પ્રીતિવાળો અને ઊદાર હતો, પણ તેનો ચીડીઓ સ્વભાવ
હતો. તેથી હુમેશાં તેનો દેખાવ કુર રહેતો હતો. ડાઇ દિવસ તેનો
ચેહેરા ઝુશીમાં રહેતોનું નહિ. અને તેથી હુમેશાં તેનું મોં પણ
ચડેલુંજ રહેતું હતું. આથી કરીને લોકો તેને દુર્સુખ એવા નામથી
આળખતા હતા. તેને વેર વિવાહનો કે ધર્મનો માંગલિક પ્રસંગ
આવતો તોપણુ તેના ચેહેરા ઉપર હર્ષનો દેખાવ થતો નહેતો. તેના
સજાંવહાતાંઓ પણ તેની પાસે જતાં નહિ અને પોતાને વેર એં-
લાવતાં પણ નહિ. એક વખતે તે ઊદારતાઓ પોતાના ધરના આં-

ગાંધીમાં દાન હેવા બેડો, ને કોઈ ભાગુલ નીકળો તેને તે દાન આપવાને બિલાવતો પણ તેનો કૂર ચેહેરો જેઈ કોઈ પણ ભાગ ઘુસેની પાંચે કર્તૃ નહીં નહીંતું, ઘણીવાર બેસી રહ્યો તો પણ કોઈ ભાગુલ તેની પાંચે કર્તૃ નહીંતું, ઘણીવાર બેસી રહ્યો તો પણ કોઈ ભાગુલ તેની પાંચે નાઓંયું નહીં. પછી તે કંટાળીને ડી ગયો અને બીજે ટિકસે શુદ્ધ પાંચે કર્થને તેણે પોતાની બધી હુકીકત લાઢે કરી, ગુરુંએ તેને જણુાંયું કે, શેઠ ! તમારે હમેશાં જોખ્ય (સારા) દેખાવથી રહેખું, બીજીએ સ્વલ્પાવ રાખવો નહીં. આવકનો બેહેરો હમેશાં આતંકી હેવોં લેખું. તમારો દેખાવ કૂર હોવાથી બોડો તમારાથી કરે છે. ગુરુનાં વચનથી હુસુખ સુધરી ગયો અને તે બેટલે સુધી સુધ્યો હે, પછી બોડો તેને સુસુખ બોવા નામથી બોલાવા લાગ્યા.

સારખેધ.

હેડે શાવકના બાળકે પોતાનો દેખાવ જોખ્ય રાખવો જેઈએ, નાણદેંદે બેહેરો રાખવાથી હુસુખની પેટ બોડોમાં અભિય ધવાય છે અને ચાદો દેખાવ રાખવાથી સુસુખ નામ બેંગવી બોડોની પ્રીતિ મેળવાય છે.

સારાંશ પ્રશ્નો:

૧. શાવકે બેહેરાનો દેખાય હેવો રાખવો જેઠુંબે ?
૨. હેવા બેહેરા ઉપર બોડો નારાજ રહે છે ?
૩. બોડો હેવા બેહેરા ઉપર શુદ્ધી રહે છે ?
૪. હેવા દેખાવવાળા ભાણુભાણી પાંચે બોડો જરૂર નથી ?
૫. હેવા કૂર ન હોય તો ને બોડોમાં કેવી પ્રકૃતિઓ અનુભૂતિ હોય ?

६ हुमुख केवा हतो है ॥

७ तेनी उपर लोकेनी अभ्रिति केम थहर हती है ॥

८ ते सुमुख शाथी कहेवाये ?

पाठ ४४ मे।

गृहस्थ श्रावकना सामान्य धर्म विषे ॥

उपजलिनी चाल ॥

हुराथें चित्त कहि न धारा,
विशेषथी ज्ञान सहा वधारा;
अतिथि सेवा सुभूथी प्रसारा,
गृहस्थनो ते शुल धर्म धारा.
१ परस्परे क्लेम न थाय क्लाये,
धर्मार्थ ने कामज्ज तेम साध्या;
३ निवर्गनो ते ४ सुभकार धारा,
गृहस्थनो ते शुल धर्म धारा.
विचारि चालो वणि देश काण,
५ विद्धि द्वारे करीने कुर्चयाल;

१ सांबणवानी धर्मा, २ सांबणवुं, ३ सांबणाने ग्रहणु करवुं, ४ तेने
धारी राखवुं, ५ तर्ह करवो, ६ समाधान करवुं, ७ अर्थ जाणुना ॥ ८ तत्वतु
ज्ञान ए आठ गुण युद्धिना कहेवाय छे ॥ २ सारा गुण उपर पक्षपात करवो ॥
१ भांडेभांडी, २ भाव न आवे तेम, ३ धर्म, अर्थ अने झाम ए न थुनो
वर्ज ते निवर्ग, ४ सुभ करनारा धारा-रीवाज, ५ विचारधारा, ६ तहारा रीवाज

“બુદ્ધાભયો જોઇ કરેં અચાચા,

ગૃહસ્થનો તે શુલ ધર્મ ધાર્યા.

૩

“બુદ્ધાભયી લોક “દુચિ વધાર્યા,

પરંયકાર્ય જગમાં પ્રસાર્યા;

દવજા અને સૌભય “શુણો સુધાર્યા,

ગૃહસ્થનો તે શુલ ધર્મ ધાર્યા.

૪

ખંડ ૩ બે.

જૈન નીતિ આચાર.

પાઠ ૪૫ મો.

મનની મોટાઈ.

હરેક આપડેના છોકરાલો મનની મોટાઈ રખવી જોઇએ. કેનું મન મોડું દોષ છે, તેની ઉપર ધધા લેડો ગ્રીતિ રખેછે. મનની મોટાઈ રખવી તેના કેવો બીજો ડોઇ ઉચ્ચા શુણ કહેવાતો નથી, કેનું હિં હચું દોષ, તે માલુમ હુશેણા સતીવી હોયછે. આ હિંનિયામાં કે ચાલ્યાં ઉચ્ચા હિંના ઘર ગોયાએ, તે વધાની ગ્રન્ઝિ

જીતલ અને આરોગ જોઈને પચાર કર્યા. / આરા પ્રમથા. / સોફાના ગ્રીત ૧૦. બાદિસ્કે જોઈનો હિંના યોગ-યોગ રખ્યા

હજુ સુધી ગવાય છે. મનની મોટાઇથી કપૂરચંદ્ર નામનો એક શ્રાવકનો છોકરો ઘણો લોકપ્રિય થયો હતો અને મોટી પાઠશાળામાં તેને અધા વર્ગની અંદર મોટું માનું મહિયું હતું.

કુંદનપુરમાં રાજચંદ્ર નામે એક શ્રાવક હતો. તેને કપૂરચંદ્ર કરીને એક છોકરો હતો. તેનામાં ભાગપણથીજ સારા સારા ગુણો દેખાતા હતા. તે અધા ગુણો કરતાં તેનામાં મનની મોટાઇનો એક ગુણ સર્વથી સારો હતો. એ ગુણને લઈને તેને લોકો ઘણા ચાહુતા હતા. કોઈનું સારું થતું હોય તો તેમાં તે પૂર્ણ રીતે ભાગ લેતો હતો. એટલું જ નહીં પણ બીજાનું સારું થતું હોય અને પોતાને ગેરલાલ થતો હોય તો તેની તે દરકાર કરતો ન હતો.

એક વખતે કોઈ ગૃહસ્થ તેને ઘેર મીજખાન તરીકે આવ્યો, રાજચંદ્રનો તે સારો સ્નેહી હતો. તેણે બીજાની પાસેથી કપૂરચંદનાં વખાણું સાંભળ્યાં. તે સાથે એવું પણ સાંભળ્યું કે, કપૂરચંદમાં મનની મોટાઇનો મોટો ગુણ છે. આથી તે ગૃહસ્થે કપૂરચંદના તે ગુણની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. પછી તે ગૃહસ્થે કપૂરચંદને આલાવીને આ પ્રમાણે પુછ્યું, કેમ કપૂરચંદ શું ભણો છો ?

કપૂરચંદ—કાકા ! હું જૈન ધર્મની પેહેલી ચોપડી બણું છું.

મીજખાન—તારા વર્ગમાં કેટલા છોકરા છે ?

કપૂરચંદ—મારા વર્ગમાં વીશ છોકરા ભણે છે.

મીજખાન—તે વર્ગમાં અધા છોકરાઓ સારા છે કે નહારા છે ?

કપૂરચંદ—કાકા તે મારાથી શી રીતે કહી શકાય ?

મીજખાન—આજે હું તને આ વીશ પુસ્તકો આપું છું, તે અધાને સરખી રીતે વેણું ચી આપજે. તે વીશ પુસ્તકમાં એક ચોપડી ફોટેકી છે, તે છેવા છોકરાને આપજે.

કૃપુરચંહ—ધર્મ ! બદુ સારુ.

પછી કૃપુરચંહ પાદયાળામાં આવ્યો અને ચોતાના શિક્ષકની લાગળ તે ચોપડીઓ શુક્રિને તે મીજણાનની બધી વાત ઠેણી જાતાવી. પછી શિક્ષક કલું હે, કૃપુરચંહ, આ ચોપડીઓ તું લાંબો, માટે તું તારે લુંબે વેહેંચી આપ. પછી કૃપુરચંહ બધી ચોપડીઓ વેહેંચી આપી. તેમાં કે નહારી ચોપડી હતી, તે ચોતે લીધી. તે લેણ શિક્ષક શુદ્ધથું, કૃપુરચંહ, તે નહારી ચોપડી હેમ લીધી ? કૃપુરચંહ—સાહેણ ! ખીજને નહારી ચોપડી હેવી અને ચોતે નહારી રાખવી તે અનીતિ ગણ્યાય છે. વળી ખીજને જે આવી જુની ચોપડી આગી હોત તો તેનું મન હુંખાય, તે કરતાં મારે ચોતાને જેવી ચોપડી લેવી તે વધારે સારુ. આ સાંસળી શિક્ષક કૃપુરચંહ ઉપર બદુ શુશી રહ્યો અને કૃપુરચંહના મનની ચોટાઈને માટે વર્ગની જાંદર તેનાં વખાણું છ્યાં. આ વાત મીજણાનના લઘુવામાં આવતાં, તે એવો શુશી રહ્યો. અને તેથે કૃપુરચંહને ખીજુ નવી પાંચ ચોપડીઓ નેટ આપી.

સારખોધ.

કૃપુરચંહની કેમ મનની ચોટાઈ રાખવી નેઇઓ.

સારાંશ અન્તો.

૧. મનની ચોટાઈ રાખવાથી શું થાય છે ?

૨. મનની ચોટાઈ રાખવી, કે એવો શુદ્ધ છે ?

૩. નેટ ડિલ ઉચ્ચ ઢાય તે એવો માણસ ઢાય છે ?

૪. કલું કુણી ઝણી શીતિ ગણ્ય છે ?

24
25
26

27
28

29
30
31

32
33

34
35

36
37

38
39
40

41
42
43

44
45
46

47
48
49

50
51
52

53
54
55

56
57
58

59
60
61

62
63
64

65
66
67

68
69
70

કેરી ચાપને સાધુઓ નિત્ય જાવે,

અત્થ તૃપદી ઘરમનો ઝૂંડ જાલે;

જાણનિ કથ તણો રેખાંતે તે ગળાયે,

કરી ચાપ જો આવહો શુદ્ધ જાવે.

પઠ ૪૭ મે.

વીશ પારાની માળા.

દેવનગરમાં ગુણુધર નામે બોક છોકરો હતો. તે બણોં કણ-
યાઓએ અને લાણુંબાં હઠીલો હતો. તે નાની ઉમરમાંથીજ તોકા-
ની હતો. તેના આપનું નામ આર્હતદાસ હતું. તેનામાં નામ પ્રમાણે
શુદ્ધ હતા. ચવારધી તે ચાંદ સુધી તે અરિહંત પ્રલુની કાંઈતન
હતો. હતો. આર્હતદાસ શુદ્ધપરને દુમેશાં બોણો બોણો બાધ આપતો
હતો. બોક વખતે આર્હતદાસે શુદ્ધપરને કલું કે, યેટા, આ બોકદી
સાદી માળા સાદી ડેકમાં પેઢેચાંસ છું. હવેથી તારામાં તેમ કેમ શુદ્ધ
અપતો નથે, તેમ તેમ તે માળામાં હું રોનાનો બોક બોક પારો
વધારતો જઈશ. શુદ્ધપરને ત્યારધી સોનાના પારાની માળા પેઢેરવાનો
દોષ યથો જને તે દુમેશાં બોક બોક શુદ્ધ વધારતો હતો. છેઠે
તેનામાં વીશ શુદ્ધ આવ્યા બેટલે તે વીશ પારાની માળા પેઢેરી
માદધાળમાં અધ્યાત્મા જતો હતો. બોક વખતે તેના ચિંભકે શુદ્ધપરને
શુદ્ધથું કે, આ શુદ્ધ પારાની માળા યેની ચેરી શુદ્ધપર બોલ્યો—
તે વીશ શુદ્ધ નેણાવ્યા છે, તેની ચુ

સા આપણે માળા

ચેહેરાવી છે. શિક્ષકે કહું, તારામાં એ વીશ ગુણુ કર્યા કર્યા છે ? તે કહી સંલગ્નાવ. ગુણુધરે કહું, સાહેખ મારામાં ચેહેરો ગુણુ—એ છે કે, હું કોઈ હિવસ અટક્યાણું કરતો નથી. અને ગુણુ—હું કોઈથી ચીડતો નથી. તેમ કોઈને ચીડવતો નથી. ત્રીજે ગુણુ—કહિ પણ કળ્યેા કરતો નથી. ચોથે ગુણુ—કોઈની સાથે ગાળગાળી આવતો નથી. પાંચમે ગુણુ—કોઈ જતની હડ રાખતો નથી. છોટા ગુણુ—કોઈનાથી રીસાતો નથી. સાતમે ગુણુ—કોઈની ચાડી કે કોઈની અદેખાઈ કરતો નથી. આઠમે ગુણુ—કોઈની નિંદા કરતો નથી. નવમે ગુણુ—કોઈની ઉપર ઓદું આળ ચડાવતો નથી. દશમે ગુણુ—કોઈની સાથે નંગાડું વર્તન રાખતો નથી. અણીયારમે ગુણુ—હુમેશાં પ્રસંગતા રાખું છું. આરમે ગુણુ—સાચું અને મીહું ઓદું છું અને ઓલવામાં તોછડાઈ રાખતો નથી. તેરમે ગુણુ—સર્વની સાથે નમૃતાથી વર્તું છું. ચ્યાદમે ગુણુ—ખીજની તરફ લાગણી રાખું છું. પનરમે ગુણુ—કેદુંના કામમાં હરકત ન થાય, તેમ શાંતિ તથા ધીરજથી વર્તું છું. સોણમે ગુણુ—રસ્તામાં રઘણતો નથી. સતતરમે ગુણુ—વખતસર નિયમ પ્રમાણે કામ કરું છું. અદારમે ગુણુ—ગળેલું પાણિ પીડિં છું. ચાગણીશમે ગુણુ—કાચું કે વાસી અનાજ ખાતો નથી, તથા સારો પદ્ધાર્થ મળે તો પણ વખત વિના ખાતો નથી. વીશમે ગુણુ—હુમેશાં સમય પ્રમાણે વર્તું છું.

સાહેખ, આ વીશ ગુણુ મેં થાડે થાડે વધાર્યા છે અને તેના અહુલામાં ભારા બાપે આ વીશ પારાની ભાળા મને ચેહેરાવી છે. અને આ ભાળાથી હું હુમેશાં એ વીશ ગુણુને યાદ કર્યા કર્યાં છું.

शिक्षक—છોકરાચો, આ શુલ્ષુપ્છરની લેમ તમે બધા બોલા
વીશ શુલ્ષુ નેણવતે અને આવી વીશ પારાની માળા તમારા ગ-
જાગાં ધારણુ કરને.

સારખોધ.

આપણના હરેક છોકરાચો શુલ્ષુપ્છરની લેમ તે વીશ શુલ્ષુ ધારણુ
કરવા નેહાચે, અને આઈતાસની લેમ હરેક માખાએ પોતાના
છોકરને તેવી રીતે વતચારીની સુધારવા નેહાચે.

સારદંશ મૈનો.

- ૧ શુલ્ષુપ્છર હેવો છોકરે હતો ?
 - ૨ આઈતાસ હેવો આપક હતો ?
 - ૩ શુલ્ષુપ્છરને સુધારવા આઈતાસે ડેવી શુક્તિ કરી હતી ?
 - ૪ વીશ પારાની માળા ડેવી રીતે બધ હતી ?
 - ૫ તે વીશ શુલ્ષુ કયા કયા હતા ?
 - ૬ ચિદ્ધકે શુલ્ષુપ્છરનો ટાણકો કઈ ઠીકાણને ડેવો બાધ
આપો હતો ?
-

પાઠ ૪૮ મો.

વિનય.

આપણા હરેક છોકરાચે વિનયશુલ્ષુ રાખવો નેહાચે, કેન્દ્રા-
ભાગાં કર્મશુલ્ષુ મૂળ વિનય કરેલો છે. નેતાજાં વિનયશુલ્ષુ છે, તે
જીના જીનું અધિકારી અહ હશે ઓ વિનય વિના પરિનામનાચે.

વિનય રાખવાથી ધર્મ વધતો જાય છે અને વિનય છેઠવાથી ધર્મ ઘટતો જાય છે. જેનામાં વિનય હોય છે, તે માણુસમાં આચાર પણું સારો હોય છે. પોતાના સગા, સ્ત્રોહી, ભિત્ર અને વડિલોની સાથે કેમ વર્તાવું જોઈએ ? જેઓ આપણુથી મોટેરા છે અને જેઓ આપણુથી નાજેરા છે, તેમની સાથે કેવી ચોણ્યતા રાખવી જોઈએ ? એ બધો વિચાર વિનય રાખવાથી થધું શકે છે. વિનય રાખવા ઉપર નયચંદ્ર નામના એક શાવકનો હાખલો ધડો લેવા ચોણ્ય છે.

શ્રીકાંત નગરમાં સોમચંદ્ર નામે એક શાવક હતો, તેને માધવ ડેશવ અને નયચંદ્ર નામે તણું હીકરા હતા. સૌથી મોટો માધવ ધર્ણો ધર્મી હતો. ડેશવ વિદ્વાન હતો અને નયચંદ્ર વિનયી હતો. માધવને ધર્મતું જ્ઞાન સારું હતું, પરંતુ તેનામાં વિનય ન હતો. ડેશવ વિદ્વાન હતો પણું તેનામાં ધર્મ અને વિનય ન હતા. અને નયચંદ્ર વિદ્વાન ન હતો પણું તેનામાં ધર્મ અને વિનય હતા. તેમાં પણું વિનય શુણું વધારે હતો.

એક વખતે ત્યાંના રાજ દીપસિંહને જળ દરનો રોગ થયો. તેવામાં કેછિ નિમિત્તિએ આવી ચઢ્યો, તેણું રાજનો કહું કે, તામારા ગામમાં જે વિનયી હોય તેની પુણ કરો તો આ રોગ મટી જાય આથી રાજએ નગરના શુણ્ણી લોકોનાં નામ પુછી પુછીને બધાને બોલાવા માંડ્યા. બધાનો મેળાવડો કરી કહું કે, જેનામાં વિનયશુણું હોય, તે એડા થધ આવો. તે સાંભળી ધર્ણો લોકો રાજના માનની ઈચ્છાથી એડા થયા. એટલે રાજ મુંઝાયો, પછી તે નિમિત્તિયાએ પોતાની વિધાના પ્રલાવથી એક પુલ સુકૃષું અને કહું કે, જેનામાં વિનય શુણું હો, તે માણુસ જે આ કુલને અહૃતો તો તે ખીલતું હજ્જેશો અને ધીજા અહૃતો તો તે પુલ કરા.

માટે જરો, પછી બધા માણુસો અડકતાં તે હુલ કેરમાઈ ગયું
જેને નયારું નયચંદ્ર તેને અડકો જોઈકે તે હુલ ખીચતું રહ્યું
તે જેઠું બધા આશ્વર્ય મારી ગયા તેના જોયા જાએ માથચ અને
કૃષ્ણ પણ શરગાઈ ગયા પછી જાલને નયચંદ્રની જોયા કાદ્યી
પુલ કરી જાને તેસે જરાદરનો શરીર મરી ગયો.

—૧૦૩—

સારથોધ.

દેખ શ્વાસદે વિતયશુદ્ધ શરળવો લેધાને, વિનયથી નયચંદ્રની
નેમ જોઈ માન ગયે છે.

—૧૦૩—

સારાંશ પ્રનો.

૧. ખર્ચતું ગૂણ શુદ્ધ છે ?
૨. ધર્મનો પૂર્વી અધિકારી કોણું ધર્મ રહે ?
૩. દેખા માણુસમાં આચાર હોય છે ?
૪. નયચંદ્ર કેવે હતો ?
૫. તેના બે લાઉંઓ કેવા હતા ?
૬. જાલને નયચંદ્રની પુલ શા માટે હોવી હતી ?

—૧૦૩—

પાઠ ૪૮ મો.

શાલાર.

એક વખતે કેનદ્રાણાતા જ્ઞાનસારીઓને ચોતાના શરૂને વિ-
નાય કરી હૈ, જાહેર કરી જોમેને કોઇ દિવસ ન બુનાય તે-
ની જોપું નની આખત જીજવે, ઊડાચાણીની તે વાત જાંબળી શુ-
દ્ધ જુદી માટે જરૂર જને તેમણે આ અમાસુ હતું, શાલારો તને
જીમના જરૂર જાહેર રહ્યો.

આચાર, લાવ, રમુજ.

છોકરાઓ તે વ્રણ શખદ લગ્યા. પછી ગુરૂએ પુછ્યું, એ
વ્રણ શખદનો અર્થ કહો.

પેહેલો છોકરો બોલ્યો—આચાર એઠલે પોતાના હેશની અ-
ને કુળની ચાલી આવેલી સારી રીત.

બીજો છોકરો બોલ્યો—લાવ એટલે મનની સારી લાવના,

બીજો છોકરો બોલ્યો—રમુજ એટલે ખુશી—મજાહ.

ગુરૂ બોલ્યા—છોકરાઓ ! એ વ્રણ શખદોમાંથી એક એક
ઘેલા અક્ષરો લઈને એક શખદ ણનાવો.

આચારનો પહેલો અક્ષર એના, લાવનો પહેલો અક્ષર એના
અને રમુજનો પહેલો અક્ષર એ એધાનો આલાર શખદ થયો.

ગુરૂ બોલ્યા—છોકરાઓ ! હવે તમે એ શખદનો અર્થ સુમજશો.
આલાર માનવો એ મોટામાં મોટો ગુણ છે. જે માણુસમાં બી-
જાનો આલાર માનવાનો ગુણ છે, તે માણુસની અંદર આચાર,
લાવ અને રમુજ—એ વ્રણે ગુણું આવે છે. જેનામાં સારો આચાર
હોય, સારો લાવ હોય, અને રમુજ સ્વલ્પાવ હોય, તે માણુસ
બીજાનો આલાર માણી શંકે છે. છોકરાઓ ! તમે હમેશાં બીજા-
નો આલાર માનજો. કોઈ પણ માણુસે આપણો કાંઈ પણ ઉપ-
કાર કરેલો હોય, તેનો હૃદયથા આપણે આલાર માનવો જોઈએ. જે
માણુસમાં આલાર માનવાનો ગુણ નથી, તે માણુસ બેકદર કહેવાય છે. તે-
વાનક્રટ માણુસને કોઈ કૂરીવાર મદદ આપતું નથી. બીજાઓનો આલા-
ર તો કહિ કોઈ પ્રસંગે મનાય છે, પણ જે તમારા ખરેખરા હમેશાના ઉપ-
કારી છે, તેમનો તો તમારે જાવળું સુધી આલાર માનવાનો છે. માણુસને

શેતાની કંઈકામાં અનુભવ રદુ ઉપકાર કરતાં છે. ગેડેલાં ૭-
પાદારી માણસે, પોતા ઉપકારી પરિશ્રદ્ધ, અને મીલ ઉપકારી વિદ્યા
શુદ્ધ—એ વર્ષેના તરે કુચે ત્યાં સુપી આખારી છે. તે ઉપર એક
વર્તી ૬, તે થાંબળો. કોમચર્ટ માનવો એક બન્ધુર્થ દુરોશાં ચ-
કાની પુલ કરતો હતો. એક વર્ષાં થિયે પ્રસ્તર થઇને કહું કે,
તું વરદાન માગ. ત્યાં કોમચર્ટ એ દ્વારા લેડીને કહું કે, જે
તરે મારી ઉપર પ્રસ્તર યથા હો તો, તરે મને આખાર માનવાનો
શુદ્ધ આપો. આથી થિયે વધારે ખુશી થઇને તેને તે શુદ્ધ ઉપરાંત
જોલે હિટલેઓએ વેલવ આપ્યો. છેઠરાઓ ! આ દાખલો મનમાં
થઇને દુરોશાં આખાર શુદ્ધ રાખતાં શીખનો. કોઈએ ઉપકાર કર્યો
કોણ, તેને ઇદી પણ વિસરવો ન લોછું.

શુદ્ધનાં આ વચન સાંભળી એકરાઓ ખુશી થઇ ગયા, અને
ત્યારથી તેઓ કર્યાને આખાર માનવાનો જોડો. શુદ્ધ શીખી ગયા,
અને તે આખાર શુદ્ધનો કોષ આપતાર શુદ્ધનો પણ તેમણે આ-
ખાર માન્યો.

સારબોધ.

હેડે આપણના એકરાને ઉપકાર કરતારનો આખાર માનવાનો
થિયો. શુદ્ધ પારશુ કરવો નોંધું.

સારાંશ મનો.

૧ એકરાને પૈતાનો શુદ્ધને કૃતી નિરતિ કરી રહ્યો ?

૨ શુદ્ધને ડાયા રદુ શરીરો ઉપાયો હતો ?

૩ તો ઉપાયો બધીનો કર્યો હતો.

(१०६)

- ૪ એ ત્રણુ શાખદોના પેહેલા અક્ષરોથી કોયો શાખ બસ્યોછે ?
 ૫ ગુડુએ આભાર શાખને માઈ શું કહું હતું ?
 ૬ હુમેશાં ઉપકારી કોણુ કોણુ છે ?
 ૭ ક્ષેમચંદ્રને અને યક્ષની શી વાત છે ?



પાઠ પૂઠ મો.

આવક કેવો હોય ?

છાપો.

આવકનો સુત કદિ અનીતિ જરા ન ધરશે,
 રાખી સાચમાં ટેક જૂઠને હૂરજ કરશે,
 સહાય કરી રનિજ ધર્મબધુનાં હુઃખજ હરશે,
 ગ્રેમે ઉરઉપકાર કરી નિજ મનમાં ઠરશે,
 એવા આવક રતનથી સંઘ તણી શોસા વધે,
 ધર્મ અને યશ તેહુના પ્રેસરે આ જગમાં બુધે.



પાઠ પૂરુ મો.

નડારા આવક વિષે.

છાપો.

જે બોલે સુખ જુઠ કરે જે કાસ નડારાં,
 પુરધન ને રૈપરનાર હુરે જે અની ઠગારા;

૧ મુત્ર. ૨ પોતાતા સાધમાં ભાઇઓના.

૧ પારક્ષ પૈસો. ૨ પારકી ળી.

દોલ મણી લલચાઈ કરેં હુંત રહ્યાં જાયાં,

સીએ મરીને ઉઠે ચવાયે જાય કૃપારા,

તેને જાપણ નહિ લલચા, અખમ જયા ચવતારમાં;

જ્ઞાપણ કુળ અંગાર તે જુદ્ધા ના સંસારમાં.

૧

પાઠ પર મેટ.

ઉદ્ઘોષ.

શોમપુર નગરમાં સુરચંદ્ર નામે એક જ્ઞાપણ હતો. તે હુગેશાં આગણું રહેતો હતો. જાથી કરીને તે ઘણો હુઃખી થતો હતો. આદ્ય છાં તે પૈતાનો ઢાર લાલુતો નહતો. એક વખતે ટોછ કિદાન જાલુસ શોમપુરમાં આવ્યો. કોડો તેનાં વખાણું જ્ઞાંલળી તે વિદાનની પાસે જવા લાગ્યા. ટોછ પરીના, ટોછ તત્ત્વના, ટોછ નીતિના અને ટોછ કાના ચલાઓ તે વિદાનને પુછતાં ઘણો અનોધ ખાની પાછા જાવતા હતા. જાથી કરીને તે પદ્ધિતનાં વખાણું જામમાં વસાઈ યવા લાગ્યાં. સુરચંદ્ર તે વખાણું જ્ઞાંલળી ક્રિયાં કે, હું પણ તે પદ્ધિતની પાસે લગી, અને ભાર હુખ્યાંતી વાત હું, જેથી ગારું ખણું હુઃખ મરી જયો. જાંબું પરી સુરચંદ્ર તે પદ્ધિતની પાંચ જાન્યો. પ્રલૂબ કરી તેની નાણક એક. પદ્ધિતે પુછ્યું તથે હેમ જાંયા છો ને સુરચંદ્ર કોણ્યો—પદ્ધિતલું। હું અહું હુખી હું, મને કાંઈ પણ એવો મળતો નથી, તે વિના હું હુખી ગાઈ હું, પદ્ધિત કોણી—તને શું કથ કરો એંરી સુરચંદ્રને હું, હું હાંધ કરું કરતો નથી.

૧. મો. ૨. પર. ૩. અન્ધાર—પણ. ૪. કલાક કા જ્ઞાનના કુદમાં

અનુષ્ઠાન.

પંડિત—કામ થંધો કર્યા વગર શી રીતે પૈસો મળે ?

સુરચંહ—કામ શું કરબું ? અને કેવી રીતે કરબું ? તે ઉપાય ભતાવો.

પંડિત—તમારા શરીરમાં એક રોગ છે, તે રોગ મટાડયા સિવાય, તમારાથી કાંઈ પણ કામ થઇ શકશે નહીં.

સુરચંહ—પંડિતજી ! મારા શરીરમાં કાંઈપણું રોગ દેખાતો નથી. મને ખાવા પીવાનું લાવે છે, ઉંઘ અહુ આવે છે, અને પડી રહેવાનું મન થાય છે.

પંડિત—તમારા શરીરમાં એવી જતનો રોગ છે, કે, તે રોગથી ખાઈ પી શકાય, પણ કામ થઇ શકે નહીં; અને પડી રહેવાનું મન થાય.

સુરચંહ—પંડિતજી ! એ રોગનું નામ શું ? અને કેવા ઉપાયથી ચરી જય ? તે મને કૃપા કરી કહો.

પંડિત—તે રોગનું નામ આળસ છે. તે રોગ માણુસને પાચમાલ કરી નાખે છે. તેનો ઉપાય એકજ છે. જે કરવાથી તે રોગ મુળમાંથી નાશ પામી જય છે.

સુરચંહ—પંડિતજી ! તે રોગનો ઉપાય મને ભતાવશો તો, માટો ઉપકાર થશો.

પંડિત—તે આળસડ્ઝ રોગને નાશ કરવાનો ઉપાય ઉદ્યોગ છે. ઉદ્યોગથી આળસ નાશ પામી જય છે. ઉદ્યોગ એ પુરુષનો ખરેખરે એ ખોરાક છે. ઉદ્યોગી માણુસ કદિપણ હુંણી થતો નથી. ઉદ્યોગી માણુસનું શરીર હુમેશાં તાંહુરસ્ત રહે છે. દરેક માણુસે ઉદ્યોગ કરવો જોઈએ. જે માણુસ ઉદ્યોગમાં ખંતી છે. તેની આગળ પૈસો નાસ થઇને રહે છે.

પાઠિતનો જ્ઞા વળન જ્ઞાંજળી સુરથદ્રે તે વાત માન્ય કરી, અને ગાડી તે હૃતીશાં ઉદ્ઘોગ કરવા લાગ્યો. ઉદ્ઘોગ કરવાથી તેના શરીર-જ્ઞાંજળી જ્ઞાંજાંક દૂર પછું ગઈ, અને અંતે તે પણ્ણો સુખી થયો.

સારુષોધ.

હૃતીશાં આતહે ઉદ્ઘોગી થખું લેધાયો. ઉદ્ઘોગી થવાથી સુરથદ્રની જેમ આગસ્ત નાથ પામી લય છે અને અંતે સુખી થાય છે.

સારાંશ પ્રાનો.

- ૧ સુરથદ્ર હેઠે હતો ?
- ૨ તેને ટેલા પાઠિતનો થોગ થયો હતો ?
- ૩ સુરથદ્રના શરીરભાં શેનો થોગ હતો ?
- ૪ તે રોગને નાથ કરવાનો પાઠિતે કથો ઊપાય જવાન્યો હતો ?
- ૫ સુરથદ્ર કથો ઊપાય કરવાથી સુખી થયો હતો ?

પાઠ પઢ મો.

ભાષુપાથી થતા લાભ.

ભાષુપાથી હૃતીશીના ચાર લાગ પાડવામાં જાવે છે. પેટેલા જ્ઞાંજાં વિદ્યા લલાય છે, બીજી લાગમાં ચેનો કર્માચાર છે. બીજી લાગમાં ડોર્ત જીવનાય છે. તૃતી લાગમાં લાગમાં ધર્મ ચર્ચાય છે. ચો. કે. ધર્મ આપવાને જારે તે લાગ લાગ રહેલા છે; તાંત્રિય લાગમાં તો તે આપહય લાગમાંની રહ્યું છે. ચેરલા અનુમાં વિદ્ય

અણુને જે જુંદગીનો પેહેલો લાગ સુધ્યારવામાં આવે, તો પછી ખીજ ત્રણું લાગ રહેલાધીથી સુધ્યારી શકાય છે. કરણું કે, વિદ્યાની ઉપર બધાને આધાર છે. તેથી દરેક શ્રાવકના છોકરાએ પેહેલી વયમાં લાણુવાની જરૂર છે. જે છોકરો અભણું રહે છે, તેની જુંદગી નકામી ગણ્યાય છે. અણુતર વિના માણુસ જીવતાં મુશ્કો જેલું છે. તેમજ તે છતી આંખો આંખો ગણ્યાય છે. અણુવાથી બધી જાતનાં સુખ મેળવી શકાય છે. જેનામાં વિદ્યા છે, તે માણુસની ઉંચી કિ-મત અંકાય છે. કહિ એક મોટા દેશનો રાજ હોય, તે પણ પો-તાના દેશમાંજ પૂજય છે. અને વિદ્યાનું માણુસ અધે ઠેકાણું પૂ-જય છે; તે ઉપર અભયસિંહ અને રવિહતની એક વાર્તા જા-ણુવા જેવી છે.



ખાડુ પુરુ મો.

અભયસિંહ અને રવિહત.

ઇચ્છિરા નગરીમાં અભયસિંહ નામે રાજ હતો. તે રાજ દાયારુ, પરોપકારી અને સંગિત વિદ્યાનો શોખી હતો. ઘણું ગવૈયાઓ આવી આવી તેની પાસેથી ધનામો લઈ જતા હતા. કોઈ કોઈવાર તે રાજ ખીજનો ઉપકાર કરવામાં આગળ પડતો હતો. જેવો તેને ગાયન વિદ્યા ઉપર શોખ હતો, તેવો ખીજુ વિદ્યા ઉપર શોખ ન હતો. અને વિદ્યાનું કરતાં પોતે ઘણો મોટો છે, એલું તે માનતો હતો. એક વખતે અભયસિંહ સલા ભરી યોડો હતો, જાત જાતનાં ગાયનો થઈ રહ્યાં હતાં, તે વખતે રવિહતની નામે કોઈ એક પંડિત રચ્યો આવી આડ્યો. મૃદુલાને થએ સેવા શરૂ હો. કહીને હિલો ર-

દો તે વખતે અરીદાણે આવી રાનને લહેર કર્યું કે, જો પંડિતને ચક્ષામાં હ્યાં જેણારવા છે ? રાનની કર્યું કે, તેને આપણા ગરેથાની પછીચાટ બેસાડી કે. અરીદાણે પંડિતને પછીચાટ જેણાયો તે વખતે પંડિતના મનમાં પણું જિએ લાગ્યું. પંડિત રીત કરીને દીની ત્યાંથી ચાલ્યો ગયો.

તે પછી બણ્ણો ચમણ થયા પછી ઓછ વખતે રાન આલાયસિંહ નાથ ઉપર બેસી ભાડેર કૃદ્રા નીકળ્યો. બોઝ તોષાની હતો, તે ચાગડીને નાથી ગયો. તે રૂચિરાનગરાંથી સો ડોશ આગળ ચાહ્યો ગયો. ત્યાં જ્યાં રાનને રસ્તામાં આવેલા ટોછ ગેડેર પાસે પારીને ચોઢો કર્યાં ગલમાં ચાહ્યો ગયો. રાન ચોકદો રહ્યો. ટોછએ તેને રાન કરીકે લાટ્યો નહીં, અને પરદેશમાં ટોછએ તેને આવાપીવાનું પણ આપ્યું નહીં. તેથી તે હુંખી ધર્યો. આવખતે ચેંદો રવિદાન પંડિત પાદખીમાં બેદ્ધિને નીકળ્યો. તેણે રાનને ત્યાં જોયો. તરત ઓળખી લીધ્યો. પંડિત તેની પાસે આવ્યો, અને તેમણી બરબે નીચે પ્રમાણે વાતચિત્ત ધથ.

પંડિત—કેમ આપ બલાયચિંહ રાન તો હાહી ?

આલાયસિંહ—હા, હું રવિદાન ગર્દાને રાનનુંછું. તોષાની બાંધ મને અહિં જેણી લાંબ્યો છે, મારે મારા દેશમાં કર્યું છે. હું કુઝધો ધરો નું. માટે ગેડેરખાની કરી મને મદદ આપો.

પંડિત—તમે મને જોળાએ છો ?

આલાયસિંહ—હા, હું જોળાખોં નથી. તમે કોણું હો ?

પંડિત—આરે મને ચક્ષામાં ગરેથાઓની પછીચાટ બેસાડ્યો હતો, તે હું રવિદાન પંડિત હું.

આલાયસિંહ—હા, હું તમને જોળાખ્યા તમારે આવી કુઝાઈ આપ્યી હું.

પંડિત—આ વીરપુર નગરના રાજા વિદ્વાનોને બહુ માન આપે છે. તેની સાથે મારી મુલાકાત થતાં તેઓ મારી ઉપર ખુશી થઈ ગયા, અને મને આવી મોટી સમૃદ્ધિ અક્ષીસ આપી.

પછી પંડિત તે અભયસિંહને માનપૂર્વક પોતાને ઘેર લઈ ગયો, અને તેને ખાનપાન કરાવી વીરપુર નગરના રાજાને મેળવી ગાડી ઘોડા સાથે રવિચિરા નગરીમાં મોકલાવી દીધો.

અભયસિંહને ધણો પસ્તાવો થયો, અને તેના મનમાં આત્મ થઈ કે, “રાજા પોતાના દેશમાં પૂજય છે, અને વિદ્વાનું બધે ઠેકાણે પૂજય છે; માટે હુવેથી દરેક વિદ્વાનોને માન આપવું.



સારાધ્યોધ.

દરેક શ્રાવકના છોકરાએ વિદ્યા મેળવવી જોઈએ. રાજા પોતાના દેશમાં પૂજય છે. અને વિદ્વાનું બધે ઠેકાણે પૂજય છે તે ઉપર અભયસિંહ અને રવિદત્ત પંડિતનો દાખૂદો હુમેશાં ચાદ રાખ્યો.



સારાંશ પ્રશ્નો:

૧ અભયસિંહ કેવો રાજ હતો ?


૨ અભયસિંહે રવિદત્તને કેવું માન આપ્યું હતું ?

૩ અભયસિંહે રવિદત્તને કેવી સ્થિતિમાં અને કયાં જોયો હતો ?

૪ રવિદત્તને પાલખીનું માન શાથી મળ્યું હતું ?

૫ રવિદત્તે અભયસિંહનો શો ઉપકાર કર્યો હતો ?

૬ અભયસિંહે છેવટે શો વિચાર કર્યો હતો ?



पाठ पर्य में।

अंतः

मोहने प्रेताना वापा हस्तिंद्रने पुष्टुं के, वापा । अभारा
किल्ला अमने हमेशां पुष्टया करे छे के तमाराथी आटडो, पाठ
पर्य गडये के नहि । तमे हमेशां आटडुं लभी शकयो के नहि ।
तमाराथी चेहेवा लडी शकयो हे नहि । तमे आ जोटी चोपडो
वांची शकयो हे नहि । तमे परीक्षा आपी शकयो के नहि । तमे
उपवास करी शकयो के नहि । तमाराथी देवे तथा उपास्त्रये, प्रो-
क्लंसो शकयो हे नहि । अने तमे वधां काम करी शकयो हे
नहि । के अधाना उत्तर अने आपी शकता नहीं, तेमन ते क-
रकानी हिंमत पशु लावी शकता नहीं, क्लें, वापा ! हवे अमारे
कु कर्तुं ?

हस्तिंद्र—बेटा मोहन ! ते वधां काम सहेलाईथी थह थहे
सेनो, कोइ उपाय छे, जे तमे ते उपाय करयो, तो पधी, तमै
तमारा भास्तरने हिंगतधी करी शकयो, के, चाहेब। अमे वधां
काम करी शकीगु.

मोहन—वापा । के उपाय बतावो,

हस्तिंद्र—ते उपाय अंत छ. जे हवेक काम करवामां अंत
राखवामां आवे तो, ते काम सहेलाईथी करी शकय छे, अंत रा-
खवी, के पशु जैये शुशु छे, गमि तेहुं मोहन काम जे तमे
अंतधी करयो तो, ते काम तमारी जागता दडी शकये नहीं, अंत रा-
खवी जैयो जाटा अम शपेलां छे, जाइवाता ताजमेती तमा-

દ્વીપાની શોધો, અને પર્વત સથાં પુઢીના પહોર્યાની વાતો, એ અધાં કામ કરી શકાય છે. આપણું જેન વિક્રાનોએ ખંતથી લાગો પુસ્તકો લખેલાં છે; માટે તમે ખંત રાખીને ફરેક કામ કરજો. પોતાના બાપનાં વચન સાંભળી મોહન ઝુશી થઈ ગયો, અને તે બાલ્યો કે, બાપા ! આ ઉપાય હું કાંઈને કહીશ નહીં.

હરિચંદ્ર—બેટા મોહન ! આવો સાંકડો વિચાર કદિપણ લાવીશ નહીં. આ ઉપાય બીજા અધા છોકરાઓને કહેલે જેથી બીજાને પણ લોભ થાય, જેનાથી બીજાને લાલ થતો હોય, તે વાત કુપી રાખવી ન જોઈએ. કે માણુસ પોતાનું સારું કરે, અને બીજાનું સારું કરે નહીં તે માણુસ એકલપેટો કહેવાય છે.

મોહન—બાપા ! હવેથી હું એકલપેટો નહિં થાઉં. આ ખંત રાખવાનો ઉપાય અધાને બાતાવીશ. પછી મોહને ફરેક કામ ખંતથી કરવા માંડ્યાં, જેમાં તે ઝેતેહમંડ થયો હતો.

સારબીધ.

ફરેક શ્રાવકના છોકરાએ ખંત રાખવી જોઈએ. તેમજ એકલ પેટાપણું ન રાખવું જોઈએ. મોહન પોતાના બાપ પાસેથી ખંત રાખતાં શીખ્યો, તેથી તે અધાં કામમાં ઝેતેહમંડ થયો હતો.

સારાંશ અશનો

૧ મોહનને તેના બાપા હરિચંદ્રને શું ચુછ્યું હતું ?

૨ તેના શિક્ષકે છોકરાઓને શું કહ્યું હતું ?

૩ ફરેક કામ પાર રાખવાને હરિચંદ્રે મોહનને કૃચ્છ ભતાવ્યો હતો ?

४ अंत रामवायी शुद्ध साम थहरे थे १०.
 ५ अंत रामवायी हेवां हेवां साम थयां थे ११.
 ६ चेहरेयेता न थवाने भाटे लक्ष्मिन्द्रे चोदनने शुद्ध हर्तु ।
 ७ चोदने छेवडे तेना आपने शुद्ध हर्तु ॥

पाठ ४५ भोः

साधिमि पात्सूच्य विषे.

उत्तिगति.

शामी भग्ने सरणा भुग्ने आपटतस्तु चंसारमां,
 शायी भग्ने उद्गेगनां शामन बधा वेडेवारमां;
 लेक्का उभायी चेत्यां ल्यां अंत भुव भरय छे,
 पात्सूच्य ते साधिमितु जगमा भद्र वभष्याय छे,
 रथायी भला विद्य गुडो र्या भानपान अपाय छे,
 विद्वान विद्याधनयी ल्यां केन बाणक थाय छे;
 श्रीमंत जननी जावयी के नित्य तेभो रहाय छे,
 पात्सूच्य ते साधिमितु जगमा भद्र वभष्याय छे,
 रथायी भुधारह भंडो गुरजाम जन भुभराय छे,
 लानि धर्षी इत्तर के झुरीवाह इर ईराय छे,
 हेत रेता धर्मनो धन अंतयी अदबाय छे,
 पात्सूच्य ते साधिमितु जगमा भद्र वभष्याय छे.

કરિ જો નિરાશીત ઝડપ મોદું પાહન જન ઉદ્ઘારવા,
આગળ પડી આનંદ ધરતા જૈનખંડુ તારવા;
ખાંતે કરી જો જૈન કન્યાભોધ નિત્ય અપાય છે,
વાત્સલ્ય તે સાધર્મિનું જગમાં ખરું વખણ્ય છે.



પા� ૫૭ મો.

અધુરાં કામ કરવાં નહિ.

દેવજી કરીને એક આવક હતો. તે સારા સ્વભાવનો અને કી. ઘણી હતો. પણ તેનામાં અધુરાં કામ કરવાની નઢારી ટેવ હતી. તેને કંઈપણ કામ બતાઓયું હોય તો, તે અધુરું રાખતો, અને નળવાં કામને લંખાવતો હતો. શિક્ષક તેને ચાર લીટીની કવિતા કે કોઈ ખાડ પૂરો વાંચવા આપે, ત્યારે તે એ લીટી કવિતા કરતો અને પાડ અહેંદો કરતો હતો. તેના માબાપ કે કોઈ વહિલ તેને અહૃતનું અથવા ધરની અંદરનું કામ બતાવે ત્યારે તે કરવા જતો, પણ અધુરું સુકી પાછો આવતો હતો. આવી નઢારી ટેવથી તેના માબાપને તથા તેના શિક્ષકને તેની ઉપર ધણો કંટાળો આવતો હતો. આવી કુટેવથી તે બરાબર સારો અજ્ઞાસ કરી શક્યો નહિ. જ્યારે તે લાયક ઉભમરનો થયો, એટલે તેના આપે તેને કોઈ વેપારીની હુકાને એસાર્યો. તે વેપારી નાતાવાળો હતો એટલે તેને માંડ માંડ નભાવતો હતો. એક વખતે કોઈ બાહેરનો વેપારી તે હુકાનમાં નાસું સમજવાને આંદોયો. તેના નામામાં

૫ અરીબ લોકોનો ઉદ્ઘાર મુઠવા. ૬ જૈન કી ડાળવણી.

મોટો ગોટાળો ની કર્યો, અમૃતાં કામ કરતારા દેવલુણે હરેક ના ભાની રહ્યો અમૃતી મારેલી, અને થેડે તેના ઉપર વિશ્વાસ ચુકેલે આંશી ચેલા પાઢેના વેભારીને મોટો વહેન રદો, અને તે બાદ વારે જાહેર કરી, એટદે પીલ લેખાદેશાવાળા લોહેના ભનમાં અ-વિશ્વાસ આવી ગયો, અમાના નામામાં પણ ગોટાળો નીકર્યો; તેણી તે ગ્રહની પેઢી કાંગી પહુંચાનો વખત આંધ્રો, પછી તેણે દેવલુણી ઉપર તે બધા ચુનુંદાણી ચુક્યા; એથી દેવલુણે જેકમાં ક્રપાનો વખત આંધ્રો, આ દેવલુણો હાખલો ણરાબર સમલુણે હાઇને અમૃતાં કામ કરવાની દેવ રાખવી ન લેછુણે, ગમે તે કામ કરવાતું સોય, તેમાં જારી રીતે ધ્યાન આપવું, અને તે પૂર્વપદ્ધતિનું

સારથોધ.

ઠોંડ પદુ ઠોકરાણે અમૃતાં કામ કરવાની કુટૈવ રાખવી ન લેછુણે, અમૃતાં કામ કરવાની કુટૈવ રાખવાથી દેવલુ હુંઘી થશો હતો, અને તેને નોકર રાખતાર થેણે હીવાળું કાદવાનો પ્રસંગ આવ્યો હતો,

સારાંશ અર્થનો.

- ૧ દેવલુમાં હોયો અવગુણ હસો ?
- ૨ દેવલુના તે અવગુણમાં હોને મુક્યાન યદું હતું ?
- ૩ અમૃતાં કામ કરવાની દેવધી શું વાય હો ?

પાઠ પૈઠ મો.

ભલાઈ.

હેવચંદ્ર કરીને એક શોઠ હતો. તે શ્રાવકનો ધર્મ પાળતો હતો. તેના ધરની સ્થિતિ સારી હતી, તે બીજાં અધ્યાત્મ કામ કરી શકતો, પણ તેનાથી કોઈ જાતનાં વૃત પરચાણું થતાં નહોતાં, કોઈ પણ જાતનો ધર્મનો નિયમ તેનાથી પળી શકતો નહોતી. કેક્ત એકાશાણું કરલું હોય, તેનાથી અનતું નહિ. કિયામાં પણ કોઈ ધર્મની કિયા કરી શકતો નહતો, એક સામાચિક લેવામાં પણ તેને બહુ સુફકેલી પડતી હતી.

એક વખતે તે ઉપાશ્રે ગુરુનાં દર્શન કરવાને ગયો. ગુરુને વંદના કરી આગળ એઠો. એટલે ગુરુએ પુછ્યું કે, શોઠલુ ! કેમ ચિંતામાં દેખાયો છે ? હેવચંદ્ર એલયો, મહારાજા ! મારાથી તન મનવડે કાંઈ પણ ધર્મનું કામ થઈ શકતું નથી, એવી મને ચિંતા રહ્યા કરે છે. મારો આ મનુષને જન્મના નકસો ચાલ્યો, જાય છે. વેપાર રોજગારમાં સારો લાલ છે, પણ ધર્મનો લાલ મારાથી મેળતી શકતો નથી. કોઈ નિયમનું કામ હું જરા પણ કરી શકતો નથી. મારી શરીરની એવી સ્થિતિ છે કે મારાથી એકાશાણું પણ થઈ શકતું નથી. હમેશાં નિયમથી જિન્હેની, સામાચિક કે બીજું કાંઈ ધર્મની કિયાનું મારાથી અની શકતી નથી. મારી આગળ શી ગતિ થશે ? તેની મને અત્યારે ચિંતા થાય છે.

ગુરુ એલયા—શોઠલુ ! ચિંતા કરો નહિ. કર્મની ગતિ એવી છે. અશુભ કર્મના અળથી માણુસ અધી જાતની જોગવાઈ છતાં કાંઈપણ

કરે શાકતો નથી, તમારાચી કે કાંઈ ન અને તેણું દોય તો, હુમેશાં
ભવાઇના શુદ્ધ રાખને, જે શુદ્ધ ચર્વિયી જોયે છે, કેવામાં ભવાઇ
દોય છે, તે ભાવું પણ પુણ્ય મેળવી શકે છે. આપણાં માબાપ,
લાટ, કેન, ચાળા, સ્નેહી, મિંન અને જાંખમાં ભાઇ દુઃખી દોય
તો, તેને ચર્વે લતની મહદ કરને, કેંચો અપંગ અને અનાય છે,
તેમની જંબાળ કેને, કેંઠનું ભાઇ ધરું દોય તો તેમાં તન, મન
અને પણથી ભાગ કેને. કે કેંઠ નશ્નું કામ ભવાયે, તેમાં કે
બીજાનું ભાઇ ધરું દોય તો, તે કામ ખંતથી કરને. આ ભવાઇ
નો શુદ્ધ રાખયો, તો પછી તમારે બીજું કાર્યન્ય બાકી રહેયો
નથી. તે ભવાઇના શુદ્ધયી તમારું હૃદય ચોખણું થયે, કેટલે
એકી ખર્મના બીજાં કામ તમારાચી નિયમિત રીતે જણી શક્યો.

શુરૂનાં આવાં વચન જાંખણી દેવચંડ ચીઠ શુશી ધર્ઢ ગયો.
ત્યાંથી તે કોણાનું બલું કરવામાં ચાગેલ થયો, કેંધી તેણું
દેવટે એમનાં ક્ષણાં કાર્યમાં લાટપર થઈ પોતાના લુનિતને ચુ-
પારી રહ્યું.

આરથોયિ.

આરથોયા કરેકે આકાશે નાનપણુંધી ભવાઇના શુદ્ધ રાખવો
નથીને, ભવાઇના શુદ્ધયી દેવચંડ દોડની કેંઠ જોતાનું લુનિત
કુખાચી રાજાય છે.

સારાંશ પ્રનો.

- ૧ રાજાય શા પ્રક હોલે.
- ૨ લાટા.

- ૩ ગુરુની આગળ તે શામાટ ચિંતાતુર થયો હતો ?
 ૪ ગુરુએ તેને શું અતાંથું હતું ?
 ૫ ભક્તાં એટલે શું ?
 ૬ દેવચંદ્રે પોતાનું જીવિત શીરીતે સુધાર્યું હતું ?
-

પાઠ પણ મો.

નિત્યકર્મની નોંધપોથી.

શિક્ષક—આ તારા હાથમાં શું છે ?

વાડીલાલ—સાહેખ ! એ મારા હાથમાં નિત્યકર્મની નોંધપોથી ॥

શિક્ષક—તેમાં શું લખેલું છે ?

વાડીલાલ—સાહેખ ! તેમાં હું હંમેશના કામની નોંધ કર્દું છું

શિક્ષક—વાડીલાલ ! તું હંમેશાં શું શું કામ કરે છો ?

વાડીલાલ—સાહેખ ! મેં હિવસના કામ કરવાના જુદા જુદા ભાગ પાડ્યા છે.

શિક્ષક—વાડીલાલ ! તે કેવી રીતે ભાગ પાડ્યા છે ? તે કહે.

વાડીલાલ—સાહેખ ! સવારે પાંચ વાગે ઉડીને હું સામાયિક કર્દું છું, પછી દેહેરે જઉ છું, ત્યાં નહાઈ ભગવાનની પૂજા કર્દું છું. તે પછી સાત વાગે ઘેર આવીને એ કલાક પાઠશાળાનો અફયાસ કર્દું છું, પછી ભાખાપની સેવા કર્દું છું. પછી દશ વાગે જમીને પાઠશાળામાં જઉ છું ત્યાં ત્રણું કલાક વ્યવહારતું અને એ કલાક ધર્મ તથા નીતિનું શાન મેળવું છું. પછી ઘેર આવીને અરધી કલાક કસરત કર્દું છું. તે પછી જમવા ભેસું છું. જમીને અરધી

हिंड कुर्वा लड़ छ, ते पछी हड्डेह दृश्य करी जात चाहे, प्रेर
आहु छ, ते वधते माझाप ठे गोटेचातुं कांड आम ढोय ते हरी,
अने तेमनी तेवा हरी, पछी आठवी हय याच्या तुधी भारी अ-
व्याकुं कळ छ. इथयो साधारण तुधी आण्या दिवसमां दुं शु
क्रांग इरु ? अने इप इप आवाततुं आके वधारे जात भेणव्युं ?
तेसे विचार हरी आ नेंध घोरीमां लघी लड छ. पछी आ
धारनी आज्ञा लड तुध लड छ.

शिवक—वारीवाद। देष्ट दिवसे उपायारे जप पठिक्कमळु
करे उंडे नहि ।

वारीवाद—शारेण। ले शुद्धनो लेज डेय तिळ, ले दिवसे
रक्त ढोय, ते दिवसे तेमनी पाचे लडी छुं, अने चोभाचाचामां ल-
गेचां, अने ते शिवाय दरेक आठम तयो चाढ्यने दिवसे अने
वधत पठिक्कमळुं कळ छुं, तयारे भारी अल्पास यारी येथे
चेटले पछीधी लगेचां भी वधत पठिक्कमळुं करवानो भी निश्चय
इयो उं अने ते शिवाय भीज उटवाचेक नियमी भी भारी नेंध
घोरीमां लघी राखा उं.

शिवक—वारीवाद। तेवी शांगायी यटे उं. तारी लेम धील
उटवानो नेंध घोरी राखी तो, तेवी चेह चारा घुक्क्य आवड
जप एड्ये, तेवी ले उटवा चाचा नित्य कर्मती उत्तमेली रा-
खी, तेवी हुं भारी कांपा आपीय, अने तेतुं आम उंचे न-
जदी राखीय.

सारपोष.

इडे शांगाय उटवाने गोत्याने गाउ नित्यकर्मती नोपचेत्ती

રાખવી જોઈએ. અને તે પ્રમાણે હુમેશાં વર્તણું જોઈએ. નોંધપોથી રાખનારા છોકરાએ. વાડીલાલની કેમ પોતાના શિક્ષક યાસેથી સારી શાખાશી મેળવે છે.



સારાંશ પ્રશ્નો.

- ૧ વાડીલાલના હાથમાં શું હતું ?
- ૨ નિત્યકર્મની નોંધ પોથીમાં શું લખાય છે ?
- ૩ વાડીલાલ આખા દિવસમાં શું શું કામ કરતો હતો ?
- ૪ વાડીલાલ કયારે ઉડતો, અને કયારે સુતો હતો ?
- ૫ વાડીલાલને તેના માસ્તરે શું કહ્યું હતું ?
- ૬ વાડીલાલની કેમ વર્તનારા છોકરાને માસ્તરે શો લાભ આપવાતું કહ્યું હતું ?



પાઠ ૬૦ મો.

હુર્ગુણ છોડવા વિષે.

વસંતતિલકા.

મોટાઈ જે હૃદયમાં સર્વ રાખે,
ઓટાં કુવાકચ સુખથી જન સાથ જાખે;
મહેણુંતણું વચ્ચનથી પરચિત આળે,
જે હોય જૈન કદિ તે નહિ તેમ ચાલે.
જે ચીડવે અવરને મનમાં ચિહાયે,
જે લોખ લાલચથકી ન જરા ધરાયે;
૧ નહારા વચ્ચનો ૨ જોદે ૩ ખીલના ચિત્તને.

गिरावङ्गा कडे परी नहि टेंग थाणे,
ले देख केन कहि ते नहि तेम चाले. २
क'मेस ले निय करे ४७७या कहीने,
चाणे। कडे शुभक्षी रीस पाणी परीने;
चाही करे १४४२नी २विपश्चिम चाले,
ले ढेख केन कहि ते नहि तेम चाले. ३
ले लागकी दृद्यमां परता न चाही,
निहा कडे शुभक्षी परनी नहाही;
शमे नहि विनयने कहि टेंध कणे,
ले ढेख केन कहि ते नहि तेम चाले.

अंड ४ थो.

जैनतत्व.

थाठ ५९ भौ.

चार गति.

म्हु क्षीने जेह छेकरा हतो, ते उमेयां नवी चीजने आटे
पछां चांशीदो हतो, व्यारे तेनो आप परनी बदार अस, त्यारे से
होतो हे, वापां चारे आटे टांड नवी चीज देता आएनो, तेना

१ अन्तर्गत २ अन्तर्गत होते

ખાપાતું નામ વિઠુલ હતું. વિઠુલ જૈન ધર્મમાં આસ્તિક હતો. તે મધુને હુમેશાં ધર્મનું જ્ઞાન આપવાની ધર્ષી કેાશિશ કરતો હતો. એક વખતે વિઠુલ અજરમાંથી એક ચિત્ર લાવ્યો. તે ચિત્રમાં એક તરફ નારકીનો દેખાવ હતો, અને તેની સામે પક્ષી, માણુસ અને દેવની એક એક છથી ચિત્રરેખી હતી. તે ચિત્ર લાવી વિઠુલે મધુને આપ્યું.

મધુ—ખાપા ! આ શેનું ચિત્ર છે ?

વિઠુલ—તે ચાર ગતિનું ચિત્ર છે.

મધુ—ચાર ગતિ કઈ કઇ ? તે બતાવો.

વિઠુલ—જો આ નારકીનું ચિત્ર છે, તે પેહેલી નરકગતિ કહેવાય છે. તેની સામે જે પક્ષીનું ચિત્ર છે, તે બીજી તિર્યંગતિ કહેવાય છે, જે આ માણુસનું ચિત્ર છે, તે ત્રીજી મનુષ્યગતિ કહેવાય છે. અને દેવતાનું ચિત્ર છે, તે ચાથી દેવગતિ કહેવાય છે.

મધુ—ખાપા ! ગતિ એટલે શું ? તે સમજાવો.

વિઠુલ—આપણા શરીરમાં જે જીવ છે, તે જીવને સુઅધી જ્યાં જીવાતું થાય, તે ગતિ કહેવાય છે અને તે જીવાની ગતિ ચારજ છે. એટલે જીવ સૂર્યાં પદ્ધતી એ ચાર માંહેલી કેાદ પણ ગતિમાં જાય છે.

મધુ—ખાપા ! તે જીવ ચારે ગતિમાં કેવી રીતે જાય ? તે સમજાવો.

વિઠુલ—ધર્ષું ખાપ કરવાથી જીવ નરક ગતિમાં જાય છે, તેનાથી થાડો ખાપ કર્યાં હોય તો, તિર્યંગ ગતિમાં જાય છે, થાડો પુષ્ય તથા ખાપ કર્યાં હોય તો, મનુષ્યની ગતિમાં જાય છે, અને એકલાં પુણ્ય કરેલ હોય તો, દેવતાની ગતિમાં જાય છે.

मर्यु—भासा । दूसे हुए अवश्यक समझो। जो वित्र हुए
मारी गयी शाखीय, जोने नारडीनी, तिर्यचनी, मतुपयनी जोने
देवतानी की यार गति समझते हुये थे। याह शाखीय।

सारणीय.

इह आपका छोड़ाने नारडीनी, तिर्यचनी, मतुपयनी जोने
देवतानी—की यार गति समझते याह शाखीय।

सारांश प्रश्नों।

१. मर्यु छोड़ो क्यों हुतो ?
 २. ते थोनो लोंधीलो हुतो ?
 ३. विकुल केहु वित्र लान्हो हुतो ?
 ४. ते विवर्मां थेनां विच्यो हुतां ?
 ५. गति डेटली दोय उ ?
 ६. शार गतिचीनां ताम आपो ?
 ७. गति केटले शु ?
 ८. शु यारे गतिचीमां डेवी दीले लाय उ ?
 ९. नारडी, तिर्यच, मतुपय, जोने देवतानी गतिमां शु
शाखी लाय ?
-

पाठ दुर्भी.

पांच गति.

आपका दीखाने पांच गतियाँ आतीं अवश्य जेगदली
गेली, से यारे गति लानी लाय उ, को उद्देश्य।

જાતિ, તે પેહેલો એકંદ્રિયજાતિ. એ ઈદ્રિયવાળા જીવની જાતિ તે થીજુ એંદ્રિયજાતિ, તરણ ઈદ્રિયવાળા જીવની જે જાતિ તે વીજુ ત્રૈંદ્રિયજાતિ, ચાર ઈદ્રિયવાળા જીવની જે જાતિ, તે ચાથી ચૌરિંદ્રિયજાતિ અને પાંચ ઈદ્રિયવાળા જીવની જે જાતિ, તે પાંચમી પંચંદ્રિયજાતિ કહેવાય છે. આ પાંચ જાતિ છે, તે અરાખર ચાદ રાખવી જોઇએ.

સારણોધ.

દરેક શ્રાવકના છોડકરાયે આ પાંચ જાતિ જાળવી જોઇએ, અને તેનો અર્થ સમજુને તે પાંચ જાતિને યાદ રાખવી જોઇએ.

સારાંશ પ્રશ્નો.

૧ જાતિ કેટલી છે ? અને તે કઈ ? તે ગણુવો.

પાઠ કર મે.

છકાય.

શિક્ષક—છોકરાયો ! તમે છકાય એટલે શું ? તે સમજો છો ?

છોકરાયો—ના સાહેખ, અમને અરાખર સમજવો.

શિક્ષક—અધા જીવ તે છકાયની અંદર આવી જાય છે. કાયનો અર્થ શરીર થાય છે, અને તે શરીર જીવને છ પ્રકારે હોય, તેથી છકાય જીવ કહેવાય છે.

શિક્ષકાયો—સાહેખ ! જો છકાય જીવ હોય તે કહો,

शास्त्रं— यृत्यीना लुप, पाषुडीना लुप, अनिता लुप, पवनना लुप, जाठ-धाराना लुप, ज्ञने हातेवाहे तेवा लुप, जे उकाय लुप रहेवाय द.

छोटरावी— साडेण ! तेमना भील' हुँडा नाम डाय ते हुँडा डे, ने अने याह राखीवे.

शिशं— तेंदा भील' हुँडा नाम सांभयो. १ यृत्यीकाय, २ अप्याय, ३ तेउकाय र वायुकाय, ५ पवनस्थितिकाय, ज्ञने ६ वसठाय.

छोटरावी— साडेण ! जे हुँडा नाम अमे हवे अनन करीने चाहे राखीयु.

सारणीध.

इ१६ शावठना छोटरावे उकाय लुप समष्टुने तेंदा हुँडा नाम याह राख्यां लोहवे.

सारांश मलो।

१ उकाय कोटवे शु ?

२ अयनो जर्य शु ?

३ उकाय लुप ईया ईया ?

४ उकाय लुपना हुँडा नाम जारयो.

पाठ ३४ भो.

पांच छातिय.

१ अरामा उद्दिशे उक उक उद्दिशे बहने *

ખંડાં કામ કરી શકે છે. જુબ સાંભળે છે, જુથે છે, સુંગે છે, ખાય
છે. અને અડકે છે એ ખંડું ઈદ્રિયોથી થાય છે. તે ઈદ્રિયો કાન,
આંખ, નાક, જીલ અને શરીરમાં રહેલી હોય છે. કાનને ઓચેંદ્રિય,
કહે છે, આંખને ચક્કુરિંદ્રિય કહે છે, નાકને ગ્રાહેંદ્રિય કહે છે,
જીલને રસનેંદ્રિય કહે છે, અને ચામડીને સ્પર્શેંદ્રિય કહે છે. તેનું
સારી રીતે જાન થવાને પ્રેમજીની વાર્તા જાણુવા જેવી છે.

પાટણુનગરમાં પ્રેમજી કરીને એક શ્રાવકનો છોકરો હતો. તે પાંચ
ઈદ્રિયોમાં સમજતો નહતો અને તેનાં બીજાં નામ યાદ રહેતાં નહતાં.

એક વખતે તેના શિક્ષકની પાસે ગયો. શિક્ષકે તેને કહું, પ્રેમજી !
તું જોહાક્ષર શિખયો છું ? પ્રેમજીએ કહું, હા સાહેખ, તે પરથી
તેની પાસે નીચેના પાંચ શખદો લખાયા.

કાન, આંખ, નાક, જીલ, ચામડી,

પછી પ્રેમજીને તેના શરીર ઉપર તે ચોળાયા. પછી તેનાં
બીજાં નામ નીચે પ્રમાણે લખાયાં.

ઓચે, ચક્કુર, ગ્રાહે, રસના, સ્પર્શી,

આ ખંડા શખદ જોખાલી મોઢે કરાયા. પછી શિક્ષકે કહું,
હવે તેની સાથે ઈદ્રિય શખદ જોડી હે. પછી પ્રેમજીએ તેની સાથે
ઈદ્રિય જોડી નીચે પ્રમાણે લખયું.

ઓચેંદ્રિય, ચક્કુરિંદ્રિય, ગ્રાહેંદ્રિય, રસનેંદ્રિય, સ્પર્શેંદ્રિય.

પછી તરત પ્રેમજી સમજુ ગયો અને તેણે શિક્ષકનો ઘણું
આલાર માન્યો.

સારણીય.

દેખો આપણના છોકરાને પ્રેમલુણી કેમ પાંચ ઈદ્રિય જોગળી
દેવી અને તેને લોકની હરી દર્શી જારી રીતે લાલુણી નેઉંબે.

સારણી પ્રસ્તો.

૧ ઈદ્રિયો થેમાં લાય છે ?

૨ તે ઈદ્રિયોથી છુ શુ શુ કરી શકે છે ?

૩ ઈદ્રિયોના વે જાતનાં નામ છેડો ?

૪ પ્રેમલુણે દેવી રીતે ઈદ્રિયોની અમદરદુ પડી હતી ?

પાઠ કૃપ મે.

૭ પર્યાયિ.

આપણું દરીર પુહગળફુપ છે. કે પાંચ ઈદ્રિયના વિવયમાં
જીવી શાહે તે પુહગળ કટેવાય છે. પૂર્વાય કરે અને ગળી લાય,
તે પુહગળનો રસસાવ છે. તે પુહગળનો બધારા ગરારાયી દરીરમાં
ફાર્સેર યાં કરે છે. છુ જ જાતની દાખિને ઉત્પત્તિ વખતે બાંધે
છ. તેસે એણાં હાડ છે. તે પર્યાયિ છ પ્રમલની છ. છુ ભરને
લ્યાદ બીજે ભરે લાય, તે વખતે રેઢેલા જરૂરી જાહીર કે છે.
અને તે પણ કે દાખિની ખાપા દીવાના મોદાહનો રસ દરીરપણે
પરિલુઘદે કેવી દાખિને બાંધે છ, તે પેઢેલી જાહીરપર્યાયિ ક.
દેવાય છ. જોગળના રસાર્થાપી કે દરીરનું બંપાયાપણું અને શરી.
રપણું જાહીરના પુહગળને પરિયભાગયાની કે દાખિન, તે બીજુ

શ્રીજ્યો છે, તેથી બોકી શકે છે, તે તેની પાંચમી ભાવાપર્યાપ્તિની ખુખી છે. અને જીવો મનમાં રમવાના કે ભાવાપીવાના વિચાર કરી શકે છે, તે તેની છુફી મનપર્યાપ્તિ છે.

ગોવિંદે આ પ્રમાણે સમજાંયું, એટલે અધ્યા છોકરાચો ખુશી થઈ ગયા, અને આગળ પાડની છ પર્યાપ્તિની વાત તેમણે બરાધાર ચાહ રાખી લીધી.

સારથોધ.

ગોવિંદની જેમ હરેક છોકરાચો છ પર્યાપ્તિ વિષે સમજુતી મેળવવી, અને તેને હમેશાં ચાહ રાખવી જાઈએ.

સારાંશ પ્રનો.

૧ ગોવિંદ કેવો હતો ?

૨ જીવો તેને શું થતો હતો ?

૩ જીવામાં છ પર્યાપ્તિ કેવી રીતે સમજવી હતી ?

પાઠ કૃત મો.

દર્શા આણ.

જીવમાં દશ પ્રાણ કહેવાચ છે. તેમો કેટલાચ્ચક જીવમાં ઓછા વધતા પ્રાણ પણ હોય છે. જીવ જયારે ભૂત્ય પામેછે, ત્યારે તેનામાંથી તે પ્રાણ ચાલ્યા જાય છે. પ્રાણદ્રિય એ જીવનો પહેલો પ્રાણ છે. તેનાથી જીવ સાંભળી શકે છે, અસુરદ્રિય એ જીવનો બીજો પ્રાણ છે, તેનાથી જીવ જોઇ શકે છે. પ્રાણદ્રિય એ જીવનો ત્રીજો

પ્રાણ છે, તેનાથી લુધ ચુંબી થકે છે. રસનેટ્રિય લુધનો જોવો
પ્રાણ છે, તેનાથી લુધ ખાવાપીવાનો શ્વાસ લઈ થકે છે. રસનેટ્રિય
એ લુધનો પાંચથી પ્રાણ છે, તેનાથી લુધને આમણી વડે ટાંકા,
ભાજા, કિરોડિટું નાન થાય છે. મનોબળ એ લુધનો છો પ્રાણ છે,
તેનાથી લુધ મનના વિવાદો હેઠાંથી થકે છે. વચનબળ—એ
લુધનો જાતગો પ્રાણ છે, તેનાથી લુધ અન્તવાની શક્તિ પરાવે છે,
અધિબળ—એ લુધનો આહમો પ્રાણ છે, તેનાથી લુધ શરીરટું
બળ હાસ્યની થકે છે. યાસોદ્વાસ એ લુધનો નવગો પ્રાણ છે, તેનાથી
લુધ ખાસ ઉત્સ્થિત લગ્ન થકે છે, અને સુદી થકે છે, અને
આણુ—એ લુધનો હથગો પ્રાણ છે, તેનાથી લુધ તેની સુદી પ્રમાણે
લુધી થકે છે. તે હથ પ્રાણ ઉપર આરામદાની વાત સામજ્યવા લેવી છે.

એપિલનગરગાં આસાધક કરીને જોક શ્વાસક હતો. તેને હથ
દિકરા દૂતા. તે પોતાના હોય ડિકરા ઉપર વળી ગ્રીવિ રાખતો.
ઘણીચાર તો તે પોતાના હથ દિકરાને “ ભારા પ્રાણ ” જેમ કરી
શ્વાસવંતો હતો. તે હૃદ્દિનાં નામ હથપ્રાણનાં નામ ઉપરથી રાખેલાં
હતાં. તેમનાં નામ ૧ કાનચંદ્ર, ૨ વચ્છુચંદ્ર, ૩ પ્રાણુચંદ્ર,
૪ રસચંદ્ર, ૫ રસર્ચંદ્ર, ૬ મનોબળ, ૭ વચનબળ, ૮ કા-
ધિબળ, ૯ યાસોદ્વાસપ્રસાદ, જેને ૧૦ દીર્ઘાયુધ્ય. જેવાં ખાદ્યાં
હતાં, ક્રિયાનયના કોણો જાસાધકને હથ પ્રાણ છે. જેમ કઢેતા
હતાં, હરિશોળે તે હોય રોકડાનો નામ પ્રમાણે શુદ્ધયાને થયા.
શાંકદ્ર જાંલાયામાં દીન હતો. વચ્છુચંદ્રનાં જાંય ગણી તેજાદાર
હતી. પ્રાણુચંદ્ર જાંય લૈયાનો બાંદાક હતો. રસચંદ્ર ખાવાપીચાંદ્ર
ખાદ્યાં જોખી હતો. રસર્ચંદ્ર આમણીને જુખ અપદામાં ઝ-
તીદા હતો. મનોબળ શુદ્ધિયાં પણો ખાળવાન હતો. વચનબળ

લાખણુ કરવામાં એકડે થયો હતો, કાયખળ શરીરે મજઘૂત હતો
શાસોચ્છ્વિસપ્રસાદ પ્રાણુયામની શાસ ધુંટવાની વિધામાં આગળ
પડ્યો હતો, દીર્ઘાયુષ્યની આયુષ્ય લાંખી હતી.

આરાધકના આ દશે દીકરાયો દશ પ્રાણથી ઓળખાતા હતા,
અને લોકે તેમનાં નામ ઉપરથી દશ પ્રાણનાં નામ યાદ રાખતા હતા.

સારબોધ.

હરેક શ્રાવકે દશ પ્રાણ જાણવા જોઈએ અને આરાધકના દીકરાના
નામ યાદ રાખી, સમજૂતી સાથે તે બધાં નામ મનમાં ઠસાવવાં
જોઈએ.

સારાંશ પ્રશ્નો.

૧ જીવમાં કેટલા પ્રાણુ હોય છે ?

૨ જીવ શેનાથી રહી શકે છે ?

૩ બધા જીવમાં સરખા પ્રાણુ હોય કે ઓછા વધતા હોય ?

૪ દશ પ્રાણુ કયા ? તે ગણાવો.

૫ દશ પ્રાણથી જીવ શું શું કરી શકે છે ?

૬ આરાધકને કેટલા દીકરા હતા ?

૭ તેમનાં નામ કેવી રીતે રાખ્યાં હતાં અને નામ પ્રમાણે
શા શા શુણુ હતા ?

પાઠ ૬૮ મો.

પાંચ શારીર.

હેવુતગૃહમાં જાનયાંદું અને વિજ્ઞાનયાંદું નામના એ ભિત્તો હતાં

संक्षेपे कह अपना प्रस्तु नहीं होता, ज्ञानव्याद्वामां पुढ़ि बोली होती है जो विज्ञानव्याद् पहुँच हुथीयार होती, पाठ्याणामां सेवा साथे कर लाउता होता, विद्यागुड़े के बात समझता होते विज्ञानव्याद् तरह बहुत ही होती होते अने ज्ञानव्याद् असम्भव समझती होती, पहुँच पाठ्याणामांगी ऐसे आव्या पहीं ज्ञानव्याद् विज्ञानव्याद्वामी भासेथी वधु लाली होती होती।

ओह वधते पाठ्याणामां शुद्धे पांच शरीरने पाठ समलाल्यो, ते विज्ञानव्याद् समलु गये, पहुँच ज्ञानव्याद् गराणर समलयो नहीं, पाठ्याणामांगी ऐसे आव्या पहीं ज्ञानव्याद् अने विज्ञानव्याद्वामी वृद्धे नीचे प्रगाढ़े बातचित यह होती।

ज्ञानव्याद्—बाइ विज्ञानव्याद् ! आने पांच शरीरने पाठ भासायी ब्राह्मणो नहीं हो गने चेहेरधानी हरी समलाल, भने समां पहीं शंभाको रहे हैं, उपने ओह शरीर छाय, जो बात समलाल है, पहुँच पांच शरीर ही होते थाय ? ते भने समलाल,

विज्ञानव्याद्—बाइ ज्ञानव्याद् ! शरीर पांच लालनां छाय है, तेनां नाम १ आदारिक शरीर, २ वेदिय शरीर, ३ आहारक शरीर, ४ विज्ञान शरीर जो य तीर्थयु शरीर है, ते अधार शरीर होइ जुने ५ लाल लालां नहीं, पहुँच मुष्य पापना चोगने लड़ने हो शरीर यह शहे है, के ७२ आदारिक शरीरने चोप्य चोपा पुहगणो, जहाँ उहे हो ते चेहेहुँ आदारिक शरीर होइयाय हो अने के ७२ वेदिय शरीरने १२ तेना मुहगणो, १२ चोताना चातम प्रदेशी आये जिने के बीचुँ वेदिय शरीर होइयाय है, ते ये जातनां छाय हैं, एहे हो जान चलायी जाने बीचुँ लाली सभानी, वेदिय शरीरवा लालानां दूर विकुण्ठा है, जसादे दूर आदारक शरीरने चोप्य

એવાં પુરુષણો લઈ શરીર અનાવે તે ગ્રીઝું આહારક શરીર કહેવાય છે, તે આહારક શરીર એક હાથનું અને છે અને તેથું શરીર ચૈદ પૂર્વધારી સુનીએ કરો શકે છે જીવે અહુણું કરેલા ઓરાકને પચાવે તે ચૈદું તૈજસુ શરીર કહેવાય છે જે પચાવેલા આહારના રસના જુહા જુહા લાગમાં જુહી જુહી રીતે વેંહેચી પરિણુમાવે તે પાંચમું કાર્મણું શરીર કહેવાય છે.

જ્ઞાનચંદ્ર—લાઈ વિજ્ઞાનચંદ્ર ! હવે હું ખરાખર સમજુ ગયો, ઔદ્ઘારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાર્મણુ—એ પાંચ શરીર મારા મનમાં હુમેશાં યાદ રહેશે.

સારથોધ.

દરેક શ્રાવકે જ્ઞાનચંદ્ર અને વિજ્ઞાનચંદ્રની જેમ માંડિમાંહી પુછી સમજુતી લઈ પાંચ શરીરનું જ્ઞાન મેળવવું જોઈએ,

સારાંશ પ્રશ્નો.

૧ જ્ઞાનચંદ્ર અને વિજ્ઞાનચંદ્ર કોણું અને કેવા હતા ?

૨ શરીર ડેટલી જતનાં છે ? તેનાં નામ આપો.

૩ ઔદ્ઘારિક અને વૈક્રિય શરીર કેવાં હોય છે ?

૪ એક હાથનું કયું શરીર અને છે ?

૫ ઓરાકને પચાવવામાં કયું શરીર કામ કરે છે ?

૬ પચાવેલા આહારના રસને જુહી જુહી રીતે વેંહેચી આપે

તે કયું શરીર કહેવાય ?

પાઠ ડાં મો.

ધાર ઉપયોગ.

અમલિક કરીને બોટ ઢાકડી હતો, તે કરીયા જાહુ ગદ્વારાના કુષણો વળન ચાંદળાને ઉપાયથે હતો હતો. બોટ વખતે તે વખાણ ચાંદળી ઘેર જાઓયો. વારે તેના બાપાને તેને સુછયું કે, રમણીક ! જાને તું ઉપાયથેયી શું ચાંદળી જાઓયો ? તેણે કહુ, બાપા ! જાને તો ઉપાયથમાં ગરણઠ ખજુ થતી હતી. બોટને ચાંદ પાડાને ઉપયોગ ઉપયોગ બેના શરૂદો બોલાતા હતા. બાપા ! તે વખતે ઉપયોગ શરૂ કરેવાય છે, તેનું શું કરણું હુશે ? ઉપયોગનો અર્થ કોણ હતો હુશે ? તે મને સમજાવશો ?

તેના બાપાને કહુ, રમણીક ! ઉપયોગનો અર્થ ટોઝુકજ વાધતું હશે. તે મને હાડ સુછયું. ખીંચ બેદ્દો તો એટલુંજ સર્ગને છે કે, ઉપયોગ સણો જોઈલે ગરણઠ ચુંદી ચાંદળામાં ધ્યાન આપો—લો કે ઇટિયી જો અર્થ થાય છે, પણ તે ઉપયોગનો અર્થ અર્થેણ ખીંચે છે. તે તું ધ્યાન આપીને ચાંદળને, આપણામાં કે લુંબ છે, તેને ઉપયોગ હોય છે. કોણે ઉપયોગ હોય, તેજ લુંબ કે લેખાણ છે. તે ઉપયોગના ભાર પ્રકાર છે. લુંબમાં જાન, જાંતાન અને હૃદિન લેખ છે તેમાં જાન પાંચ પ્રધારે, જાંતાન બલું પ્રધારે અને હૃદિન ચાર પ્રધારે છે. બેની જીતે ભાર પ્રકારે ઉપયોગ થાય છે. કુષને જો ભાર પ્રકારના ઉપયોગમાં ટોઝુપણ બોટ કે વપારે ઉપયોગ હોય છે. જા ઉપયોગ સાંકાર તથા નિરાકાર ઇપ કરેવાય છે. ગતિ જાન, કુંત જાન, જાપણ જાન, અના પર્યાપ જાન અને રાધિય ગુરુ રામનાના જાન.

કેવળ જ્ઞાન—એ પાંચ પ્રકારનાં જ્ઞાન કહેવાય છે. ભતિ અજ્ઞાન ઝુલ અજ્ઞાન, અને વિલંગ જ્ઞાન—તે ત્રણું અજ્ઞાન કહેવાય છે. અક્ષુ હર્ષાન, અચ્કુ હર્ષાન, અવદ્ધિ હર્ષાન અને કેવળ હર્ષાન—એ ચાર પ્રકારનાં હર્ષાન કહેવાય છે. પાંચ જ્ઞાન, ત્રણું અજ્ઞાન અને ચાર દુર્શાન—એ બધા ભળીને ખાર ઉપયોગ કહેવાય છે. રમણિક ! આ ખાર પ્રકારના ઉપયોગનો સંખ્યા જીવની સાથે છે. ઐહેલાં પાંચ જ્ઞાન સંમક્ષિતને આશ્રીને કહેલાં છે; એટલે જ્યાં સંમક્ષિત હોય ત્યાં પાંચ જ્ઞાન હોય છે. અને ત્રણું અજ્ઞાન મિથ્યાત્વને આશ્રીને રહેલાં છે એટલે જ્યાં મિથ્યાત્વ હોય, ત્યાં ત્રણું અજ્ઞાન હોય છે.

રમણિક—ખાપા ! એ ખાર પ્રકારના ઉપયોગને માટે હું સંક્ષેપમાં સર્મજુ ગયો, પણ તે વિસ્તારથી કથારે સમજાવશો ?

પછી તને વિસ્તારથી સમજાવીશ. અલ્યારે તો એ ઉપયોગના ખાર પ્રકાર યાદ રાખજો.

રમણિક—ખાપા ! હાડું સારું, પછી સમજાવજો.



સારખોધ.

હરેક શ્રાવકના છોકરાએ રમણિકની જેમ એ ખાર ઉપયોગ યાદ રાખવા જોઈએ.



સારાંશ પ્રશ્નો.

૧ રમણિક કેવી છોકરા હુંતો ?

૨ ઉપયોગનો અર્થ બોકેનું જણું છે ?

૩ ઉપયોગનો અર્થ શો ?

- ૪ ઉપરોગન કેટાં હેઠાં હેઠાં હેઠાં ?
 ૫ ઉપરોગન કેટાં પ્રકારના હેઠાં ?
 ૬ જીવન કેટાં પ્રકારનું હે ?
 ૭ જીવન કેટાં પ્રકારનું હે ?
 ૮ જીવનના કેટાં પ્રકાર હે ?
 ૯ જીવનના એ લોઽ કણ હે ?
 ૧૦ ઉપરોગના બાર પ્રકારમાં ક્રમાંકિત જેને મિથ્યાત્મને આ
શીને કણ કણ પ્રકાર હે ?
-

પાઠ ૭૦ મો.

આડ કર્મ.

કોઈ પણ જતનું કામ કરવું, તે કરે કહેવાય છે. તે કરેના
જીવ પ્રકાર છે. જેનાથી પાંચ ઈન્દ્રિય તથા ભન વહે વસ્તુનું ખરું
જીવન યાય, તે ભતિજીવ કહેવાય છે, કેવું ભતિજીવ જે
જીવથી દેખાઈ લાય, તે ભતિજીવરણીય કરે કહેવાય છ.
ખાડ જાંબળજાંબથી કે જીવ યાય તે જીવ જીવ, તે જેના ૬.
દિવથી દેખાઈ લાય, તે જીવ જીવરણીય કરે કહેવાય છ.
ઉદ્દૂકો તથા માની જરૂરીયાત ચિવાય જ્ઞાનાથી હૃપી દ્રોષ ન
જીવમાં જારે તે જાણિ જાન, તે જેના ઉદ્યથી દેખાઈ લાય તે
જાણિ જીવરણીય કરે કહેવાય છે. જેનાથી જીવના ભનનો જીવ
જાણાય તે ભના એવું જાન, તે જેના ઉદ્યથી દેખાઈ લાય તે ભના;
જીવરણીય કરે કહેવાય છે. જેનાથી હૃપી જાણે જીવને જાણે

શ્રીમદ્ભગવાનું શ્રુતી શથું ગયો અને શુદ્ધતો ઉપષાર માની વાંચી
શુદ્ધી કરી પોતાને પર આવ્યો અને ખણી તરતાજ તેણે તેજ શુદ્ધ
નિની જાણે વીજા લીધી હતી. આથી જાણી ખર્દા પણ વહિન
એ ગણે હતી.

સારબોધ.

દેદે આવકે કર્મચારુની કેમ તે જાહ કર્મના દુકાં વચ્છપ જાળી
તેની જ્ઞાનલુટી મેળતવી કોઇઓ.

સારાંશ પર્યાય.

૧ કર્મચારુ કેવો આવક દતો ?

૨ કર્મચારુ શુદ્ધની આગળ કેવા યદ્ય કંદ્યા હતા ?

૩ જાહ કર્મના જુદા જુદા ગાખતા જાયો.

૪ જાન કરે નહિ, બધુ નિદ્રા જાવે, શરીરમાં હાથ ઉઠે,
કન્દખમં ઉપર જાડા ન રહે તથા શુદ્ધો વિનિરે બધુ જાવે,
શરીરમાંથી હુંનીપણ નાટે, કિસ્કું હુણાં જન્મ થાય, અને
પેંચો હતો આપી ન રાખાય, જોદું જુવસુ અને શાંખાં જાણ
શુદ્ધી જુવસુ તે બધા કષા કર્મના ગાખતા છે ? તે કહે.

પાઠ તૃતી મો.

તૈવીશ વિપય.

શ્રીમદ્ભગવાને રતિવારું જાણે કે મિળે હતા. સેણો કેવાંધા-
ણાં કાર્ય આવયાં હતા હતા. શ્રીમદ્ભગવાને જીવું સેણું મનત
કરો. અને રતિવારું જૈમતીશું જાણે ગાખતો હતો. રતિવારુની
આદી જાહરી હેઠળે હેતા વિષા તેણી ઉપર નાસુદી રહેતા

આ અશાતાવેદનીય કર્મનું એક જાતનું સ્વરૂપ છે. પછી સુનિઓ એક ચોથા આવકને ખોલાવીને પુછ્યું, આવકળા! તને શું થાય છે? તે ઓદ્યો મહારાજ! મને કોધ, માન, માયા, લોલ વિગેરે બહુજ પીડા કરે છે. અને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા રહેતો નથી. હું ડોઈ ડોઈ વાર મિથ્યાત્વીના દેવને સાતું છું. વળી ડોઈવાર મને ધણો ગુસ્સો આવી જાય છે. સુનિ ઓદ્યો—લાઈ કર્મચંદ્ર! જે આ મોહનીય કર્મનું સ્વરૂપ છે. પછી એક પાંચમા આવકને ખોલાવીને પુછ્યું કે, તારામાં શું છે? તે ઓદ્યો—મહારાજ! સારા શરીરમાંથી હુંધ છુટયા કરે છે. સુનિ ઓદ્યો—કર્મચંદ્ર! આ નામ કર્મના ધણો બેદ છે. પણ તે માંહેલું આ એક સ્વરૂપ છે. તેને અપ્રસ્તગંધ કહે છે. પછી છુંબા આવકને ખોલાવીને પુછ્યું કે, તારામાં શું છે? તે ઓદ્યો—મહારાજ! હું આવકનો ધર્મ માતું છું, પણ મારો જન્મ લિક્ષુક કુળમાં છે, સુનિ ઓદ્યો—કર્મચંદ્ર! જે આ ગોત્ર કર્મનું સ્વરૂપ છે. પછી સુનિઓ સાતમા આવકને ખોલાવીને પુછ્યું કે, તારામાં શું છે? તે ઓદ્યો, મહારાજ! હું પૈસાદાર છું, તે છતાં ડોઈને કાંઈ આપી શકતો નથી. સુની ઓદ્યો, કર્મચંદ્ર! જે આ અંતરાય કર્મનું એક સ્વરૂપ છે અને તે દાનાંતરાય કહેવાય છે. પછી સુનિઓ એક આડમા આવકને ખોલાવીને પુછ્યું કે તને શું છે? તે ઓદ્યો, મહારાજ! હું અને રામચંદ્ર સાથે એક દિવસે જન્મથાયી પણ એક જોશીઓ મારું આચુષ્ય પચવીસ વર્ષનું કહ્યું છે. અને રામચંદ્રનું પચાસ વર્ષનું કહ્યું છે. તેથી મને એવ થાય છે. શુરૂ ઓદ્યો જે, કર્મચંદ્ર! આ લાંખા કાળ સુધી અને થોડી સુદરત સુધી જે એક જાવમાં રેહલું તે આચુંકર્મ કહેવાય છે. આ અમારું સુનિઓ પૂર્ણદામાંથા આડ કર્મનું અત્યક્ષ્ય સ્વરૂપ જાતોંસું, તે જાણ્યી

કર્મચારુ એવો શુદ્ધી ધરું જયો અને શુદ્ધસો ઉપકાર ગાની લાંબી
શુદ્ધી ઘસે ખોતાસે પ્રેર જાઓયો અને પછી તરતાજ તેણે તેજ શુદ્ધ
નિની જાગે જીથા લીધી હતી. આથી ઘખો ખાંડા પણ વાદિત
ધરું જઈ રહ્યો.

સારથોધ્ય.

દેહ જાપણે કર્મચારુની લેમ તે આઠ કર્મના હુક્કાં વષ્ટ્ય જાણી
તેની સંગઠુતી ગેજવવી નેછાચો.

સારાંશ પ્રાનો.

૧ કર્મચારુ કેવો આવક હુતો ?

૨ કર્મચારુ શુદ્ધની આગળ કેવા પણ કર્યા હતા ?

૩ આઠ કર્મના શુદ્ધ શુદ્ધ દાખલા આપ્યો.

૪ જાન ચઢે નહિલ, એહુ નિદ્રા આવે, શરીરમાં શાદ ઉદે,
કેનપર્મ ઉપર શરીર ન રહે તથા શુદ્ધસો વિચેર નહુ આવે,
શરીરમાંથી હુંણ્ય હુદે, કિન્ફું કુળમાં જન્મ થાય, અને
મેણી હતાં આપી ન ચકાય, વોહું લષણું અને પણું કાળ
શુદ્ધી લષણું તે થથા કથા કર્મના દાખલા છે ? તે કહે.

પાઠ ૭૨ મો.

ત્રૈવીણ લિપય.

ત્રૈવીણ અને રત્નિવારુ જાતો જે મિથો હતાં તેણો કેતથા
જાણો કારે અભ્યાસ કરતા હતા. ત્રૈવીણ કે જાણે જેણું મનમ
સ્થાનો અને રત્નિવારુ મૌપદીયું જાન રાખતો હતો. રત્નિવારુની
જાણ નહાતી હું નોંધ તેના લિપય તેની ઉપર જારી રહેતા.

આ અશાતાવેદનીય કર્મનું એક જાતનું સ્વરૂપ છે. પછી સુનિએ એક ચોથા આવકને બોલાવીને પુછ્યું, શાવકળા! તને શું થાય છે? તે બોલ્યો—
 મહારાજ! મને કોઈ, માન, માયા, લોલ વિગેરે બહુજ પીડા કરે છે. અને
 જૈન ધર્મ ઉપર શ્રદ્ધા રહેતો નથી. હું કોઈ કોઈ વાર મિથ્યાત્વોના
 દેવને માનું છું. વળી કોઈવાર મને ધણ્ણા શુસ્ત્રો આવી જાય છે.
 સુનિ બોલ્યા—લાઇ કર્મચંદ્ર! જે આ મોહનીય કર્મનું સ્વરૂપ છે,
 પછી એક પાંચમા આવકને બોલાવીને પુછ્યું કે, તારામાં શું છે?
 તે બોલ્યો—મહારાજ! મારા શરીરમાંથી હુર્ઝ છુટ્યા કરે છે.
 સુનિ બોલ્યા—કર્મચંદ્ર! આ નામ કર્મના ધણ્ણા લેદ છે. પણ તે
 માંદેખું આ એક સ્વરૂપ છે. તેને અપ્રસ્તાગંધ કહે છે. પછી છફ્ટા
 આવકને બોલાવીને પુછ્યું કે, તારામાં શું છે? તે બોલ્યો—મહા-
 રાજ! હું આવકનો ધર્મ માનું છું; પણ મારો જન્મ બિક્ષુક કુ-
 ણમાં છે, સુનિ બોલ્યા—કર્મચંદ્ર! જે આ ગોત્ર કર્મનું સ્વરૂપ
 છે. પછી સુનિએ સાતમા આવકને બોલાવીને પુછ્યું કે, તારામાં
 શું છે? તે બોલ્યો, મહારાજ! હું ચૈસાદાર છું; તે છતાં કોઈને
 કાંઈ આપી શકતો નથી. સુની બોલ્યા, કર્મચંદ્ર! જે આ અંતરાય
 કર્મનું એક સ્વરૂપ છે અને તે હાનાંતરાય કહેવાય છે. પછી સુ-
 નિએ એક આડમા આવકને બોલાવીને પુછ્યું કે તને શું છે? તે
 બોલ્યો, મહારાજ! હું અને રામચંદ્ર સાથે એક દિવસે જન્મન્યા
 છીએ પણ એક જોશીએ મારું આચુષ્ય પચવીસ વર્ષનું કહું છે
 અને રામચંદ્રનું અચાસ વર્ષનું કહું છે. તેથી મને ઐદ થાય છે.
 શુરૂ બોલ્યા જે, કર્મચંદ્ર! આ લાંઘા કણ સુધી અને બોડી સુદત
 સુધી જે એક લખમાં રેહલું તે આચુષ્ય કર્મ કહેવાય છે. આ અમારું
 સુનિએ પર્બદ્ધામાંથા અઠ કર્મનું પ્રત્યક્ષ સ્વરૂપ અતાંથું, તે જાણું

કર્મચંદ્ર ધર્મા ખુશી થઈ ગયો અને શુરૂનો ઉપકાર માની લાંથી
ખુશી થતો પોતાને વેર આવ્યો અને પછી તરતજ તેણે તેજ સુ-
નિની પાસે શિક્ષા લીધી હતી. આથી બધી પર્ષદા પણ એકિત
થઈ ગઈ હતી.

—*—*—*— સારધોધ.

હરેક શાવકે કર્મચંદ્રની જેમ તે આઠ કર્મના દુંકાં સરૂપ જાહી
તેની સમજુતી મેળવવી જોઈએ.

—*—*—*— સારાંશ મર્નો.

૧ કર્મચંદ્ર કેવો શાવક હતો ?

૨ કર્મચંદ્રે શુરૂની આગળ કેવા પ્રશ્ન કર્યા હતા ?

૩ આઠ કર્મના જુદા જુદા દાખલા આપો.

૪ જીન ચડે નહિ, એહુ નિદ્રા આવે, શરીરમાં દાહ ઉઠે,
જેનધર્મ ઉપર શ્રદ્ધા ન રહે તથા શુસ્તો વિગેરે બહુ આવે,
શરીરમાંથી હુંઘ છુટે, બિક્ષુક કુળસાં જન્મ થાય, અને
પૈસો છતાં આપી ન શકાય, થોડું જીવનું અને ધણા કળ
સુધી જીવનું તે બધા કયા કર્મના દાખલા છે ? તે કહો.

—*—*—*— પાઠ ૭૨ મો.

ત્રૈવીશ વિષય.

શ્રીચંદ્ર અને રતિચંદ્ર નાસે એ ભિન્નો હતા. તેઓ જેનશા-
ળામાં સાથે અલ્યાસું કરતા હતા. શ્રીચંદ્ર જે લણે તેણું મનતન
કરતો અને રતિચંદ્ર પોપીયું જીન રાખતો હતો. રતિચંદ્રની
આવી નહારી ટેવ જોઈ તેના શિક્ષક તેની ઉપર નારાજ રહેતા

અને શ્રીચંદ્રમાં મનત કરવાની સારી એવ જોઈ તેની ઉપર તે ખુશી રહેતા હતા. એક વખતે પાંચ ઈંડિયોના વિષયની પરીક્ષા ચાલતી હતી. તે વખતે શિક્ષકે નીચેના એ સવાલો લખાવ્યા હતા—

એ અને ગ્રણુ વિષય કઈ કઢ ઈંડિયોના છે ?

આડ અને પાંચ વિષય કઈ કઢ ઈંડિયોના છે ?

આ સવાલના જવાબ શ્રીચંદ્રે તરત લખી આપ્યા અને તેમાં તે સારી રીતે પાસ થયો અને રતિચંદ્ર તે લખી શક્યો નહોં. તેથી નાપાસ થયો. રતિચંદ્રને તેના શિક્ષકે ધણેણ ઠપકો આપ્યો અને કંદું કે, જે હવે કરીવારની પરીક્ષામાં પાસ થશે નહોં, તો તને વર્ગની અહાર કાળી મુકવામાં આવશે.

આવી ધમકી સાંલળી રતિચંદ્ર ચિંતાતુર રહેવા લાગ્યો. પછી તેના મિત્ર શ્રીચંદ્રે તેને દીલાસે આપી કંદું કે, રતિચંદ્ર હુદેથી તું ખરાખર ધ્યાન ફંડું વાંચજો. રતિચંદ્ર એદયો, ભાઇ શ્રીચંદ્ર! મારે શી રીતે ધ્યાન ફંડું વાંચવું, તે ઉપાય અતાવ. શ્રીચંદ્ર એદયો—
ભાઇ! રતિચંદ્ર! જે વિષય આપણે શ્રીભવાને હોય, તેનો ખરાખર વિચાર કરવો અને તે આપણું મનમાં ડસાવી હેવો. રતિચંદ્રે કંદું શ્રીચંદ્ર !
હુદેથી હું તારા કહેવા પ્રમાણે કરીશ પણ પાંચ ઈંડિયોના ત્રેવીશ વિષયો. તેવી રીતે યાદ રાખવા તે સમજાવ. શ્રીચંદ્ર એદયો. ભાઇ
રતિચંદ્ર ! પહેલાં તો તારે નીચેની કવિતા યાદ રાખવી.

ચોપાદ્ય.

એ છે નાકે ગ્રણુ કાણ,

આંઝે જુલે પાંચસું કામ;

ચામડીના છે આડે જે,

ત્રેવીશ વિષયો સુધળા તે.

સારબોધ.

જ્યું વિજ્ઞયની જેમ દરશ અકારનું મિથ્યાત્વ સમજુને તે પ્ર-
માણું દરેક શ્રાવકે દર્તાહું. અને વિજ્ઞયની જેમ જે સાચું લગે
તેને છ્યારી રીતે આંગીકાર કરું.

સારાંશ પ્રાનો.

૧ જ્ય વિજ્ઞય ડાણું અને ડેવા હતા ?

૨ વિજ્ઞયે જૈન થવાને કેવી પ્રતિજ્ઞા લીધી હતી ?

૩ વિજ્ઞયની ઉપર કેટલા અકારનું મિથ્યાત્વ ઘડાંયું હતું ?

૪ વિજ્ઞય છેવટે કેવો થયો હતો ?

પાઠ ૭૪ મો.

જૈન શાસન વિષે કવિતા.

હરિગીત.

દિવમાં દ્યા ધરવા થકી જ્યાં સત્ય ધર્મ મનાય છે,
ઉપકાર કરવા ૧અન્યનો જ્યાં ૨પરમ પુણ્ય ગણ્યાય છે;
જ્યાં ધર્મ કેઢું મૂળ સહશુણું વિનય ગાજે ગર્વથી,
જ્યવંત છે આ જગતમાં હે જૈનશાસન સર્વથી. ૧

વખણ્યાય લારે વીરનો એ ધર્મ સધગા લોકમાં,
શ્રાવક કુળે અવતાર આંદો પુણ્ય કેરા થોકમાં;
પાખ્યા લાલો જિન ધર્મ તે સંતોષ ધરજો ધરવથી,
જ્યવંત છે આ જગતમાં હે જૈન શાસન સર્વથી. ૨

જ્યાં દેવ છે અરિહંત નિર્મળ વીતરાગ મહા પ્રભુ,
સુખકાર સુંદર શાંત જિનવર વિશ્વના નાયક ૩વિજુ;
તેને લાલો લાવ હુઃઅ હરવા વિષય સધગા ૪નેમથી
જ્યવંત છે આ જગતમાં હે જૈન શાસન સર્વથી. ૩

શું છે ? તે મને બતાવ. જય એદ્યો, લાધ વિજય ! અમારા શાસ્ત્રમાં દશ પ્રકારનું મિથ્યાત્વ કહેલું છે, તે બધું તને લાગુ પડે છે. વિજય એદ્યો, જે તું મારા ઉપર દશ પ્રકારનું મિથ્યાત્વ સાખીત કરે તો હું મારું મિથ્યાત્વ છોડી હક્ક અને તારો જૈન ધર્મ બદલ્યું કરું. જય એદ્યો, લાધ વિજય ! તું એક ચિત્તથી સાંભળજો. જીવ હોય, તેને અજીવ કરી જાણુવો એ પેહેલું મિથ્યાત્વ છે અને અજીવને જીવ કરી માનવો તે થીજું મિથ્યાત્વ છે. તું કાચા પાણીને જીવવાળું છતાં અજીવ જાણી વાપરે છે, એ તારું મિથ્યાત્વ છે. ધર્મને અધર્મ કરી જાણુવો, એ ત્રીજું મિથ્યાત્વ છે અને અધર્મને ધર્મ કરી માનવો એ ચોથું મિથ્યાત્વ છે. વિજય ! તું ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ કરી જાણું છે, માટે એ અને મિથ્યાત્વ તારામાં છે. સાધુને અસાધુ જાણું અને અસાધુને સાધુ જાણું—એ પાંચમું અને છુંઠું મિથ્યાત્વ છે. વિજય ! તું તેવીજ રીતે જાણું છે, માટે તારામાં પાંચમું અને છુંઠું મિથ્યાત્વ રહેલું છે. અરેખરા મોક્ષ માર્ગને અવળો માર્ગ જાણું અને વિષય સેવા ઇપ અવળા માર્ગને મોક્ષ જાણું તે સાતમું અને આઠમું મિથ્યાત્વ છે. વિજય ! તું પણ એવીજ રીતે નડારા માર્ગને મોક્ષ માર્ગ માને છે અને અરેખરા મોક્ષ માર્ગને નડારો માર્ગ માને છે, માટે તારામાં એ અને મિથ્યાત્વ રહેલાં છે. પવન વિશેરે ઇથી પદ્ધર્થને અદૃપી પદ્ધર્થ કહે અને મોક્ષ વિશેરે અદૃપી પદ્ધર્થને ઇથી કહે તે નવમું અને દશમું મિથ્યાત્વ છે. વિજય તું ! પણ તેવી રીતે માને છે, માટે એ દશે પ્રકારના મિથ્યાત્રે તારામાંજ ધરે છે, માટે હું તને ખરેખરા મિથ્યાત્વી કહું છું. જયનાં આવાં વચ્ચન સાંભળીને વિજયના મનમાં સારી અસર થઈ ગઈ. તરત તેણે જૈન ધર્મ સ્વીકાર્યો અને તે પ્રમાણે વતીને છેવટે તે એક સારો ગૃહસ્થ શ્રાવક થઈ પડ્યો.

સારાંશ અગ્રનો.

- ૧ શ્રીચંદ્ર અને રતિચંદ્ર ડાલ્ય અને કેવા હતા ?
- ૨ શિક્ષકે ઈદ્રિયેના વિષયેની પરીક્ષામાં કેવા સવારો કણાંયા હતા ?
- ૩ રતિચંદ્રને શિક્ષકે ડેવી ખમકી આપી હતી ? અને તે શાં માટે આપી હતી ?
- ૪ શ્રીચંદ્રે રતિચંદ્રને શો ઉપાય અતાંયો હતો ?
- ૫ પાંચ ઈદ્રિયેના કેટલા વિષયો છે ?
- ૬ તે વિષયો યાદ રાખવામાં પેહેલા કેવા આંકડા યાદ રાખવા લેધુંયો ?
- ૭ આડ, બે, પાંચ અને ત્રણુ વિષયો કઈ કઈ ઈદ્રિયેના છે ?
- ૮ રતિચંદ્ર ઝરીવારની પરીક્ષામાં કેવો ઉત્ત્યો હતો ?

પાઠ ૭૩ મે.

દશ અઙ્કારનાં મિથ્યાત્વ.

જ્ય અને વિજ્ય નામે એ મિશ્રો હતા. તેઓ જુદી જુદી જાતિના અને જુદા જુદા ધર્મના હતા. જ્ય શ્રાવકનો દીકરા હતો, અને વિજ્ય અન્ય ધર્મનીનો દીકરા હતો. જ્ય હમેશાં પોતાના મનમાં એવો વિચાર કરતો હતો કે, આ વિજ્યને હું શ્રાવકધર્મી કરી દોં. પણ, વિજ્યના મનમાં તે વાત ઉત્તરતી નહતી. એક વખતે જ્યે વિજ્યને મિથ્યાત્વી કહીને ઘોલાંયો, એટલે વિજ્યે કહ્યું, જ્ય ! તું મને મિથ્યાત્વી કેમ કહે છો ? મરામાં મિથ્યાત્વ

એહેલાં તો તું એ, નણુ, પાંચ અને આડ એ ચડતા આંકડા યાદ રાખજો. પછી તેમને ઈદ્રિયોની સાથે ગોઠવજો. સુગંધ અને હુંશુંધ એ એ નાક (શાણુદ્રિય) ના વિષયો છે. જીવ શખફ, અજીવ શખફ, અને મિશ્ર શખફ એ નણુ કાન (શ્રોકંદ્રિય) ના વિષયો છે. કણો, લીલો, પીળો, રાતો અને ધેળો એ પાંચ વિષયો આંખ (ચક્ષુદ્રિય) ના વિષયો છે. કડવો, કષાયેલો, ખાટો, મીઠો અને તીઝો એ પાંચ વિષયો જીબ (રસેંદ્રિય) ના છે અને સુંવાળો, ખરસડ, હળવો, ભારે, ટાહાળો, ઉનો, લૂઝો અને ચોપડયો—એ આડ વિષય ચામડી (સ્પેશેન્દ્રિય) ના છે. આ પ્રમાણે પાંચે ઈદ્રિયોના બધા મળીને ચેવીશ વિષયો થાય છે.

રતિચંદ્ર—ભાઈ શ્રીચંદ્ર ! હું બરાખર ઈદ્રિયોના વિષયો—સમનુ ગયો. આપણુ શિક્ષક ગમે તેવી પરીક્ષા લેશે, તો પણ હું હું નાપાસ નહિ થાઓ.

શ્રીચંદ્ર—રતિચંદ્ર ! આ પ્રમાણે બધા વિષયો વિચાર કરી શીખીશ તો તું કદિપણુ નાપાસ નહીં થા. છેવટે તને એટલું વળી કહેતાનું છે કે, આ ચેવીશ વિષયો તું બરાખર ગણીને ચાદ રાખજો.

રતિચંદ્રે શ્રીચંદ્રનો ઉપકાર માન્યો અને પણી તે ઈદ્રિયોના વિષયોની પરીક્ષામાં સારે નંબરે પાસ થયો હતો!.



સારબોધ.

દરેક છોકરાએ શ્રીચંદ્રની જેમ દરેક વિષય મનન કરીને ભાણુવો. રતિચંદ્રની જેમ પોપટીયું જાન રાખલું નહીં. કોઈ આપણુને સારે બોધ આપે તો તે બોધ કેવો અને તે પ્રમાણે વર્તલું. તેમ કરવાથી જેમ રતિચંદ્ર શ્રીચંદ્રનો બોધ લઈને સુધરી ગયો, તેમ સુધરી જવાય છે.



